

Super Visa/ Visitor to Canada Insurance



- Best Mortgage Rates
- 1st and 2nd Mortgages
- Life and Critical Illness Insurance
- RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth  
Financial Advisor  
www.pyramidfinancial.ca  
mukund@pyramidfinancial.ca

Serving at 2 locations  
GTA East / GTA West ON LIC # 10530  
Investment | Insurance | Mortgages

परदेशां देशनी महेंक अटले



# स्वदेश

केनेडाथी प्रसिद्ध थतुं सर्वोत्तम गुजराती साप्ताहिक SWADESH



डेल्ताथी 96 देशां फ़ड्डाट :  
आफ़्साथी दुनिया प्रभावित

PAGE NO. 18

FRIDAY, 02 JULY, 2021 Vol. 18, No. 27 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

# हीट डोमनी आग ओकती गरमी केनेडामां 500नां मोत

अमेरिकाना ओरेगोनमां 10थी वधु मोत, सिअेटल सखितनां शहेरोमां पारो 46 डिग्रीने पार

हीट डोमनी आग ओकती गरमीमां केनेडा अने उत्तरपश्चिम अमेरिकामां हाडाकार मयी गयो छे. केनेडाना ब्रिटिश कोलम्बियामां अचानक थतां मोतनी संध्यामां १८५ टकानो उछाणो ज़ोवा मण्यो छे. ब्रिटिश कोलम्बियाना थिफ़ कोरोनेर विसा लेपोर्णन्टे ज़े ज़ेप्राव्युं डतुं के, अर्डी छेल्वा पांय दिवसमां काणजण गरमीना कारछे मृत्यु पामनारानी संध्या ४८६ पर पछोथी गछे छे. ज्यारे आभा देशमां गरमीने कारछे अंदाजत 500थी वधु लोकोना मोत थया छे. ब्रिटिश कोलम्बियाना लिट्टोन गाममां केनेडाना र्थितिसनुं सौथी वधु ४८.६ डिग्री सेन्टिग्रेड तापमान नोधाता आसपासना जंगलोमां दावानण झटी नीकणतां गामने भावी करावायुं डतुं. प्रोविन्सना सौथी मोटा शहेर वानकुंवरमां घरमां ऐसीना अभावे लोको नासीने डडिनडाडिननी डोटेलोमां ऐसी ओरडाओमां आश्रय लछे रछां छे. जेना कारछे डोटेलोमां लांभी कतारो लागी रछी छे. डोटेलोमां अेक ओरडानो अेक नाईटनो भाव २००० केनेडियन डोडर बोलाई रछो छे. शहेरमां वीजणीनी माग ओलटाईम डड ६०० मेगावोट करतां वधी गछे छे.



## केनेडामां सर्वोच्च तापमाननो नवो विक्रम ब्रिटिश कोलम्बियाना लिटनमां नोधायो

वानकुंवर : केनेडामां सौथी वधु तापमाननो विक्रम मात्र २४ कलाकमां १ जीजुवार सर्जयो ज्यारे ब्रिटिश कोलम्बियाना लिटन भाते सोमवारो ४७.५ से. तापमान नोधायुं हतुं. जे अगाडि रविवारे अे ४६.१ से. हतो. आ आंकडा अेन्वायरन्मेन्ट केनेडाअे आधा हता. आ अगाडि केनेडामां सर्वोच्च तापमाननो विक्रम ८० वर्ष पहेला सास्केचवान भाते नोधायो हतो. लिटननी सोमवारनी गरमीअे लास वेगासना सौथी वधु तापमानना ४७.२ से.ना विक्रमने पछा पार करी दीधो हतो. जे युअेस नेशनल वेधर सर्विसना ज़ेप्राव्युं मुण्ण नेवाडा सिटीमां नोधायो हतो. डिटेवेवने कारछे पंजाओ अने अेर कंडीशनरनो डिपयोग वधयो हतो अने घरां लोकोअे कोन्डो अने अेपार्टमेन्टमां भाते अेफ़ारानो अने परसेवाथी रेअेज्ज थवानो अनुभव कर्यो हतो. वानकुंवरमां सुटोन प्लेसमां विकेन्डना घसारांने पछोथी वणवा वधाराना स्टाङ्गनी १३२ पडी हती. डोटेवना सेल्स मेनेजर सीन हचिसने कहुं हतुं के, अमने आतुं थशे अेनी कोर्ष आगतरी ज़ाणकारी नहोती. अेटवे अमे आवी स्थिती माटे तैयार नहोता. डिटेवेव डरमियान ब्रिटिश कोलम्बियाना र्थिमन्टन्सी सेवाओने सौथी वधु ८११ कोल मण्यो हता.

## पारो 49 डिग्रीने पार



१००० वर्षे अेकाड वपत अननारी घटना अत्यारे केनेडामां हाडाकार मयावी रछी छे. गया शुक्रवारथी मंगलवार सुधीमां केनेडाने रीतसर शेकी रछेवी भयानक गरमीना कारछे १३४ लोको मृत्यु पाम्या हता. मोटी संध्यामां लोको गरमीना कारछे अचानक मृत्यु पामी रछां छे. १००० वर्षमां केनेडाअे ४८.५ डिग्री सेन्टिग्रेड गरमी कडी जेध नथी.

**हीट डोम क्यं सुधी यालशे?**  
निष्ठातोने अंदाज छे के आवा हीट डोम अेक अडवाडिया सुधी याले छे, पछी विपरावा लागे छे. डर वपते आग घटना कम रहे छे.

**गरमी शा माटे वधी गछे छे?**  
वातावरण साथे आपछे करेला रेडांजा परिणामे अचानक वायुअो चारैणावुथी केनेडा डिपर पारदर्शी डोमरूपी टांकण अनावीने वही रछा छे. गरमीने केड करी लीधी छे. तेना कारछे पारो भयानक हडे वधी गयो छे.

**अरेपर हीट डोम गुं होय छे?**  
गरम पवननो प्रवाह डिचे चटया पछी आसपास प्रसरवाने अडेले लहेरिया लेतो डिपर-नीचे थवा लागे अने डिपरना भागे पछा भयानक गरम पवनो लहेरियां लेता रहे पछा डेलाय नहो, तो हीट डोम रचाय छे. अे विस्तारनी गरमी क्यंय जध १ शकती नथी.

**१००० वर्षमां अेकाडवार आतुं अने छे?**  
कुडरती रीते १००० वर्षमां अेकाड वपत १ आतुं अने छे. जेके हवे आपछे हवामान अेटतुं गरम कर्युं छे के थोडां वर्षमां करी अनी शके.

## मार्गो पर कुवारा लगावाया

केनेडाना पर्यावरण विभागे अेलर्ट जारी कर्युं हतु. जेमां ज़ेप्राव्युं हतु के, लांभा समय सुधी अतरनाक गरमीनी लहेर आ अडवाडिये पछा जारी रछेशे. युअेस नेशनल वेधर सर्विसे पछा कहुं के, लोको डंसां स्थणोअे रहे. गरमीने कारछे वानकुंवरमां स्कुलो अने वेक्सिनेशन केन्द्रो अंध करी देवायां छे. पोर्टलेन्डमां ज़ाहेर परिचलन अटकावायुं छे. ऐसीवाणा सिनेमान होल कुल छे अने मार्गो पर पाणीना कुवारा लगावाया छे. लोको अर्डी लीना थर्ष शके छे. अर्डी केटलाक घरमां अेर कन्डिशनर नथी. अेवामां सरकाटे कुलिंग सेन्टर अनाव्यां छे जयां लोको रात वितावी शके छे. स्विमिंग पूल परना कोविड प्रतिबंध हटावी लेवाया छे.

**SUPER VISA INSURANCE**

Get Full REFUND if visa is declined  
Get partial refund if parents leave early\*  
\*conditions apply.... Ask NOW for a free quote..



Sanjiv Puri  
Insurance Broker  
Ph.: 416-890-3232  
Email: sanjivpuri@rogers.com

StarLife  
Insurance & Investments Inc.  
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE  
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

छेल्वा ४४ वर्षथी टैरान्टोनी सर्व प्रथम गुजराती ट्रावेल अेजन्सी. ४४ वर्षथी गुजराती प्रज्ज अने गुजराती भाषा अमारी सङ्गता माटे यज्ञभागी छे. दिखथी आपनी अमे भूज आभार मानीअे छीअे. इवाई मुसाकरी नी टीकीट माटे अमारा भाव टैरान्टोमां भूज आकर्षक छे अजमावी ज़ुअी... आपने आनंद थसे.

**Ashok Travels 416-977-9896** अशोक ट्रावल्स ४१६ ९७७ ९८९६

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

**www.ashoktravel.com**  
Ashok Travels Serving your travel needs in Canada since 1973  
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

Residential  
New Condos  
Investments  
Commercial

दुआमां याह राणशो

**Zakir Patel**  
Broker

Cell: 416-561-7973  
Office : 416-287-2222

RE/MAX  
COMMUNITY  
Realty Inc., Brokerage

Independently Owned and Operated  
1265, Morningside Ave. #203  
Toronto, ON M1B 3V9  
Email : patelzakir82@gmail.com

**SS & LAWYERS LLP**

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

**Avni Shah**  
B.A., JD  
Barrister & Solicitor

ashah@sslawyers.ca  
Tel : 416-818-4000  
Fax : 416-740-4002







# બ્રિટીશ કોલંબિયાની શાળા પાસેથી ૧૮૨ અજાણી કબરો મળી

કેટલાક અવશેષો માત્ર ત્રણ ચાર ફૂટની ઉંડાઈવાળી કબરોમાં દફન કરાયેલા હતા: પખવાડિયા પહેલા બાળકોના કંકાલ પણ મળ્યા હતા

વાનકુવર : બ્રિટીશ કોલંબિયાની બીજી એક મૂળ જાતિએ એવો દાવો કર્યો છે કે, જમીનની અંદર જઈને શોધનારા ૨૬૨માં એક જુની નિવાસી શાળા નજીકથી માનવ અવશેષો મળી આવ્યા છે. લોવર કૂટેની બેન્ડ બુધવારે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કુલ ૧૮૨ વ્યક્તિઓના અવશેષો અજાણી કબરોમાંથી મળી આવ્યા હતા. કેનબ્રુકમાં આ જગ્યાએ પહેલા સેન્ટ યુજેન્સ મિશન સ્કુલ હતી. નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, એકવામ જાતિએ ૨૦૨૦માં તપાસ શરૂ કરી હતી. આ નિવાસી શાળા ૧૯૧૨થી ૧૯૭૦ના દાયકા સુધી ચાલતી હતી. કેટલાક અવશેષો માત્ર ત્રણ ચાર ફૂટની ઉંડાઈવાળી કબરોમાં દફન કરાયેલા હતા. નિવેદનમાં એમપણ જણાવવામાં આવ્યું હતું કે, લોવર કૂટેની બેન્ડ એ ટુનાકસા નેશન બેન્ડનું સભ્ય છે. ઘણાં લોવર કૂટેની બેન્ડના સભ્યોને



આ મિશન સ્કુલમાં જબરદસ્તીથી મોકલવામાં આવતા હતા. આ પહેલા એક માસ અગાઉ ટીકમ્લપ્સ ટે સિક્વેપેમ્ક ફર્સ્ટ નેશને એવી જાહેરાત કરી હતી કે, કામલૂપ્સની એક નિવાસી શાળા નજીકથી ૨૧૫ બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. જેના એક અઠવાડિયા બાદ કોવેસેસ ફર્સ્ટ નેશને કહ્યું હતું કે, ૭૫૧ અજાણી કબરો સાર્કેઝવાનની એક નિવાસી શાળા નજીકથી મળી આવ્યા હતા. ફર્સ્ટ નેશન, ઈનુઈટ અને મેટીસના ૧૫૦૦૦ બાળકો આવી નિવાસી શાળાઓમાં ભણતા હતા. બાળકોના પરિવારોએ બળજબરીથી એમના બાળકોને ભણાવવાનો વિરોધ કર્યો હતો. જેની નોંધ આરસીએમપીએ લીધી હતી. આ શાળાઓ નબળી સ્વચ્છતા, બિન આરોગ્યપ્રદ આહાર, વધુ પડતા વિદ્યાર્થીઓની સંખ્યા અને આકરી સજાઓ માટે જાણીતી હતી.

## ટોરોન્ટોએ જુલાઈ માટે કોવિડ વેકસીનની ૩૭૫૦૦૦ એપોઈન્ટમેન્ટ્સ જાહેર કરી

ટોરોન્ટો : ધી સિટી ઓફ ટોરોન્ટોએ કહ્યું હતું કે, તેઓ નવી ૩૭૫૦૦૦ વેકસીનેશન એપોઈન્ટમેન્ટ્સ આવનારા ત્રણ અઠવાડિયામાં ખુલ્લી મુકશે. જે પાંચમી જુલાઈથી શરૂ થશે અને એને માટે બુકિંગ મંગળવારે સવારે ૮.૦૦ વાગ્યાથી શરૂ થશે. નવા સ્પોટ્સમાં મોટાભાગે ઓન્ટેરિયોવાસીઓનો સમાવેશ થશે. જેઓ વેકસીનના બીજા ડોઝ માટે લાયક હશે. ૧૮ વર્ષથી વધુ વયના કોઈપણ નાગરિક જેમણે ફાઈઝર કે મોર્ડના વેકસીન ૨૮ દિવસ પહેલા લીધી હોય તેઓ બીજા ડોઝ માટે એપોઈન્ટમેન્ટ બુક કરાવી શકશે. ટોરોન્ટોમાં ૧૨ વર્ષથી વધુ વયના કોઈ પણ નાગરિક માટે વેકસીનનો બીજો ડોઝ ઉપલબ્ધ છે. સોમવારની સવારથી જ તેમને ડોઝ મળી શકશે. જો તેમણે નિર્ધારિત સમય પહેલા વેકસીનનો પહેલો ડોઝ લીધો હોય તો તેઓ ડોઝ લઈ શકશે એમ સોમવારે અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. દરમિયાનમાં હજારો વોલિયન્ટર્સ ૨૭૦૦૦ કોવિડ-૧૯ વેકસીનના ડોઝ ટોરોન્ટોના મોટા ક્લિનિકોમાં પહોંચાડી રહ્યા છે.

આ સેન્ટરે ટોરોન્ટોમાં એક જ દિવસે સૌથી વધુ વેકસીન ડોઝ આપવાનો વિક્રમ રવિવારે નોંધાવ્યો હતો. જે ટોરોન્ટોમાં રવિવારે અપાયેલા કુલ ૬૨૮૯૭ ડોઝના અડધાથી વધુ હતા. જેમાં ૫૭૮૨૫ બીજા ડોઝની હતી. જયારે ૫૦૭૨ પહેલા ડોઝની હતી. ટોરોન્ટોના મેપલ લીફ્સ અને ટોરોન્ટો રેપોર્ટ્સ ખાતે યોજાયેલી અવર વિનીંગ શોટ 'ઈવેન્ટમાં જે ૨૬૭૭૧ લોકોએ ભાગ લીધો હતો. એમાં ટોરોનો પણ સમાવેશ થાય છે. આ ક્લીનિકે સાંજે



### પાંચમી જુલાઈથી બુકિંગ સુવિધા સવારે 8.00 વાગ્યાથી શરૂ થશે

૫.૦૦ વાગ્યે નોર્થ અમેરિકાના ૧૭૦૦૩ ડોઝ એક જ દિવસમાં એક ક્લીનિકના વિક્રમને પાર કર્યો હતો.

ટોરોન્ટોનું આ ક્લીનિક મોડી સાંજ સુધી ચાલુ રહ્યું હતું અને વોક ઈન એપોઈન્ટમેન્ટ પણ ચલાવી હતી. પુખ્ત વયનાઓને મોર્ડના વેકસીન અપાઈ હતી. જયારે ઓછી વયનાઓને ફાઈઝરની વેકસીન આપવામાં આવી હતી. ટોરોનો જણાવ્યા મુજબ આ ઈવેન્ટમાં ૮૦૦ કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. અત્યાર સુધીમાં ટોરોન્ટોમાં વાઈરસના ૧૬૯૭૩૫ કેસ અને ૩૫૨૨ મોત નોંધાયા છે.

## યુનિવર્સિટી ઓફ વોટરલુ કેમ્પસમાં ડ્રાઈવર વિનાની શટલ બસ દેખાશે

ટોરોન્ટો : યુનિવર્સિટી ઓફ વોટરલુના વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં ડબલ્યુએટીઓનો બસ નામની અદ્યતન અને ડ્રાઈવર વિનાની શટલ બસમાં સવારી કરી શકશે. આ સિસ્ટમ ઓન કેમ્પસ વિકસાવવામાં આવી છે અને એ સૌથી પહેલી સ્વયં સંચાલિત શટલ બસ કોઈ પણ કેનેડીયન યુનિવર્સિટી માટે ગણાશે. આ બસમાં ૩૬૦ ડીઝીલ કેમેરા

બસમાં ૩૬૦ ડીઝીલ કેમેરા અને લાઈટ ડીટેક્ટીંગ અને રેંગીંગ (એલઆઈડીએઆર) સિસ્ટમ હશે, જે કોઈ રાહદારી રસ્તો ઓળંગતો હોય તો એ જોઈને અટકી જશે. જો કે, એનું સંચાલન નજીકની લેબમાંથી થશે. પ્રાયોગિક ધોરણે એક બેકઅપ ડ્રાઈવર રાખવામાં આવશે. જે સલામતી રૂપે કામ કરશે. ટૂંક સમયમાં જ આ શટલનો ટેસ્ટ રન થશે એમ ટેકનીશિયન એરોન શેરાટે કહ્યું હતું, જે હાલમાં બેકઅપ

ડ્રાઈવર તરીકે શટલમાં રહે છે. ટ્રાયલ રનમાં બસ ૨.૭ કિ.મી.નું અંતર પાંચ સ્ટોપેજ સાથે પૂર્ણ કરી શકી હતી, જે યુનિવર્સિટી રીંગ રોડ ઉપર છે. હાલમાં એની ઝડપ કલાકના ૨૦ કિ.મી.ની છે. મિકેનિકલ એન્જનીયરીંગના પ્રોફેસર અમીર ખાજેપોરે કહ્યું હતું કે, આ શટલ સેવા પાનખર સુધીમાં શરૂ થઈ શકે એવી આશા તેઓ રાખી રહ્યા છે. ડબલ્યુએટીઓનો

બસ એ પ્રાંતના સ્વયં સંચાલિત વાહનોનો પાઈલટ પ્રોજેક્ટનો હિસ્સો છે. જે ડ્રાઈવર વિહોણા વાહનોના પરિક્ષણનું કામ કરે છે. આ સેવા નિયમિત શરૂ કરતા પહેલા ઘણાં પરિક્ષણો કરવા પડશે. ત્યારબાદ આ ટેકનોલોજીનો ઉપયોગ કિચનેર વોટરલુને ઓટોનોમસ ટ્રાન્સપોર્ટેશનનું હબ બનાવવામાં થશે. જેનો ઉપયોગ સીટી બસ સેવા તરીકે પણ કરી શકાશે.

## ટોરોન્ટોમાં ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીની ઉનાળા સીઝન પણ નિયંત્રણ હેઠળ પસાર થશે

આંતર રાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધો અંગે સરકાર સમક્ષ વિવિધ સેક્ટરના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત

ટોરોન્ટો : ટોરોન્ટોના ટૂરિઝમ સેક્ટરના આગેવાનો એવી ચેતવણી ઉચ્ચારી રહ્યા છે કે, સરકારે વિદેશ પ્રવાસ માટે કેનેડામાં છૂટ આપવાનો ઈન્કાર કર્યો હોવાથી સતત બીજા વર્ષે પણ કોવિડ-૧૯ મહામારીને કારણે એમનો બિઝનેસ જોખમમાં મુકાઈ શકે છે. સરકાર સમક્ષ રજૂઆત કરવા ગયેલા પ્રતિનિધિમંડળમાં રીપ્લે'સ એકવેરિયમ, મિર્વિસ પ્રોડકશન, હિલ્ટન હોટેલ્સ અને ટોરોન્ટો રીજિયન બોર્ડ ઓફ ટ્રેડના સભ્યો હતા. તેમણે મંગળવારે સવારે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, વર્તમાન પ્રતિબંધોને કારણે તેમના બિઝનેસ પર અવળી અસર પડશે. કેમ કે, એનો બધો આધાર પ્રવાસીઓ પર રહે છે. મિર્વિસ પ્રોડકશનના ડીરેક્ટર ઓફ સેલ્સ એન્ડ



માર્કેટીંગ જોન કારાસ્ટામેટીસે કહ્યું હતું કે, ઉનાળાની મોસમમાં એમના થીયેટરમાં આવનારા પ્રેક્ષકોના ૫૦ ટકા તો અમેરિકાથી આવતા હોય છે. ટૂરિસ્ટોને કારણે થનારી આવક જો બંધ થઈ જાય તો એ પોતાનું કામ કેવી રીતે આગળ વધારી શકે. જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઉપરના પ્રતિબંધો હટાવી ન લેવાય ત્યાં સુધી આ પ્રોડકશન હાઉસ તેનું કામ શરૂ નહીં કરી શકે. કેનેડા અને અમેરિકા વચ્ચેની સરહદ બિનઆવશ્યક પ્રવાસ માટે માર્ચ ૨૦૨૦થી બંધ છે. છેલ્લા થોડા મહિનાઓથી પ્રતિબંધો હળવા કરાવવા માટે સરકાર પર ભારે દબાણ

પણ થઈ રહ્યું છે. ફેડરલ સરકારે કહ્યું છે કે, જેમણે વેકસીનના બંને ડોઝ લીધા હોય એવા કેનેડીયનો પાછા ફર્યા બાદના ૧૪ દિવસના ફરજિયાત ક્વોરન્ટાઈનની શરતે પ્રવાસ કરી શકે છે. જેનો આરંભ પણ પાંચમી જુલાઈ બાદ શક્ય છે. આ નિયમો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે લાગુ પડશે કે નહીં એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. સરહદના પ્રતિબંધોની મુદત ૨૧મી જુલાઈએ પૂર્ણ થાય છે અને લંબાવવામાં આવશે કે નહીં એ પણ હજુ જાહેર કરાયું નથી. એવા સંજોગોમાં ટૂરિઝમ સેક્ટર પરની અસર હજુ કેટલો સમય રહેશે એ પણ સ્પષ્ટ નથી.

## ISISના કેમ્પમાંથી મહિલાને મુક્ત કરાવી બાળકી સાથે મેળાપ કરાવ્યો

ઓન્ટેરિયો

ઉત્તર-પૂર્વ સિરીયાના આઈઆઈએસના ડીટેન્શન કેમ્પમાંથી એક કેનેડીયન મહિલાને ભૂતપૂર્વ અમેરિકન રાજપુરુષની મદદથી છોડાવીને પોતાની ચાર વર્ષીય પુત્રી સાથે મુલાકાત કરાવાઈ હતી. આ અંગે પીટર ગેલબ્રેથે મીડિયાને જણાવ્યું હતું કે, આ વાતને હું સમર્થન આપું છું અને એ સાચું છે કે, હું એને બહાર લાવ્યો હતો. આ અત્યંત ખાનગી પહેલ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એ મહિલા તુર્કી અને ઈરાકની સરહદે આવેલા અલ રોજા કેમ્પમાંથી મુક્ત થયા બાદ ઉત્તર ઈરાકની નજીકના એબ્રિલમાં આવી હતી. કેમ્પમાં આઈએસઆઈએસ સમર્થિત ૭૦૦ પરિવારો રહેતા હતા. જે કુદર્શિ આગેવાની વાળા સિરીયન ડેમોક્રેટિક ફોર્સિસના તાબામાં છે

અને ઉત્તર અને પૂર્વ સિરીયામાં સ્વયંભૂ શાસન ચલાવી રહ્યા છે. આ મહિલા એવી ૩૦ કેનેડીયનો પૈકીની એક છે, જેમાં વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે અને એ પહેલી મહિલા હશે જે ત્યાંથી છૂટી હોય. ગ્લોબલ અફેર્સના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઈ કેનેડીયન નાગરિકે સિરીયા અને ઈરાકની સરહદ પાર કરીને ઈરાકમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે, એમાં કેનેડાની સરકારની કોઈ ભુમિકા નહોતી, એમ પ્રવક્તા પેટ્રીસીયા સ્કીનરે મીડિયાને જણાવ્યું હતું.

આ બાબત ગોપનિય હોવાથી આ વિશે કોઈ વધુ માહિતી તે આપી શકે એમ નથી. એક મહિલાની મુક્તિને કારણે અન્ય કેનેડીયન મહિલાઓ જે એ કેમ્પમાં છે અને બાળકો સાથે રહે છે તે પણ સવાલો પુછી શકે છે.

કેમ્પમાં વસવાટ દરમિયા મહિલા વેસ્ટર્ન ડ્રેસ પહેરતી અને આદેશોનો ગણકારતી ન હોવાથી તેને માથે વધુ જોખમ રહેતું હતું



# કેનેડામાં ૨૦૩૫ સુધીમાં ઈલેક્ટ્રીક વાહનો દોડશે

કાર અને લાઈટડ્યુટી વાહનોને કારણે થઈ રહેલું પ્રદૂષણ રોકવાનું લક્ષ્ય

ઓન્ટેરિયો : કેનેડાની લિબરલ સરકારે મંગળવારે જાહેર કર્યું હતું કે, એ હવે કેનેડામાં વેચાનારા બધા લાઈટ ડ્યુટી વાહનો ઈલેક્ટ્રીક સંચાલિત હોય એના માટેનું ઝડપી લક્ષ્ય નક્કી કરે છે. ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર ઓમર અલ્લાખાએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૩૫ સુધીમાં કેનેડામાં વેચાનારી બધી કાર અને લાઈટ ડ્યુટી ટ્રકસ ઈલેક્ટ્રીકથી ચાલનારી હશે. એટલે કેનેડામાં વાહનોથી થતું એમિસન શુન્ય થઈ જશે. આ પહેલા સરકારે ૨૦૪૦ના વર્ષનું લક્ષ્ય નક્કી કર્યું હતું અને પેટ્રોલિયમથી ચાલનારા વાહનોને બદલે ઈલેક્ટ્રીકથી ચાલનારા વાહનો જ કેનેડામાં બને એવું કરવાનું હતું. પણ હવે એ લક્ષ્યને પાંચ વર્ષ વહેલું પૂર્ણ કરી લેવાનું ઠરાવ્યું છે. અલ્લાખાએ પેરીસ સ્થિત ઈન્ટરનેશનલ



એનર્જી એજન્સીના અહેવાલને ટાંકતા કહ્યું હતું કે આ લક્ષ્ય વર્ષ ૨૦૩૫ સુધીમાં હાંસલ થઈ શકે છે. સદીના મધ્ય સુધીમાં તો ઈલેક્ટ્રીકથી ચાલનારા વાહનો આવી જવાથી નેટ ઝીરો એમિસનનું લક્ષ્ય હાંસલ કરી શકાશે. ૨૦૫૦ સુધીમાં તો કેનેડા એના અર્થતંત્રમાંથી ગ્રીનહાઉસ

ગેસ એમિસનને નાબુદ કરશે અથવા અન્ય રીતે પણ ક્લાઈમેટ ચેન્જમાં મહત્વના ગણાતા ડ્રાઈવિંગને કારણે ફેલાતા વાયુ પ્રદૂષણને નાથવા કડક પગલા લઈ શકાશે. કેનેડામાં પેસેન્જર કાર અને લાઈટડ્યુટી વાહનોને કારણે પ્રદૂષણ વધતું હોવાથી એને ઈલેક્ટ્રીક સંચાલિત કરવાની પહેલ કેનેડાએ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, અમારો લક્ષ્યાંક વધુ પડતો આશાવાદી છે, પણ એ પાર પડવો જ જોઈએ. એને માટેના તમામ પ્રયાસો થવા જોઈએ. સરકારે આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે અત્યાર સુધીમાં ૬૦૦ મિલિયન યુએસ ડોલરનો ખર્ચ કરીને લોકોને ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા માટેની આર્થિક સહાય પણ ઓફર કરી છે. સરકાર હજુ વધુ પ્રોત્સાહનો ખરીદનાર અને વેચનારને આપવા માંગે છે, જે ખરીદનારને ૫૦૦૦ યુએસ ડોલર અને વેચનારને ૨૫૦૦ યુએસ ડોલર જેટલી હશે. જો કે એને માટે વધુ નાણાની પણ જરૂર પડી શકે છે. એ રીતે જ ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનને વેગ આપવા માટે પણ યોજના બનાવવામાં આવી છે.

## બ્રામ્પટનમાં બે સિનિયર સભ્યોને વિદાયમાન

ઓન્ટેરિયો : બ્રામ્પટનની સીનીયર્સ સીટીઝનના લોકલાડીલા કલાકાર વિમાર્બન તથા હસમુખભાઈ મહેતા, કેનેડા છોડી તેમના પરિવાર સાથે ડલાસ, યુ.એસ.એ જઈ રહ્યા છે. આ પ્રસંગે વિક્રમભાઈ પટેલએ તે બંનેનું સરસ મજાના બુકેથી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત તેઓએ આ કલાકારોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે પ્રમુખે દુઃખ અને સુખ એમ મિશ્ર ભાવ પદર્શિત કર્યા હતા. જે બાદ વિમાર્બન તથા હસમુખભાઈ મહેતાએ પોતાની યાદગીરીના સંભારણા નિમિત્તે, સર્વો સિનિયર્સ મિત્રો માટે પરમેશભાઈ તથા હાર્ટ નાન્દીના મ્યુઝીકલ પ્રોગ્રામનું આયોજન ૨૬મી જુન ૨૦૨૧ના રોજ કર્યું હતું. આ હિન્દી ફિલ્મી ગીતોના પ્રોગ્રામમાં પ્રમેશભાઈ નાન્દીએ જુના હિન્દી ફિલ્મી ગીતો તથા હાર્ટ નાન્દીએ નવા હિન્દી ફિલ્મી ગીતો રજુ કર્યા હતા. પ્રમેશભાઈએ ખૂબ મહેનત કરીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. હસમુખભાઈ મહેતાએ ગરવી ગુજરાત સિનિયર્સ ગ્રુપના પ્રમુખ વિક્રમભાઈ પટેલનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. વિક્રમભાઈએ પણ પ્રાસંગિક પ્રવચન કરી અને કલાકારોનો આભાર માન્યો હતો. સંસ્થાના વાઈસ પ્રેસીડન્ટ વત્સલાબેન



વ્યાસનું પણ આ કલાકાર બેલડીએ શાલ ઓઢાડી સન્માન કરી સન્માન પત્ર આપ્યું હતું.

આ ઈવેન્ટમાં પ્રમેશભાઈએ દિલ ખોલીને પ્રોગ્રામ આપ્યા અને સૌ સિનિયર્સ મિત્રો, કમિટી મેમ્બર્સ શ્રોતાગણ આનંદવિભોર થઈ ગયા હતા. વિભાબેન તથા હસમુખભાઈને પ્રમેશભાઈએ શૂભેચ્છા પાઠવી હતી. હમ તો ચલે પરદેશ, હમ પરદેશી હો ગયે ગીત સાથે કાર્યક્રમની પુર્ણાહૂતી કરાઈ હતી.

## શાળાઓમાંથી ઈસ્લામોફોબિયા નાબુદ કરવા ૩ લાખ યુએસ ડોલર ખર્ચ કરાશે

ક્યુબેક : કેનેડામાં મુસ્લિમ જાતિ સામેની નફરતને કારણે થતાં ગુનાઓનું પ્રમાણ વધતા ઓન્ટેરિયો પ્રાંતમાંથી ઈસ્લામોફોબિયા નાબુદ કરવા સરકારે ૩ લાખ યુએસ ડોલરનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યાની જાહેરાત મંગળવારે શિક્ષણ મંત્રી સ્ટીફન લેસેએ કરી હતી. એક અખબારી યાદીમાં ઓન્ટેરિયોએ સ્ટેટીસ્ટિક્સ કેનેડાના એવા આંકડાઓ ટાંક્યા છે જેમાં મુસ્લિમ વિરોધી હુમલાઓનું આ વર્ષનું પ્રમાણ જોવા મળે છે. જે ગયા વર્ષની સરખામણીમાં વધુ છે. લેસેએ કહ્યું હતું કે, આ બાબત સ્વીકારી શકાય એવી નથી અને એ અટકવી જ જોઈએ. અમારો આશય એવો માહોલ ઉભો કરવાનો છે, જેમાં બધાનો સમાવેશ સહજ રીતે થતો હોય. શિક્ષણ પદ્ધતિ પણ અમે સર્વ સમાવેશી બનાવવા માંગીએ છીએ. લંડન ઓન્ટેરિયોમાં થોડા સમય પહેલા એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા અને એકને ગંભીર ઈજાની બનેલી ઘટનાના અઠવાડિયા બાદ જ આ જાહેરાત થઈ છે. આ ઘટનામાં પોલીસના જણાવ્યા મુજબ મુસ્લિમ વિરોધી તત્વોની સંડોવણી હતી. સરકારે જે ફાળવણી કરી છે એ પૈકી ૨૨૫૦૦૦ યુએસ ડોલર કેનેડાના મુસ્લિમ એસોસિયેશનને ફાળવવામાં આવશે જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં ઈસ્લામોફોબિયાવિશે જાગૃતિ ઉભી કરવા ડિજિટલ સ્ત્રોતો તૈયાર કરશે.

## કેનેડામાં પાકિસ્તાની નાગરિક પર ચપ્પુથી હુમલો: કહ્યું- તારા દેશમાં પાછો જતો રહે

સાસ્કેચવાન

કેનેડામાં પાકિસ્તાની નાગરિકો સામે હુમલાઓની ઘટના સતત વધી રહી છે. તેવામાં પાકિસ્તાની મૂળના નાગરિક પર હુમલાની વધુ એક ઘટના સાસ્કેચવાનમાં બની હતી. અહીં બે અજાણ્યા શખ્સોએ પાકિસ્તાની નાગરિક પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. અને તેની દાઢી પણ કાપી દીધી હતી. અને તેને પોતાના દેશ પરત જતા રહેવા માટે કહ્યું હતું.

જે વ્યક્તિ પર હુમલો કરાયો તેનું નામ મોહમ્મદ કાશિફ છે. અને તેની ઉંમર ૩૨ વર્ષની છે. તેણે પરંપરાગત ઈસ્લામી કપડાં પહેર્યા હતા. સાંજે જ્યારે તે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેના પર

અજાણ્યા શખ્સોએ હુમલો કરી દીધો હતો. આ સમયે હુમલાખોર ચીસો પાડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે, તે આ કપડાં કેમ પહેર્યા છે. તું તારા દેશ પરત જતો રહે. હું મુસ્લિમોથી નફરત કરું છું. અને હુમલાખોરોએ કાશિફની દાઢીનો અમુક ભાગ પણ કાપી નાખ્યો હતો. હુમલામાં ઈજા પામેલા કાશિફને ૧૪ ટાંકા પણ આવ્યા હતા. આ મામલે કાશિફે પોલીસને ફરિયાદ કરી છે. કાશિફ ૨૦ વર્ષ પહેલાં પાકિસ્તાનથી કેનેડા આવ્યા હતા. પણ હવે તેને તેના બાળકો અને પત્નીની ચિંતા છે. જેમાં બાળકની ઉંમર ૩થી ૮ વર્ષની છે. આ ઘટના બાદ સાસ્કેચવાનના મેયર ચાલીએ કહ્યું કે આ ઘટનાથી હું દુઃખી છું.

### THINKING OF INVESTING?

#### INVEST AS LOW AS \$50,000 IN REAL ESTATE

SECURED INVESTMENT with up to 8-12% Guaranteed Return

INVEST WITH **Metrobuild Capital**  
Sharia'h Compliant

We have multiple avenues for investment in Residential Properties, Commercial Properties or Construction Projects **plus** your investment is secured against the assets.

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી અથવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માં અમારી પાસે ઘણાં જુદા જુદા રોકાણોનો વિકલ્પ છે જ્યાં તમને રોકાણ પર ૮-૧૨% સુધીનું વળતર અને તમારું રોકાણ સંપત્તિ સામે સુરક્ષિત હોય છે.

### CALL 416 893 4585 TODAY!!!

**આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર**  
અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહનો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.

Call us TODAY for all of your Real Estate Needs and get Honest, Reliable and Courteous Service you can count on.

- Residential
- New Construction
- Investment
- Commercial

**416 893 4585**

## ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX #1 with ABOWATH your Local REALTOR

\*Not intended to Solicit client under contract.

### LIFE INSURANCE

MORTGAGE/LINE OF CREDIT INSURANCE

Q : DO YOU HAVE MORTGAGE / LINE OF CREDIT INSURANCE WITH BANK ?  
A : COMPARE & SAVE UP TO 50% LOWEST RATES GUARANTEED

AGE	\$ 250,000		\$ 500,000		\$ 1000,000	
	Male	Female	Male	Female	Male	Female
30 Yrs	\$ 12.00	\$ 07.00	\$ 18.00	\$ 10.00	\$ 32.00	\$ 19.00
40 Yrs	\$ 13.00	\$ 08.00	\$ 22.00	\$ 14.00	\$ 36.00	\$ 26.00
50 Yrs	\$ 30.00	\$ 18.00	\$ 50.00	\$ 31.00	\$ 95.00	\$ 60.00
60 Yrs	\$ 85.00	\$ 56.00	\$ 146.00	\$ 103.00	\$ 271.00	\$ 190.00

ALSO AVAILABLE

- NO MEDICAL TEST LIFE INSURANCE (up to age 85)  
(Even if you have DIABETES, BLOOD PRESSURE, HEART ATTACK, STROKE)  
CANCER OR INSURANCE declined by other companies
- CORPORATION OWNED LIF / CRITICAL ILLNESS INSURANCE  
(Key Person INSURANCE, BUY SELL AGREEMENT, GROUP BENEFITS)
- MONEY BACK LIFE / CRITICAL ILLNESS INSURANCE, RRSP, RESP, TFSA

Visitor To CANADA INS, TRAVEL INS, Lite ins For Refugees & Work Permits

Davinder Singh Chawla

Email : - Davindersinghfh@gmail.com  
www.financialhuttd.com

**416.320.4614** Toll : 1866.623.0865 Call For HONEST ADVICE

**SUPER VISA INSURANCE**  
HARD TO BEAT OUR PREMIUMS





તંત્રી સ્થાનેથી

# કોરોનાથી મોત બદલ વળતર ચૂકવો : સરકારને SCની ટકોર

ભારતમાં કોરોનાકાળમાં મોટી સરકારની અનેક નીતિઓ અને યોજનાઓ વિવાદમાં રહી છે. સરકારની મનષા સામે



તંત્રી - પ્રકાશક  
સ્વદેશ

સતત સવાલો થતા રહ્યો છે. હાલમાં જ હિજરતી કામદારોના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ખખડાવી એ વાતને ચોવીસ કલાક પણ વીત્યા નહીં ત્યાં બુધવારે મોદી સરકાર ફરી સુપ્રીમ કોર્ટની ઝપટે ચડી ગઈ. કોરોનાના કારણે મોતને ભેટનારી દરેક વ્યક્તિના પરિવારને ચાર-ચાર લાખનું વળતર આપવું જોઈએ એવો કેન્દ્ર સરકારને આદેશ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જો કે, મોદી સરકારે આ મામલે હાથ અધ્ધર કરી દીધા છે. કોરોના કાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા લોકોને સરકારે વળતર આપવું પડે તેમ છે. પરંતુ મોદી સરકારને તો પૈસા ઉઘરાવવામાં જ હોય તેમ હજુ સુધી કોઈ ફોડ પડાયો નથી. દેશમાં કોરોનાને કારણે લાખો લોકોના અંતિમ સંસ્કાર સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરાયા છે. હવે મહામારી ઘોષિત થયા પછી કોરોનાની જે ગાઈડલાઈન સરકારે નક્કી કરેલી છે તે પ્રમાણે અંતિમ સંસ્કાર થયા હોય તેવા લાખો પરિવારને સરકારે સહાય કે વળતર આપવું પડે તેમ છે. સુપ્રીમ કોર્ટે બુધવારે એક અરજી સંદર્ભે જ સરકારને ફરમાન કર્યું કે, કોરોનાના કારણે મોતને ભેટનારી દરેક વ્યક્તિના પરિવારને વળતર આપવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) ગાઈડલાઈન તૈયાર કરે તે આવશ્યક છે. આ સાથે જ આ ઓથોરિટીએ દેશમાં કોરોનાને કારણે મોતને ભેટલાના દરેક પરિવારને ઉચ્ચક કેટલી રકમ આપવી એ અંગે પણ સરકારને ભલામણ કરવી. જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની ત્રણ જજની બેંચે દરેક પરિવારને કેટલી રકમ આપવી તેનો નિર્ણય છ અઠવાડિયાં એટલે કે લગભગ દોઢ મહિનામાં લઈ લેવા પણ આદેશ કર્યો છે.

ભારતમાં આફતમાં મોતને ભેટનારા લોકોના પરિવારને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવાની જોગવાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા કાયદામાં છે. આ કાયદા હેઠળ કોરોનાના કારણે મોતને ભેટનારાને પણ વળતર આપવું જોઈએ એવી માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી. પણ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને હાથ ખંભેરી નાંખ્યા હતા. મોદી સરકારે આ સૌગંદનામમાં કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, કોરોનાના મૃતકોના પરિવારોને વળતર આપી ના શકાય. કેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતો કાયદો કુદરતી આફતોને જ લાગુ પડે છે. જ્યારે કોરોના કુદરતી આફત નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ વળતર આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. મોદી સરકારની દલીલ હતી કે, રાજ્ય સરકારો કોરોનાના કારણે મોતને ભેટેલી દરેક વ્યક્તિના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયા વળતર આપવા જાય તો દેવાળું ફૂંકવાનો વારો આવે.

દરેક રાજ્ય પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જે પણ ફંડ હોય એ બધું કોરોનાના કારણે થયેલાં મોતના વળતરમાં જ વપરાય જાય તો રાજ્ય સરકારને બીજી સહાય ચૂકવવામાં મોટી મુશ્કેલી સર્જાય. તેથી ચાર-ચાર લાખ રૂપિયા વળતર આપવું તો કોઈ કાળે શક્ય જ નથી. સુપ્રીમ કોર્ટે સરકારની આ દલીલ માન્ય રાખી છે અને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાંથી મુક્તિ આપી છે. પરંતુ આ સાથે સાથે એમ પણ કહ્યું છે કે, સરકાર સાવ હાથ ખંભેરી નાંખે તે પણ ચલાવી લેવાય તેમ નથી. કોર્ટે એનડીએમએને

રાહત માટેનાં લઘુત્તમ ધારાધોરણ નક્કી કરવા પણ ફરમાન કર્યું છે. સાથે સાથે કોરોનાના કારણે મોતને ભેટેલાં લોકોના મૃત્યુના પ્રમાણપત્રમાં મોતનું કારણ કોરોના જ દર્શાવવાયેલું હોય એ માટે યોગ્ય ગાઈડલાઈન બહાર પાડવા પણ કહ્યું છે. જેમને પ્રમાણપત્ર આપી દેવાયાં છે તેમાં કઈ રીતે સુધારો કરી શકાય એ માટેની ગાઈડલાઈન બહાર પાડવા પણ સુપ્રીમે તાકીદ કરી છે.

વાસ્તવમાં સરકારે જવાબદારીથી છટકવા સાવ ધૂપ્પલ ચલાવેલું છે. કેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ હેઠળ ડિઝાસ્ટરની જે વ્યાખ્યા કરાઈ છે તેમાં કુદરતી અને માનવસર્જિત બંને પ્રકારની હોનારતોને આવરી લેવાઈ છે. સરકારે કોરોનાને નાથવા માટેનાં મોટાભાગનાં પગલાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જ લીધાં હતાં. સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનો છૂટથી ઉપયોગ કરાયો હતો. આ જ સમયગાળામાં ઈધણના ભાવને પણ આસમાને રાખીને સરકારે ટેક્સને નામે અબજો રૂપિયા ખંભેરી લીધા છે. પરંતુ જ્યારે વળતરની વાત આવી ત્યારે સરકારે આ જ કોરોનાને ડિઝાસ્ટરમાં ગણવા માંગતી નથી. સરકારની આ લુચ્ચાઈના કારણે જ કોરોનાને ડિઝાસ્ટર નહીં ગણવાની દલીલ કરાતી હતી. સુપ્રીમ કોર્ટે આ દલીલનો નકારી સ્પષ્ટ કરી દીધું છે કે કોરોના જેવો રોગચાળો પણ ડિઝાસ્ટર જ કહેવાય છે. અને તેને માટે વળતર આપવું જ પડે.

સરકારે આર્થિક જવાબદારીથી છટકવા માટે ગૂંચવાડો ઊભો કરવા ભારે ઉધામા કર્યા છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સરકારની મનષા પર પાણી ફેરવી દીધું છે. સુપ્રિમ કોર્ટનું આ વલણ ન્યાયસંગત અને સરાહનીય છે. કારણ કે ભારત જેવા લોકતાંત્રિક દેશમાં ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવ્યા બાદ કોઈપણ શાસકો આ પ્રકારે મનમાની કરી શકે નહીં. સરકાર તો લોકહીત માટે જ હોય છે. સરકારે આવકનો સ્ત્રોત ઉભો કરવા અન્ય રસ્તા અપનાવવા જોઈએ અથવા તો પોતાના ખુદના ખર્ચ પર કાપ મુકવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા જે માનવીય અભિગમ બતાવ્યો છે તે ખરેખર બિરદાવવા લાયક છે.

સરકાર કોરોનાની સારવાર માટેની પૂરતી વયવસ્થા તો ના જ કરી શકી પણ આ નાનકડી હૂંફ આપવા પણ તૈયાર નહોતી એ આ ઘટના પરથી સ્પષ્ટ થઈ ગયું છે. આમ તો દેશમાં ઓક્સિજન અને દવા કે ઈન્જેક્શન વિના સેંકડો લોકોના મોત થયા તે સમયે પણ સરકારે હાથ અદ્ધર કરી નાંખ્યા હતા. દવા, ઈન્જેક્શન કે ઓક્સિજન માટે દર્દીના પરિવારે રજળપાટ કરવી પડી હતી. આવા સમયે દેશમાં સરકાર છે કે કેમ તેવો સવાલ પણ લોકોમાંથી ઉઠી રહ્યો હતો. થોડા સમય પહેલાં જ આવેલા વાવાઝોડા વખતે જેમને નુકસાન થયું છે કે જે લોકોનાં મોત થયાં છે તેમના પરિવારને સરકારોએ વળતર આપ્યાં જ છે. જ્યારે કોરોનાના મામલે સરકાર પોતે સાવ હાથ અધ્ધર કરીને બેસી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે સરકારનો પણ વિચાર કર્યો જ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા કાયદામાં ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવાની જોગવાઈ છે પણ અત્યારે દરેક પરિવારને આટલી મોટી રકમ આપવા પણ સુપ્રિમે દબાણ કર્યું નથી. હાલના સંજોગોમાં દરેક મૃતક દીઠ ચાર-ચાર લાખ રૂપિયા ચૂકવાય તો સરકારના માથે ૧૬૦૦૦ કરોડનો બોજ આવે તેમ છે. ભારત જેવા મોટા અર્થતંત્ર માટે ૧૬૦૦૦ કરોડ રૂપિયા વધારે નથી. પરંતુ અત્યારે સરકાર આર્થિક ભીંસમાં છે. તેથી વાસ્તવિકતા સમજતા સુપ્રીમ કોર્ટે ચાર-ચાર લાખ રૂપિયાના બદલે સરકાર પોતે કોઈ ઉચ્ચક રકમ નક્કી કરે એવી તાકીદ કરી છે.

Manoj Gandhi

manoj1968@yahoo.ca

**RE/MAX**  
REALTY SERVICES  
INC., BROKERAGE  
INDEPENDENTLY OWNED AND OPERATED



**JAY PATEL**  
BROKER

647.241.3818  
jaypatel1323@gmail.com



"Let Me Make Your Dream  
Home Into A Reality"

Residential, Commercial &  
Investment in Real Estate

Off : 905.456.1000 | Fax : 905.456.1924  
295 Queen Street East, Brampton, On., L6W 3R1



**ARISTO PEST CONTROL**  
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice

✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



✓ Cockroach

✓ Bedbug

✓ Animal Control

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



24 HRS / 7 DAYS EMERGENCY SERVICES  
AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And  
Discounted Rates



CALL SANKET TRIVEDI - 647.339.3926  
Government Licensed Structural Exterminator



# ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

## Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,  
છોલેપુરી, કટલેસ,  
ખાસ્તા ક્યોરી,  
સેવ ઉસળ, સમોસા ચાટ

## Takeout & Catering

Limited થાળી  
(with sweet & Farsan)

\$8.00 +Tax

Limited થાળી  
(without sweet & Farsan)

\$6.50 +Tax



## CATERING SPECIAL

\$ 7.99 10 items

+Tax

Sweet, Farsan, Subji,  
Kathor, Puri, Dal, Rice  
Papad, Pickle, Kachumber

Franchise  
Opportunity  
in GTA

Call us for details

રસોઈકામ  
કરી શકે તેવા  
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

દેશ-વિદેશથી ટોરન્ટો ભણવા આવતા ગુજરાતી  
(વેજીટેરીયન) સ્ટુડન્ટ, ભાઈઓ તથા બહેનોની ખાસ  
સગવડ માટે તુષાર શાહ તથા ગોવર્ધન થાળ શરૂ કરે છે

# ગુજરાત ભવન

જેમાં આપને સ્પેશિયલ રૂમ, શેરીંગ રૂમ, ગુજરાતી વેજીટેરીયન ભોજન,  
પ્રાઈવેટ બેડ, Wi Fi ઇન્ટરનેટ વગેરે સગવડો આપવામાં આવશે.



ગુજરાત ભવન

Quarantine  
Special  
Package

\$73 Per Day



Call : Tushar Shah - 416-434-8121

ગુજરાત ભવન - 416-913-7184

4694 Kingston Road, Scarborough.





# વડોદરામાં દેશનો સૌપ્રથમ રોડ સોલાર પ્રોજેક્ટ 14 લાખ યુનિટ ઉત્પાદન કરશે

ગુજરાત રાજ્યમાં સોલાર રૂફ ટોપ યોજનામાં 2,44,000 અરજીઓ આવી

વડોદરા : શહેરના હાર્દ સમા દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે તૈયાર થયેલ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનું રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ ઈ લોકાર્પણ કર્યું હતું. જેનાથી પાલિકાને વીજ બીલમાં વર્ષે 87 લાખનો ફાયદો થશે. વડોદરાના હાર્દ સમા દાંડિયા બજાર ચાર રસ્તાથી અકોટા તરફ જવાના રેલવે બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે રૂફ ટોપ સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. સાડા ચાર વર્ષમાં તૈયાર થયેલ

રૂફટોપ સોલાર પ્લાન્ટનું રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે સયાજીનગર ગૃહમાંથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરી વડોદરાવાસીઓને અર્પણ કર્યું. રૂફ ટોપ સોલાર પ્લાન્ટની વિશેષતા એ છે કે, આ રૂફટોપ સોલાર પ્લાન્ટ 982.8 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરશે. એટલે કે, પ્રતિદિન 3930 યુનિટ વીજળી જનરેટ થશે. અને એક વર્ષમાં 14.34 લાખ યુનિટ વીજળી જનરેટ થશે. જનરેટ થનાર વીજળીનો ઉપયોગ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ

તેમજ વારસીયા વિસ્તારમાં આવેલ રાજવનગર સુએઝ પમ્પીંગ સ્ટેશન અને અટલાદરા સુએઝ પમ્પીંગ સ્ટેશન ખાતે ઉપયોગમાં લેવામાં આવશે. વડોદરા મહાનગર સેવાસદનને વર્ષે આવતો રૂપિયા 87 લાખનો વીજળી ખર્ચ બચી જશે. કોર્પોરેશનની તિજોરી ઉપર રૂપિયા 87 લાખનું ભારણ ઓછું થશે. સાથે જ ઉર્જા મંત્રીએ કહ્યું કે સોલાર રૂફ ટોપ યોજનામાં રાજ્યમાં 2,44,000 અરજીઓ થઈ. જેમાં સૌથી વધુ વડોદરામાં 33702 સોલાર રૂફટોપ યોજના માટે અરજીઓ થઈ છે.

# દાનહ-સેલવાસમાં ગટર સફાઈ દરમિયાન ત્રણ શ્રમિકોનાં મોત

સેલવાસ : દાદરાનગરના સેલવાસમાં ગટર સફાઈ માટે અંદર ઉતરેલા 3 શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. તેમની ડેડબોડી ન મળતાં ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 6 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ તમામની ડેડબોડી બહાર કઢાઈ હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના ડોકમરડીના ગામમાં ગટર સફાઈ માટે 3 શ્રમિકો અંદર ઉતર્યા હતા. પણ ગેસ ગળતરને કારણે ત્રણેય શ્રમિકોનાં ગુંગળાઈ જવાને કારણે

મોત નિપજ્યા હતા. શ્રમિકોનાં મોત થતાં સરકારી અધિકારીઓ સહિત ફાયરનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે, શ્રમિકોના મૃતદેહોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અને 6 કલાકની ભારે જહેમત બાદ તેઓના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા જેસીબીની મદદથી ખાડો ખોદીને મૃતદેહો શોધવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અને ગટરની અંદર ઉતરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

# કોરોનાના બીજા વેવનો અંત: ૨૪ કલાકમાં માત્ર 84 લોકો સંક્રમિત

રાજ્યમાં 3 વ્યક્તિનું મોત, 18 જિલ્લા કોઈ કેસ નહીં

## ગાંધીનગર

ગુજરાતમાં કોરોના કાબુમાં આવી ચુક્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા ૮૪ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૩૦૦થી વધારે દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં ૮,૧૦,૭૫૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે ૨,૮૪,૭૯૧ લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે. જો એકિટવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૨૭૮૪ એકિટવ કેસ છે. જે પૈકી ૧૧ લોકો વેન્ટિલેટર પર છે.

૨૭૮૩ લોકો સ્ટેબલ છે. ૮,૧૦,૭૫૧ લોકોને ડીસ્ચાર્જ આપવામાં આવી ચુક્યું છે. ૧૦૦૬૨ લોકોનાં અત્યાર સુધી કોરોનામાં મોત નિપજ્યાં છે. ૦૩ લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. ગુજરાતમાં ૧૮ જિલ્લા એવા પણ છે જેમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તો બીજી તરફ સુરત અને અમદાવાદને બાદ કરતા મોટા ભાગનાં જિલ્લાઓમાં કોરોનાના નવા આંકડા સિંગલ ડિજિટમાં આવ્યા છે.

# ઝીમીરાં રિસોર્ટમાંથી BJPના માતરના MLA કેસરીસિંહ જુગાર રમતા ઝડપાયા

## દાહોલ

પંચમહાલ જિલ્લાના શિવરાજપુર નજીક આવેલા ઝીમીરાં રિસોર્ટમાં દારૂ - જુગારની મહેફીલ ચાલી રહી હોવાની પોલીસને ખાતમી મળી હતી. જે ખાતમીના આધારે ગોધરા એલસીબી પોલીસે રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. જેમાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને તેમના ટેકેદારો દારૂ-જુગારની મહેફીલ માણતા ઝડપાયા હતા. આ મહેફીલમાં ધારાસભ્ય સહિત ૧૮ પુરૂષો અને ચાર નેપાળી, ત્રણ ગુજરાતી સહિત



૭ મહીલાઓ હતી. આ દારૂ-જુગારની મહેફીલમાં ધારાસભ્ય કેસરીસિંહ અને તેમજ તેમના ટેકેદારો પ્લાસ્ટીકના સિક્કાથી જુગાર રમતા હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, હાલ લાખો રૂપિયાનો મુદ્દામાલ હોવાનું જાણવા મળે છે. પોલીસની રેડ દરમિયાન રિસોર્ટમાંથી ઝડપાયેલી ચાર નેપાળી મહિલા સહિતની સાતેય મહિલા કઢંગી અવસ્થામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તેમના ટેકેદારોની આગતા સ્વાગતા માટે આ સાત મહિલાઓને બોલાવવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય દારૂ-જુગારની મહેફીલ માણતા ઝડપાતા રાજ્યભરમાં ચર્ચા જાગી છે.

# THANK YOU FRONTLINE WORKERS



**MORTGAGE DILIGENT**  
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

**5 Yrs Fixed @ 1.84%\* High Ratio Only**  
**5 Yrs Variable @ 1.15%\* High Ratio Only**  
**3 Yrs Variable @ 0.99%\* (Special Promotion)**



Rakesh Patel\*\*  
Vice President- Commercial.



Pranay Jani \*



Nilesh Tailor \*



Bala Shah\*



Vijay Rana\*



Rajesh Khurana, MBA  
Principal Broker

**Cell : 416-616-1300**

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.\* FSCO#10252,OAC,E&O.E \* - Mortgage Agent, \*\* - Vice President

\* Some conditions apply



# નડિયાદ પાલિકામાં ટેક્સચોરી કૌભાંડ સંડોવાયેલા ત્રણેય કર્મચારીની ધરપકડ

**નડિયાદ**  
નડિયાદ નગરપાલિકામાં છ મહિના પહેલાં ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં આરોપીઓએ પોતે મોટી એન્ટ્રી કરી ભ્રષ્ટાચાર આદર્યો હોવાનું કબૂલી લઈ નાણા ભરપાઈ કરવાની બાંહેધરી આપી હતી. ૨૬-૧૧-૨૦૨૦ના રોજ પાલિકાના ટેક્સ સુપ્રિટેન્ડેન્ટે ટેક્સ વિભાગના કર્મચારીઓ કાસમભાઈ મૌલવી,

અનીલભાઈ અંબુભાઈ ઠાકોર અને સુનીતાબેન મિસ્ત્રી વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓના આગોતરા જામીનની અરજી નડિયાદ કોર્ટે ફગાવી દીધા પછી આરોપીઓ હાઈ કોર્ટમાં ગયા હતા. હાઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીઓના વકીલ દ્વારા આગોતરા જામીનની અરજી પાછી ખેંચી લેતા પાલિકાના એ ત્રણ કર્મચારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

ગત ઓક્ટોબરમાં નડિયાદ શહેરની

પાલિકાના કુલ ૧૮ વોર્ડમાં આવેલી ૭૦,૦૦૦થી વધુ મિલકતોની ટેક્સ રીકવરીમાં લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં છેલ્લાં બે ત્રણ વર્ષનો ટેક્સ બાકી હોય તેવા મિલકતધારકોને માત્ર ચાલુ સાલનો ટેક્સ ભરાવીને તેની પાવતી આપવામાં આવતી. તે પાવતીમાં પાછલી બાકીની રકમો નીલ બતાવવામાં આવતી અને બદલામાં બાકી રકમના પચાસ ટકામાં બારોબાર સોદો થતો. આ રીતે ૫૦,૦૦૦ ટેક્સ બાકી હોય ત્યારે માત્ર ૫,૦૦૦ રૂપિયા જ પાલિકામાં જમા થતા હતા. બાકીની રકમની ટેક્સ રીકવરી કર્મચારી અને બાકીદાર વચ્ચે સમજૂતીથી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં આરોપીઓને ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજા થઈ શકે છે. આરોપીઓની કસ્ટડી લીધા પછીની તપાસમાં વધુ રકમો ઉઘાડા થાય અને ફરિયાદમાં વધારે કલમો ઉમેરાઈ ગુના સાહિત થાય તો સજા વધી પણ શકે છે.

**ટેક્સ વસૂલીમાં ખોટી એન્ટ્રીઓ કરી 25 લાખની ઉંચાપત કરી ફરાર હતા**

# કઠલાલના લાંચ કેસમાં ના. મામલતદારની જામીન અરજી ફગાવી

**નડિયાદ** : તા.૯ જૂનને બુધવારની ઢળતી સાંજે ગાંધીનગર એ.સી.બી ટીમે કઠલાલ મામલતદાર કચેરીમાં લાંચનુ છટકુ ગોઠવી નાયબ મામલતદાર હબીબીભાઈ મલેકને ઝડપી પાડ્યા હતા. હબીબીભાઈ મલેકે જાગૃત નાગરિકની પાકી નોંધ પાડવા માટે પૈસાની માંગણી કરી હતી. જેમાં એક નોંધ પૈકી રૂ.૧૫,૦૦૦ એમ છ નોંધના કુલ રૂ.૯૦,૦૦૦ નક્કી કર્યા હતા. આ બાદ રકમકના અંતે કુલ છ એન્ટ્રીના રૂ.૫૦,૦૦૦ નક્કી કરાયા હતા. જો કે તે પછી ફરિયાદ થતા એ. સી. બી ટીમે લાંચનુ છટકુ ગોઠવી હબીબીભાઈ મલેક રૂ.૫૦,૦૦૦ સ્વીકારતા લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા. નાયબ મામલતદારે નડિયાદ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. તાજેતરમાં આ કેસ અંગે ચાલી જતાં નડિયાદ સેશન્સ કોર્ટના સરકારી વકીલની ઉગ્ર દલીલો કોર્ટ ગ્રાહ્ય રાખી હબીબીભાઈ મલેકની જામીન અરજી કોર્ટે ફગાવી હતી.

# વડોદરા શહેરમાં ડ્રગ્સ માફિયાઓને પકડવા મેડિકલ સ્ટોર ઉપર તપાસ

**વડોદરા**

વડોદરા કોઈપણ જાતના ભય વગર ડ્રગ્સનો વેપલો કરતાં માફિયાઓ બેનકાબ થયા બાદ પોલીસે તેમને પકડવા દોડધામ કરી મુકી છે.

રાજ્યમાં ડ્રગ્સનું દુષણ પોલીસ માટે માથાના દુખાવા સમાન બન્યું છે. ખાસ કરીને વડોદરા, સુરત અને અમદાવાદમાં ડ્રગ માફિયાઓએ જબરજસ્ત નેટવર્ક જમાવી દીધું છે. મોટાભાગે સ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સનો નશો કરતાં થયાં છે. જેમાં ટીનેજર્સ પણ બાકાત નથી. વિદ્યાર્થીઓમાં પેન્ટાગોસિન ઈન્જેક્શન, એમડી, ગાંજો અને ચરસનું ચલણ વધારે છે. પોલીસે કરેલા મોટાભાગના કેસોમાં યુવકો ગાંજાની સાથે કફ સિરપ, મેથાફેટામાઈન અને ચરસનું વધારે સેવન કરે છે.

આ અંગે ડીસીપી કાઈમ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, યુવક - યુવતીઓ પેન્ટાગોસિન ઈન્જેક્શનની સાથે કફ સિરપ તથા વ્હાઈટનરનો પણ નશો કરે છે.



જેમાં કરફ સિરપ અને પેન્ટાગોસિન ઈન્જેક્શન કેટલાક મેડિકલ સ્ટોર પર પ્રિસ્ક્રિપ્શન વગર અથવા બોગસ પ્રિસ્ક્રિપ્શનના આધારે નશોબાજોને આપી દેવાય છે. પેન્ટાગોસિન ઈન્જેક્શનોનું માંજલપુર, ફતેગંજ, વાસણા રોડ, ગોત્રી, અકોટા, મકરપુરા, કારેલીબાગ, ફતેગંજ, રાજમહેલ રોડ અને સમા વિસ્તારમાં બજાર ધમધમી રહ્યું છે. તાંદલજા, જૂના પાદરા રોડ, મકરપુરા - વડસર રોડ અને વિશ્વામિત્રી નદીના ચોક્કસ કાઠાં વિસ્તારો સ્વર્ગ સમાન બન્યાં છે. આ અંગેની ફરિયાદો મળતા પોલીસે હાલ શહેરના મેડિકલ સ્ટોર પર દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. પોલીસનો મુખ્ય ટાર્ગેટ ડ્રગ્સ માફિયાઓને ઝબ્બે કરવાનો છે.

# છોટાઉદેપુરમાં 4 પાનાની સ્યુસાઈડ નોટ લખી માધ્યમિક શાળાના આચાર્યની આત્મહત્યા

**વડોદરા**

અરવલ્લી જિલ્લાના માલપુરના રહેવાસી ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા અને પતિ અને બે બાળકો સાથે રહેતા હતા. ભાવનાબેન ડામોરે મંગળવારે સવારે શાળાના શૌચાલયમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ સ્કૂલના શિક્ષકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને પોલીસ અને મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. નસવાડી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને નસવાડી પોલીસે મૃતદેહ પાસેથી 4 પાનાની સ્યુસાઈડ નોટ કબજે કરી હતી. જોકે સ્યુસાઈડ નોટમાં આત્મહત્યાના કારણ અંગે ખુલાસો થાય

તેવી શક્યતા છે. પોલીસે મહિલાના માતા-પિતાને જાણ કરી હતી. જેથી મહિલાના માતા-પિતા કુકરદા ગામ જવા રવાના થઈ ગયા હતા. આત્મહત્યા કરનાર મહિલાના લગ્ન 10 વર્ષ પહેલા જયદીપ ડામોર સાથે થયા હતા અને છેલ્લા 4 વર્ષ કુકરદા ગામમાં જ રહેતા હતા. મહિલાએ મંગળવારે સવારે 9:25 વાગ્યે બે સગાના જન્મદિવસ હોવાથી શુભેચ્છા પાઠવી હતી અને વોટ્સએપમાં સવારે 10:25નું તેમનું લાસ્ટ સીન બતાવે છે. આત્મહત્યા કરનાર મહિલા પ્રિન્સિપાલના પતિ જયદીપ ડામોરે જણાવ્યું હતું કે, ઘરમાં કોઈપણ પ્રકારના પ્રોબ્લમ નહોતા. જોકે 4 મહિનાથી પ્રિન્સિપાલ બન્યા બાદ તે સ્ટ્રેસમાં રહેતી હતી. જેના કારણે આ પગલુ ભર્યું હોય તેમ લાગે છે.

# વડોદરાની મહિલાએ 5 વર્ષ સુધી ભણી 67 વર્ષની ઉંમરે PhDની ડીગ્રી મેળવી

**વડોદરા**

વડોદરાની એક 67 વર્ષની મહિલાએ પણ આ પ્રકારે જ પીએચડીની ડીગ્રી મેળવી છે. 20 વર્ષની ઉંમરે લગ્ન કરનારા ઉષાબેને પોતાની સિદ્ધિ વિશે કહ્યું છે કે, હું પહેલેથી ડોક્ટર બનવા માગતી હતી. મારા લગ્ન થયા ત્યારે હું ગ્રેજ્યુએશનનાં પ્રથમ વર્ષમાં હતી. મારા માતા-પિતા પણ ઈચ્છતા હતા કે, લગ્ન પછી હું અભ્યાસ ચાલુ રાખું. પરંતુ લગ્ન બાદ પરિવાર સંભાળવાનો હતો તેથી સાથે અભ્યાસ કરવો મુશ્કેલ હતો. એટલે 60 વર્ષની ઉંમર થયા પછી ઉષાબેન છેલ્લા 10 વર્ષોથી તેમના ગુરુ જય દર્શીદાસ મહારાજ પાસેથી ધર્મનું શિક્ષણ મેળવવા માંડ્યા હતા.

# મેઘરાજની ત્વિષા ચૌધરીને ગુજરાતમાંથી પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેટ કરાઈ

**મેઘરાજ**

મેઘરાજના અંતરિયાળ ગોઢા ગામની ત્વિષા ચૌધરીની ઈસરોમાં ઈન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-૨ ક્ષેત્રની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર આવતા ચંદ્રયાન મિશન-૨માં પ્રથમ ક્રમ આવ્યો હતો. હવે ૧૮ વર્ષીય ત્વિષાની ગુજરાતમાંથી પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેટ કરાવામાં આવી છે. ગોઢા ગામની ત્વિષા ચૌધરી નામની ૧૭ વર્ષની ઉંમરમાં પોતાના સપનાને સાબિત કરી બતાવ્યા હતા. જેમાં તેના માતા-પિતા કરતા નાના-નાની તેમજ મામા-મામીનો વિશેષ સહયોગ મળ્યો હતો. પરિવારની મદદથી ત્વિષાએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેનાથી તેના માતા-પિતા તેમજ સમાજ અને રાજ્યનું નામ રોશન કર્યું છે.

# Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

**24 Hour Service • 7 Days a Week**

Preventing the Spread of COVID-19 :  
Our disinfectant services that we offer are:

1 Spray Services

2 Fogging Services

3 Sanitation Services

**All Pest Control:**  
Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.  
Total Interior & Exterior Pest Control

**Removal:**  
Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

First Time Customer gets

## 10% Off

on your first home service

\*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca  
info@imperialpestcontrol.ca  
(We speak English, हिन्दी, ગુજરાતી)

# Call: Ramesh Kanani 416-837-1820

## સ્વદેશ CANADA

Registration # 869127209  
Publication Mail Agreement /  
Email : info@swadesh.news

Return Undeliverable Canadian Address To :

**Shree Balaji Inc.**  
MAILING ADDRESS  
23 Lyric Road,  
Brampton ON L6S 0B4.  
416-996-7755

Registered Address  
713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi  
Director : Nilesh Tailor  
Sub Editor : Chhaya Gandhi  
Montreal Bureau : Vijay Patel (514-826-7442)

**GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT ( INDIA)**

Designed By  
Sabir Daroga  
Mevada Piyush  
Firoz Shaikh





# કેડીસીસી ચૂંટણી પ્રક્રિયામાં શાસક પક્ષને જીતાડવા ગેર વહિવટનો કોંગ્રેસનો આક્ષેપ

અબજોનો ભ્રષ્ટાચાર દબાવવા અત્યારથી જ નિયમોનો ભંગ શરૂ કરાયો !

ભુજ

કરોડોના ભ્રષ્ટાચારમાં ડુબેલી કેડીસીસી બેંકની ચૂંટણી ફરી વિવાદમાં સપડાઈ છે. કોંગ્રેસ દ્વારા ખુલ્લેઆમ આક્ષેપ કરાયો છે કે, અબજોનો ભ્રષ્ટાચાર દબાવવા શાસક પક્ષને જીતાડવા કોશિશ કરાઈ રહી છે. નિયમોને નેવે મુકીને કરાતી કામગીરી સામે જવાબદાર વહીવટી તંત્ર પણ મુકપ્રેક્ષક બનીને તમાશો જોતા બેંકમાં ફરી ભ્રષ્ટાચારનો માર્ગ મોકળો થાય તેવી વકી છે.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રફીક મારાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીની પ્રક્રિયામાં લોકશાહીનું ખૂન થયું હોય અને શાસક પક્ષના હોદ્દાદારોને જીતાડવાની પ્રક્રિયા ચાલુ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. આગામી સમયમાં કેડીસીસી બેંકની ચૂંટણી યોજાવવાની હોઈ તેના માટે મંડળીઓ દ્વારા ઠરાવ લેવામાં આવે છે. જેની ગઈકાલે તા.૨૮ના રોજ સાંજે સમય પુર્ણ થઈ

ગયો છે. જેમાં ૭૫૮ મંડળીઓના ઠરાવો રજૂ કરવામાં આવ્યા છે.

આ મંડળીઓ દ્વારા ૧૨ ડાયરેક્ટરોની ચૂંટણી પ્રક્રિયા થોડા સમયમાં જાહેર થશે. આ પ્રક્રિયામાં ૧ થી ૧૨ વોર્ડ પ્રમાણે મતદાન કરવાનું હોય જેથી ૧ થી ૧૨ મતદારોના નામ પહેલેથી જાહેર કરવાના હોય છે. જેનો સમય ગઈકાલે પુર્ણ થઈ ગયો હોવા છતાં તેમણે યાદી બહાર પાડી નથી.

# રાજકોટ સિવિલમાં મ્યુકરના 45 દર્દીઓને ઈન્જેક્શનનું રિએક્શન

- ફાર્મકો વિજીલન્સને તપાસ સોંપવામાં આવી રાજકોટ

રાજકોટ સિવિલના મ્યુકર માર્ફકોસીસ વોર્ડમાં ઈન્જેક્શનના રિએક્શનથી ૪૫ દર્દીઓને તાવ, ઉલ્ટી થતા આ ઈન્જેક્શનનો વપરાશ સ્થગિત કરાયો હતો જેના પગલે ભારે હોબાળો મચી ગયો છે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા આ રિએક્શનની બાબતે ફાર્મકો વિજીલન્સને તપાસ સોંપી છે.

સિવિલના મ્યુકર વોર્ડમાં આજે દર્દીઓને એમ્ફોટેરેસીન-બી ઈન્જેક્શન

ન મળતા ભારે વિરોધ સર્જાયો હતો ઈન્જેક્શનની અછત સર્જતા દર્દીઓએ વિરોધ નોંધાવ્યો હતો સિવિલ સર્જન ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે મ્યુકરના દર્દીઓમાંથી ૪૫ને ઈન્જેક્શનથી રિએક્શન આવતા આ અંગે ફાર્મકો વિજીલન્સને તપાસ સોંપાઈ છે.

આ બાબતે તપાસ કરવામાં આવતા ડે.કલેક્ટર ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દવા અને ઈન્જેક્શનનો પુરતા પ્રમાણમાં સ્ટોક છે થોડા દિવસો પહેલા દર્દીઓને રિએક્શન આવતા હવે તબીબોની સલાહ મુજબ જ ઈન્જેક્શન આપવામાં આવે છે.

# સોમનાથ મંદિરે હવે ટૂંક સમયમાં ભાવિકો સ્વહસ્તે જ કરી શકશે ધ્વજારોહણ

**પ્રભાસપાટણ :** સોમનાથ મહાદેવ મંદિરના ગગનચુંબી શિખરે હવે ભાવિકો સ્વહસ્તે ધ્વજારોહણ કરી શકે તે માટે યાંત્રિક સીસ્ટમ ટૂંક સમયમાં મંદિર ખાતે કાર્યરત કરાશે. હાલ શિખર ઉપર ચડીને મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ભાવિકો વતી ધ્વજારોહણ કરે છે. તેને બદલે ભાવિકો મંદિરના શિખરે ખુદ ધ્વજારોહણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકશે.

સમુદ્ર તટે આવેલ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના ૧૫૧ ફૂટ ઊંચા ગગનચુંબી શિખરે ભાવિકો સ્વ હસ્તે ધ્વજારોહણ કરી શકશે તેવી યાંત્રિક સીસ્ટમ ટૂંક સમયમાં કાર્યરત થશે. ધ્વજ ચઢાવવાની દોરી પકડી ધ્વજ શિખર ઉપર ચઢે ત્યાં સુધી સ્વ હસ્તે પોતે ધ્વજ ચઢાવવાની દિવ્ય અનુભૂતિ કરી શકશે.

# વિરનગરમાં ચાલતું વ્યસન મુક્ત કેન્દ્ર, 7000 લોકોએ છોડ્યું 'બંધાણ'

- રાજ્યમાં દારુ-અફિણ, ડ્રગ્સનાં વ્યસનીઓને મળી નવી જિંદગી

રાજકોટ

નશાબંધી મંડળ - ગુજરાત દ્વારા સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનાં વિરનગર ખાતે ૧૯૮૯ થી વ્યસન મુક્ત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. દારુ, અફિણ, ગાંજો, કોકીન, ડ્રગ્સ, ચરસનાં બંધાણીઓને આ મુક્ત કેન્દ્રમાં સારવાર અપાયા બાદ વ્યસન છુટ્યું છે તેવા હજારો કિસ્સાઓ છે. પારિવારિક પ્રશ્નો, આર્થિક સંકટ, ખરાબ મિત્રોની સંગતથી યુવાનો સૌથી વધુ

વ્યસનનો ભોગ બની રહ્યા છે. વિરનગરનાં કેન્દ્રમાં છેલ્લા ત્રણ દાયકામાં ૭૭૦૦ જેટલા વ્યસનીઓને સારવાર આપવામાં આવી છે અને ૨૮૦૦૦ ઓપીડી નાં કેસ આવ્યા છે. પંદર - વીસ દિવસની સારવાર આપવામાં આવે છે. ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ વ્યસન છૂટી શકે છે જરૂર હોય છે મનની મક્કમતાની. આ કેન્દ્રએ સાત હજાર લોકોને વ્યસનમાંથી મુક્ત કરાવ્યા છે. સમાજ માટે ચિંતાજનક બાબત એ છે કે વિરનગરની પ્રખ્યાત શિવાનંદ આંખની હોસ્પિટલનાં કેમ્પસમાં ચાલતા આ કેન્દ્રમાં અત્યાર સુધી જ વ્યસનીઓને દાખલ કરાયા છે તેમાં ૨૮ થી ૪૦ વર્ષનાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે.

# ધારી ગીર પૂર્વ વિસ્તાર- શેત્રુંજીમાં 15 દિવસમાં પાંચ સિંહોનાં મોત

**ખાંભા :** ધારી ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં ગંભીર બીમારી આવી હોય તેમ છેલ્લા પંદર દિવસમાં પાંચથી વધારે સિંહોના મોત નિપજ્યા છે. બુધવારે શેત્રુંજી ડિવિઝનના જાફાબાદ રેન્જના રેવન્યુ વિસ્તારમાંથી એક બિમાર સિંહણ મળી આવી હતી. આ ૫ થી ૯ વર્ષની સિંહણને સારવાર મળે તે પહેલા જ બેબસીયા રોગની ગંભીર બીમારીથી મોત થયું હતું. પંદર દિવસમાં ધારી ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં પાંચથી વધારે સિંહોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ખાંભા તુલશીશ્યામ રેંજમાં, શેત્રુંજી ડિવિઝનના લીલીયા વિસ્તારમાં, ગઢીયા પાટળા રેવન્યુ વિસ્તારમાં સિંહબાળના મૃતદેહ મળ્યા હતા. જ્યારે બેબસીયા નામની ગંભીર બિમારીથી સિંહણનું મોત નિપજ્યું હતું.

# માણાવદરમાં અઠવાડિયાથી લાપતા મહંતની લાશ મળી, હત્યાની આશંકા

ક્ષતવિક્ષત હાલતમાં મળી આવ્યો મૃતદેહ, આંખો ગાયબ

માણાવદર

માણાવદર નજીકના ભાલેચડા ગામ પાસે પ્રાચીન બાલા હનુમાન મંદિરના મહંત સદારામ બાપુ(૪૫)ની લાશ નજીકમાં આવેલા ડેમ પાસેથી મળી આવતાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. આ બનાવ હત્યાનો હોવાની આશંકા સાથે પોલીસે તપાસ આગળ વધારી છે.

માણાવદર પોલીસે જણાવ્યું કે ગત સોમવારથી મહંત ગુમ હતા. ભક્તોનું કહેવું છે કે તે બહાર જતા ત્યારે કંઈ જણાવતાં નહિ. મહંતનો મૃતદેહ મંદિરથી થોડે દૂરથી જ મળી આવ્યો છે. તેમને કોઈ સાથે દુશ્મનાવટ નહોતી. હાલ પ્રાથમિક તબક્કે વિવિધ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. મૃત્યુને ૪થી ૫ દિવસ થઈ ગયા હોવાનું જણાય છે.

બુલ્લી જગ્યામાં લાશ પડી હોવાથી શ્વાનોએ ફાડી ખાધી હોવાનું પણ લાગે છે. મૃતદેહને પીએમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.

બાલા હનુમાન મંદિરે અનેક લોકો દર્શનાર્થે જાય છે. આમ છતાં મહંત ક્યાં ગયા હતા એ કોઈ જાણતું ન હોવાની વાત પોલીસના ગળે પણ ઊતરી નહોતી. ડેમ હાલ ખાલી છે તેથી ડૂબી જવા સિવાયનું કોઈ કારણ લાગી રહ્યું છે. મિલનસાર સ્વભાવ ધરાવતા મહંત લોકોને આયુર્વેદિક દવા પણ આપતા અને ગૌશાળા પણ બનાવી હતી. થોડા સમય પહેલાં ગાયોના લાભારે ડાયરો પણ કર્યો હતો, જેમાં કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ એમની સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

# 'આપ'નાં નેતાઓની કાર પર પથ્થરમારો, તોડફોડ : હુમલામાં એક કાર્યકરને ઈજા

જૂનાગઢ-વિસાવદર

વિસાવદરના લેરીયા ગામે આજે 'આપ'નું જનસંવેદના સંમેલન યોજવામાં આવ્યું હતું, પરંતુ આ સંમેલનમાં આપ નો કાફલો પહોંચે તે પહેલા જ ગામના પાદરમાં તેમને રોકવામાં આવ્યા હતા. તેમાં કોઈએ કાંકરીયાળો કરતા મામલો તંગ બન્યો હતો અને ટોળામાંથી પથ્થરમારો થતા કારના કાચ ફૂટી ગયા હતા અને એક કાર્યકર ઘાયલ થતા આપ ના નેતાઓ સંમેલન મોકૂફ રાખીને ફિયાદ માટે વિસાવદર પોલીસ મથકે પહોંચ્યા હતા.

આજે વિસાવદરના લેરીયા ગામે સાંજે સાત વાગ્યે આપ નું જનસંવેદના સંમેલન યોજવામાં

આવ્યું હતું, સાજે આપના પ્રદેશ નેતાઓ ઈશુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામ મોણીયા મુકામે નાગબાઈ માતાજીના મંદિરે દર્શન કરીને લેરીયા ગામે આયોજિત કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે આપ ની કારનો કાફલો લેરીયા ગામના પાદરમાં પહોંચ્યો ત્યાં તેના પર ટોળામાંથી કોઈએ કાંકરીયાળો કરીને આપ ના કાર્યકર હરેશ સાવલિયા પર હુમલો કર્યો હતો. જેને લઈને જોત-જોતામાં પથ્થરમારો થતા કારના કાચ ફેડી નાખ્યા હતા. હુમલામાં ઘાયલ હરેશભાઈને સારવાર માટે વિસાવદર સરકારી હોસ્પિટલ ખસેડવા હતા



**First Flight**  
FFCL Couriers Inc.

દુનિયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

**તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ**

<p><b>1 LB \$20 વધુ દર LB ના \$6</b></p> <p><b>11 LB \$55 વધુ દર LB ના \$6</b></p> <p><b>23 KG \$185, વધુ દર KG ના \$10</b></p> <p><b>30 KG \$230, વધુ દર KG ના \$10</b></p>	<p><b>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</b></p>
--	--

**જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ**

<p><b>Brampton (West)</b></p> <p>519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, Opposite Vegetables Market.</p> <p>Phone 647-761-1317, 647-657-9631</p> <p>-----: MON-THU : -----</p> <p>2.00 PM to 6.00 PM</p> <p>FRIDAY WEEKLY OFF</p> <p>: SAT-SUN :</p> <p>1.00 PM to 6.00 PM</p>	<p><b>Scarborough</b></p> <p><b>WE ARE RE-OPENING</b></p> <p>880 Markham Road, Unit-8 Main Intersection Markham Road &amp; Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631</p> <p>-----: MON-TUE : -----</p> <p>2.00 PM to 6.00 PM</p> <p>: SAT-SUN :</p> <p>11.00 AM to 6.00 PM</p>	<p><b>Mississauga</b></p> <p>2960 Drew Road, Unit-158, Mississauga ON L4T 045</p> <p>Great Punjab Plaza, Next to Malton Gurudwara.</p> <p>: Phone :</p> <p>905-673-9631</p> <p>647-761-1317</p> <p>647-657-9631</p> <p>-----: MON-FRI : -----</p> <p>11.00 AM to 5.00 PM</p>
---	--	--

**૬૪૭-૭૬૧-૧૩૧૭**      [www.firstflightcanada.com](http://www.firstflightcanada.com)





## હું એ શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી : રશ્મિકા

રશ્મિકા મંદાનાની બોલીવૂડમાં બે ફિલ્મો આવી રહી છે. રશ્મિકાની તેલુગુ સુપરહિટ ફિલ્મ ડિયર કોમ્પેડના હિન્દી 5th વર્ઝને ચુ-ટ્યુબ પર અટીસો મિલિયન વ્યુઝ પાર કરી લેતાં રશ્મિકાની ખુશીનો પાર નથી. તેણે કહ્યું હતું કે ડિયર કોમ્પેડ આજ સુધી મારા હૃદયમાં છે. આ ફિલ્મ સાથે ખોડાયેલા લોકો, શુટીંગની કાર્યવાહી, અનુભવ મારા માટે એટલા મહત્વના છે કે હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. આ ફિલ્મને હું જ્યારે પણ જોઉં છું કે તેના એકાદ બે દ્રશ્યો કે ગીત સાંભળું છું તો પણ ખુશીને કારણે મારી આંખમાં આંસુ આવી જાય છે.



# સ્વદેશ

## શિલ્પા શેટ્ટીની કમબેક ફિલ્મને ડિજિટલી રિલીઝ કરવામાં આવશે

મુંબઈ : કોરોના મહામારીના કારણે થિયેટરોને તાળા લાગી ગયા છે. જેથી મોટા ભાગની ફિલ્મોને ડિજિટલી રિલીઝ કરવી પડી છે. હવે આ યાદીમાં શિલ્પા શેટ્ટીની કમબેક ફિલ્મ હંગામા ટુનો પણ સમાવેશ થઈ ગયો છે. એક રિપોર્ટના અનુસાર, શિલ્પાશેટ્ટીની કમબેક ફિલ્મ હંગામા ટુને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મમેકર્સે આ ફિલ્મને ડિજિટલ વેચવા માટે તગડી રકમ માંગી હતી, પરંતુ ફર્ટ રૂપિયા ૩૦ કરોડ જ મેળવી શક્યા છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, હંગામા ટુના પ્રોડ્યુસર રતન જેને વાસ્તવમાં મોટી રકમની માંગણી કરી હતી. મૂળ ફિલ્મ હંગામા ૧૮ વરસ પહેલા રિલીઝ થઈ હતી તેમજ દિગ્દર્શક પ્રિયદર્શનની આ ફિલ્મ હિટ નીવડી હતી. પરંતુ આજની પેઢી બદલાઈ ગઈ છે. તેમજ ફિલ્મના કલાકારોની ફેસવેલ્યુ પણ ખાસ્સી નથી. ઓટીટી પર હાલના સમયમાં સારી કન્ટેન્ટ વેચાય છે. ઉલ્લેખનીય છે કે, ડિજિટલ પ્લેટફોર્મ ફિલ્મો ખરીદવાની બાબતે વધુ પડતા સજાગ થઈ ગયા છે. ગયા વરસે વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ કુલી નંબર વનને ૮૦ કરોડમાં અમેઝોન પ્રાઈમ વિડીયોએ ખરીદી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ જવાથી આર્થિક નુકસાન થયું હતું. ત્યાર પછી ઓટીટી પ્લેટફોર્મ કોઈ પણ ડીલ કરતા પહેલા વધુ પડતી સાવચેતી દાખવી રહ્યું છે.



## વાપસી સાયન્સ-ફિક્શન પર આધારિત ફિલ્મમાં કામ કરશે

મુંબઈ : તાપસી પન્નુએ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તાપસીએ પાસે સારા પ્રોજેક્ટ્સ હોવાની સાથેસાથે તેણે એક વધુ ફિલ્મ સાઈન કરી છે. કહેવાય છે કે, તાપસીએ એક યુનિક વિષયવાળી ફિલ્મમાં કામ કરવાનો રસ દાખવ્યો છે. મળેલી માહિતીના અનુસાર, તાપસી પન્નુ એક સાયન્સ-ફિક્શન ફિલ્મમાં નજરે ચડવાની છે. આ ફિલ્મમાં એક એલિયનની વાર્તા હશે. ફિલ્મનું નામ એલિયન હોવાની શક્યતા છે. આ ફિલ્મનું દિગ્દર્શન ભારત નીલકંઠ કરવાના છે. દિગ્દર્શકે તાપસીને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી છે. જે તાપસીને પસંદ પડી છે. આ ફિલ્મને વિવિધ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં દર્શાવામાં આવશે કે ભારતમાં એલિયન કઈ રીતે આવી શકે છે. કહેવાય છે કે, આ ફિલ્મ માટે વીએફએક્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. ફિલ્મના બજેટમાંથી રૂપિયા ૧૦ કરોડનો વિજયુઅલ ઈફેક્ટ માટે ખર્ચો કરાશે. તાપસી જલદી જ ફિલ્મ હસીન દિલરુબામાં જોવા મળવાની છે. તેમજ તે રશ્મિ રોકેટ, લૂપ લપેટા, દોબારા અને શાબાશ મિટ્ટુ જેવી ફિલ્મોમાં કામ કરી રહી છે.



## મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકથી મોત

મુંબઈ : મંદિરા બેદીના પતિ અને નિર્માતા-દિગ્દર્શક રાજ કૌશલનું ૪૯ વરસની વયે અચાનક નિધન થતા બોલીવૂડ આઘાતમાં સરી ગયું છે. તેમને હૃદય રોગનો હુમલો આવતા અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સવારે ૪.૩૦ વાગ્યે રાજ કૌશલને ઘરે જ હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને પછી તેમનું



દોસ્તો અને પત્ની સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. રાજ કૌશલનો જન્મ ૨૪ જુલાઈ, ૧૯૭૧ના થયો હતો. તેમણે ૨૦૦૫માં માય બ્રધર નિખીલ, ૨૦૦૪માં શાદી કે લાડુ, ૧૯૯૯માં પ્યાર મેં કભી કભી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેમજ એન્યની કૌન હૈ, શાદી કે લડુ અને પ્યાર મેં કભી કભીનું દિગ્દર્શન કર્યું હતું. તેમજ તેઓ સ્ટન્ટ ડાયરેક્ટર પણ હતા. તેમને બે સંતાનો છે.

**PayLessTravel**  
Fly Well ... Pay Less

**વિમાની સેવાના બુકીંગ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ**

**Call for all your Air Travel Services**

- Lowest Prices for Ahmedabad, Vadodara, Mumbai, Delhi
- We will beat or match any online price with better service, call once before booking online
- Best Service
- We sell Travel Insurance

**Call us for the Lowest Fares Coming From India to Canada Also**

**Please Call 905-281-2627**

**Address : 100 Matheson Blvd. East, Unit-203, Mississauga, ON. L4Z 2G7**

**Get Updated travel information during COVID time**

BRITISH AIRWAYS, KLM, Emirates, QATAR AIRWAYS, AIR CANADA, Tico # 50015262, tico.ca

**GRAND CENTRAL MIMICO**  
(South Tower)

**Guaranteed Access** to this prestigious project.

Located at Royal York Rd & Evans Ave in Etobicoke! Grand Central Mimico will feature direct access to the Mimico GO Station,

Starting from **\$500's**

**Nadir Shah** MBA  
Sales Representative

**416.625.3580**  
nadir.shah@sympatico.ca

**CENTURY 21**  
Regal Realty Inc. Brokerage  
Member Broker

4030, Sheppard Ave. East, Toronto, ON M1S 1S6 T: 416.291.0929 (24/7) F: 416.291.0984

Not Intended to solicit buyers or sellers already under a contract





# ॥ સંસ્કૃતિ ॥



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

[www.swadesh.news](http://www.swadesh.news)

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

[info@swadesh.news](mailto:info@swadesh.news)

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

મશહૂર, હિંમતવાન અને ટેકનોક્રેટ મેકઅફીના જીવનનો સ્પેનની જેલમાં અણધાર્યો અંત

## મેકઅફી : શહેનશાહી જીવન, કાયરતાપૂર્ણ મોત

શોલે ફિલ્મના એક દ્રશ્યમાં ગબ્બર તેનાં સાગરિતો સામે એક ખેલ ખેલે છે. ગબ્બર હાથમાં રિવોલ્વર પકડીને એલાન કરે છેકે - ઈસકે તીન ખાનો મેં ગોલી હે, તીન ખાલી હે. અબ હમ ઈસ કો ઘૂમાયેંગે. અબ કહાં ગોલી હે, ગબ્બરે જે ખેલ ખેલ્યો હતો તેને રશિયન રુલેટ કહેવાય છે. આવા જ એક ખતરનાક ખેલનો ખેલાડી મેકઅફીએ અઠવાડિયા પહેલાં જ પોતાના જીવનનો અંત આણી દીધો. તે જીવ્યો એક શહેનશાહી જેમ, અને મર્યો કમોતે ! કમ્પ્યુટર સિક્યોરિટી સોફ્ટવેર બનાવતી અમેરિકન કંપની મેકઅફી કોર્પોરેશનનો તે ફાઉન્ડર હતો. જહોન મેકઅફીને કમ્પ્યુટર એન્ટિવાયરસ સોફ્ટવેરના રચનાકાર તરીકે વિશ્વમાં માનવામાં આવતો હતો. આટલો મશહૂર અને હિંમતવાન ટેકનોક્રેટ જેલમાં બંધ કેમ હતો ? જેલમાં જ તેનું મોત કેવી રીતે થયું ? તેની વિગતો પણ રસપ્રદ છે.

જહોન સ્કોટલેન્ડમાં જન્મ્યો હતો. તેનાં માતા-પિતા પાછળથી તેને અમેરિકા લઈ આવ્યાં હતાં. પિતા જલ્દાદ ખુબ શરાબ પીતાં તથા જહોન અને તેની માતાને બેરહેમીથી મારતાં હતાં. જહોન ૧૫ વર્ષનો હતો જ્યારે તેનાં પિતાએ મુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જહોન ભણવામાં સ્કોલર હતો. કોલેજ સુધી પહોંચી ગયો હતો. જહોને બીએવિથ મેથેમેટિક્સના કોર્સમાં એડમિશન મેળવવા પૈસાની જરૂર હતી. જહોન ઘરે ઘરે જઈને લોકોને ઊલ્લું બનાવતો કે, તમને લોટરી લાગી છે, કોઈને કહેતો તમે ફ્રી મેગેજિનનું સબસ્ક્રિપ્શન જીત્યા છો, તમારે ફક્ત શિપિંગનો ખર્ચ આપવાનો છે વગેરે વગેરે બહાના બનાવી જહોન કમાણી કરવા લાગ્યો હતો. આ બધામાં જહોન એટલું કમાયો કે, કોલેજની ફી તો ભરાઈ ગઈ, પણ સાથે શરાબ પીવાના પૈસા તેને મળી ગયાં હતાં. ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તે એક સેક્સસ્કેમમાં ફસાઈ જતાં તેને પીએચીમાં એડમિશન મળ્યું ન હતું. જહોને નાની-મોટી નોકરી શોધી લીધી, પણ ગાંજો વેચતા ઝડપાઈ જતાં નોકરીથી પણ હાથ ધોવા પડ્યાં. જહોનની એક ખાસિયત હતી તે એકદમ આત્મવિશ્વાસ સાથે ખોટું બોલી લેતો હતો. આવાં જ આત્મવિશ્વાસ સાથે તેણે ખોટો બાયોડેટા તૈયાર કરીને રેલ્વે માટે કામ કરતી એક કંપનીમાં નોકરી મેળવી લીધી. આ દરમિયાન જહોનને ડ્રગ્સની આદત લાગી ગઈ. તેનાં કારણે આ નોકરી પણ છૂટી ગઈ હતી. બીજી તરફ લગ્નજીવન પણ તૂટી ગયું. આખરે આત્મહત્યા કરવાના વિચારો આવતાં કોઈએ મનોચિકિત્સકની સલાહ લેવાનું કહ્યું અને ધીમે ધીમે ફરી જિંદગી પાટા પર ચડી હતી. દરમિયાનમાં એક ટેક કંપનીમાં જહોનને જોબ મળી ગઈ હતી. વર્ષ ૧૯૮૬માં જહોન એક



મેગેજિન વાંચી રહ્યો હતો. આ મેગેજિનમાં જહોનને બ્રેન વાઈરસ પર એક આર્ટિકલ વાંચવા મળ્યો હતો. બસ, અહીંથી જ જહોનની જિંદગી બદલાઈ ગઈ. જહોને નક્કી કર્યું કે, તે પોતે એન્ટિવાયરસ પ્રોગ્રામ બનાવશે. તેણે એક નાની કંપની ખોલી અને પોતાનું જ નામ આપ્યું મેકઅફી અસોસિએટ્સ. તે કમ્પ્યુટરને વાયરસથી સુરક્ષિત રાખવા માટે સોફ્ટવેર બનાવવા લાગ્યો હતો. તેણે પોતાનાં પહેલાં કોડ પ્રોગ્રામને વાયરસ સ્કેન નામ આપ્યું. શરૂઆતમાં તેણે બનાવેલું એન્ટિવાયરસ મોટી કંપનીઓને ફીમાં આપવાનું શરૂ કર્યું હતું. માત્ર પાંચ વર્ષમાં જ લગભગ ૫૦ ટકા કંપનીઓ મેકઅફી એન્ટિવાયરસ યૂઝ કરવા લાગી હતી. કંપનીઓએ મેકઅફીને લાયસન્સ આપવાનું પણ શરૂ કરી દીધું હતું. ૧૯૯૦ સુધીમાં તો મેકઅફીનું વાર્ષિક

**પ્રાસંગિક  
ધવલ શુક્લ**

**ખોટું બોલવામાં માહિર મેકઅફી ગાંજો વેચતા પકડાયો અને ડ્રગ્સના રવાડે પણ ચલ્યો : એન્ટિ વાયરસ બનાવી કંપની શરૂ કરી 750 કરોડની સંપત્તિ ધરાવતા મેકઅફીએ ઈન્ટેલ પણ ખરીદી લીધી હતી**

ટર્નઓવર કરોડોમાં પહોંચી ગયું. અને છેવટે એન્ટિ વાયરસની દુનિયામાં મેકઅફીનું નામ થઈ ગયું હતું. વર્ષ ૧૯૯૪માં જહોને રાજીનામું આપી કંપનીમાંથી છુટો થઈ ગયો હતો. જહોન પાસે લગભગ ૬૦૦ કરોડના શેર્સ આવી ગયાં હતાં. વર્ષ ૨૦૧૦માં કમ્પ્યુટર ચીપ બનાવતી કંપની ઈન્ટેલને મેકઅફીએ ખરીદી લીધી હતી.

મેકઅફી અસોસિએટ્સમાંથી નીકળી ગયાં પછી પણ જહોનને ટેક બિઝનેસમાં ટકી રહ્યો હતો. તેણે ફાયરવોલ બનાવતી કંપનીઓમાં રોકાણ શરૂ કર્યું હતું. રોકાણકારની સાથે હવે જહોન બિઝનેસ ગુરુપણ કહેવાતો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ મંદી પૂર્વે કંપની પાસે ૩૧.૭૫૦ કરોડની સંપત્તિ હતી. મંદી પછી આ સંપત્તિ માત્ર ૩.૩૦ કરોડ રહી હતી. જહોન પર મુસિબતોનો પહાડ તૂટી પડ્યો હતો. ગભરાઈને જહોને દેશ છોડીને ભાગી છૂટવાનો પ્લાન બનાવ્યો. જહોને અમેરિકાની તેની બધી સંપત્તિની નિલામી કરી દીધી. ઘર, કાર, પોતાનું પ્રાઈવેટ એરપોર્ટ વગેરે બધું વેચી નાખ્યું. બધા પૈસા ભેગાં કરીને 2008માં બલીઝ પહોંચી ગયો હતો. તેનાં મનમાં હવે શહેનશાહીની જેમ જીવવાની ઈચ્છા હતી. તેણે સમુદ્રના કિનારે

એક આલિશાન ઘર બનાવ્યું, અહીં ઘરમાં ઈન્ટરનેટ ન હતું! જહોન એવું સમજતો કે, ઈન્ટરનેટ હશે તો તેને ફોલો કરવામાં આવશે અને તેની પ્રાઈવેસી ખતમ થઈ જશે. જો કે, તેમ છતાં તેણે અહીં બિઝનેસ પણ શરૂ કર્યાં હતાં.

અલબત્ત, જહોનની આ એયાશ દુનિયા વધારે ટકી નહીં. તેની ગતિવિધિઓ સરકારના નિશાને ચડી

ગઈ હતી. આરોપ હતો કે, જહોન પોતાની પ્રાઈવેટ આર્મી તૈયાર કરી રહ્યો છે, જેથી મોટાપાયે ડ્રગ્સનો કારોબાર કરી શકે. જહોન પરના આરોપો પછી સરકારે વારંવાર તેનાં ઘર પર છાપા માર્યા હતાં, પણ કંઈ મળ્યું ન હતું. આ આરોપ પૂરવાર થાય એ પહેલાં ૨૦૨૧માં જહોન પર તેનાં પડોશીની હત્યાનો આરોપ લાગતા પોલીસે પૂછપરછ માટે તેની ધરપકડ કરી હતી. જો કે, જહોન સામે પોલીસને છેવટે કોઈ પૂરાવાઓ મળ્યાં ન હતાં અને અનેક હેરેસમેન્ટ પછી જહોનને છોડી મૂકવામાં આવ્યો હતો. જહોનને લાગ્યું કે, હવે અહીં બલીઝમાં રહેવું સુરક્ષિત નથી. તેણે ત્યાંથી ભાગવાની કોશિશ કરી પરંતુ તે પછી જહોનને ગુઆટેમાલામાં અરેસ્ટ કરવામાં આવ્યો હતો.

જહોને ગુઆટેમાલા સરકાર પાસે આશરો માગ્યો પણ સરકારે તેને અમેરિકા ડિપોર્ટ કરી દીધો હતો. ૨૦૧૬માં જહોન રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો છે તેવી ખબર આવી. જો કે, તેવું કશું ન થયું અને ૨૦૧૯માં ફ્લોરિડાની એક કોર્ટ મર્ડર કેસમાં જહોનને દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. જહોન અહીં પણ આઠો ચાલ્યો અને દંડ ભરવાનો ઈન્કાર કરી દીધો. ઉપરથી ટ્રીટ કરીને ચેલેન્જ આપતાં લખ્યું કે, છેલ્લાં ૧૧ વર્ષમાં મારી ઉપર આવાં ૩૭ કેસ ચાલ્યાં છે અને એકમાં પણ દંડ ભર્યો નથી. એ પછીના વર્ષોમાં જહોન સામે ક્રિપ્ટોકરન્સીમાં ફોડ અને ટેક્સ ચોરીના કેસ ચાલ્યાં હતાં. કાર્યવાહીથી બચવા માટે જહોન ફરી દેશ છોડીને ભાગી ગયો હતો. ચોર પોલીસની લાંબી રમત પછી ૩ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સ્પેનના બાર્સેલોના એરપોર્ટ ઉપરથી તે ઝડપાઈ ગયો હતો. બાર્સેલોનાથી ફ્લાઈટ પકડીને તે ઈસ્તાનબુલ જઈ રહ્યો હતો. સ્પેનની પોલીસે તેને જેલમાં ધકેલી દીધો હતો. બીજા બાજુ અમેરિકાએ જહોનનો કબજો માગતા જહોને અદાલતને અપીલ કરી હતી કે, તેને અમેરિકા મોકલવામાં ન આવે. તેણે અદાલતને એવું કહ્યું હતું કે હું ૭૫ વર્ષનો છું. મને અમેરિકા મોકલશો તો મારી પાછલી જિંદગી જેલમાં જતી રહેશે. ગત ૨૩ જૂને સ્પેનની અદાલતે ફેસલો સંભળાવ્યો અને જહોનને અમેરિકા મોકલવાની પરવાનગી આપી દીધી હતી. બસ, સ્પેનની અદાલતે પ્રત્યાપ્તિની મંજૂરી આપી દીધાં પછી થોડાં કલાકોમાં જ જહોનનું મોત થઈ ગયું. સ્પેનની ઓથોરિટીના જણાવ્યાં મુજબ, જહોન તેની કોઠડીમાં ફંદા સાથે લટકતો મળ્યો હતો. રશિયન રુલેટનો ખેલ ખેલીને રોમાંચિત થતાં જહોન મેકઅફીએ અંતે પોતાને જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ સાથે જ : મશહૂર, હિંમતવાન અને ટેકનોક્રેટ મેકઅફીના જીવનની રસપ્રદ કથાનો પણ અંત આવી ગયો.





**SHARP**  
INTERNATIONAL  
IMMIGRATION SERVICES



# CANADA IMMIGRATION

Specialized in :

Entrepreneur/Investor Business/  
Self Employed/Farm Owner

- LMIA/WORK PERMIT
- EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- FEDERAL SKILLED WORKER/SKILLED TRADE
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS
- DETENTION REVIEWS
- CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS



**AMI MEHTA**  
IMMIGRATION PRACTITIONER

**BUSINESS IMMIGRATION  
TO CANADA REQUIRES  
3 CR NET WORTH/  
1.5 CR INVESTMENT/  
BUSINESS OWNERSHIP/  
MANAGEMENT EXP**

**REJECTED  
CASES WELCOME**

**ONLINE IELTS  
SPOKEN ENGLISH  
CLASSES ON ZOOM**

**SUPER VISA INSURANCE / TRAVEL INSURANCE  
/ PR 90 DAYS INSURANCE**

94- 499 MAIN STREET SOUTH, SHOPPERS  
WORLD MALL, BRAMPTON, ONT

**416-745-2466  
905-230-7855**

101-102 SIDDHARTH COMPLEX, BESIDES  
EXPRESS HOTEL, ALKAPURI, VADODRA-390007

**91-9428973911  
91-9512157817**

Email.: info@siis.ca

Website.: www.siis.ca





# સ્ત્રીઓની હોટ ચોઈસ છે નાઈટવેર



દિવસે અનેક પ્રકારની ડિઝાઇનનાં કપડાં પહેરતાં આપણે રાત્રીના સમયે તો એકદમ આરામદાયક વસ્ત્રો પહેરવાનું જ પસંદ કરતાં હોઈએ છીએ. દિવસના સમયે એટીકેટસમાં રહેતા આપણે રાત્રે રિલેક્સ રહેવાનું પસંદ કરતાં હોઈએ છીએ, એટલે જ રાત્રે આપણે બને તેટલાં સોફ્ટ મટીરિયલનાં અને ખૂલતાં કપડાં પહેરીએ છીએ. પહેલાં રાત્રીના સમયે જુનાં કપડાં પહેરતા પણ હવે સમય બદલાયો છે, હવે ટ્રેન્ડી નાઈટ ડ્રેસનો જમાનો આવ્યો છે, શોપિંગ મોલમાં નાઈટ ડ્રેસ માટે ખાસ અલગ સેક્શન હોય છે તો ઓનલાઇન પણ માત્ર નાઈટ ડ્રેસ જ વેચતી વેબસાઈટ જોવા મળે છે. આજકાલ નાઈટ ડ્રેસમાં પણ ઘણાં વેરિએશન જોવા મળે છે.

## શોર્ટ નાઈટ ડ્રેસ

આગળ જણાવ્યું એ પ્રમાણે નાઈટ ડ્રેસમાં પણ ઘણાં વેરિએશન જોવા મળે છે, શોર્ટ નાઈટ ડ્રેસની વાત કરીએ તો તેમાં શર્ટ અને ટીશર્ટની સાથે શોર્ટ્સનો કેન્દ્ર વધી રહ્યો છે. ટીનેજ છોકરીઓ અને નવપરિણીત સ્ત્રીઓ આ પ્રકારના નાઈટ ડ્રેસ પહેરવાનું ખાસ પસંદ કરે છે. ખૂલતાં શર્ટ અને ટીશર્ટની સાથે શોર્ટ્સ પહેરવામાં એકદમ કમ્ફર્ટબલ રહે છે.

## ટીફોક

ટીફોકનો કેન્દ્ર પણ ખૂબ જોવા મળી રહ્યો છે. ટીંગાણ સુધીની લંબાઈવાળાં એકદમ ખૂલતાં ટીશર્ટ જેવાં આ ફોક દેખાવે સુંદર લાગવાની સાથે આરામદાયક પણ એટલાં જ હોય છે. હોઝિયરી અને કોટન મટીરિયલનાં ટીફોક પણ ખૂબ ચલણમાં છે.

## નાઈટ ડ્રેસમાં શર્ટ-પેન્ટની પણ માંગ વધી

કોટન અને સોફ્ટ સિલ્ક મટીરિયલનાં બનતા શર્ટ અને પેન્ટની આજકાલ નાઈટ ડ્રેસમાં માંગ વધી રહી છે. નાઈટ ડ્રેસમાં પ્લેઝન, પોલકાં ડોટ્સ પ્રિન્ટ તેમજ કાર્ટૂન પ્રિન્ટ ખૂબ ચાલે છે. વી-નેકમાં કાર્ટૂન પ્રિન્ટવાળા શર્ટ પેન્ટનાં નાઈટશૂટ સ્ત્રીઓમાં હોટ ફેવરિટ છે. આ સિવાય લૂઝ ટીશર્ટ અને ટ્રાઉઝરનો કેન્દ્ર તો કોમન હોવા છતાં યથાવત્ જ છે, તેનું ચલણ પણ છે જ, તેમાં પણ સોફ્ટ કલર અને કાર્ટૂન પ્રિન્ટના તેમજ પ્લેઝન નાઈટ ડ્રેસ ખૂબ ચાલી રહ્યાં છે. તે સિવાય એવેડ સ્ત્રીઓ માટે ગાઉનના બદલે કફતાનનો ઓપ્શન શ્રેષ્ઠ અને ટ્રેન્ડી બની રહેશે. આજકાલ ઓનલાઇન નાઈટ ડ્રેસની ખરીદીનું ચલણ વધી રહ્યું છે, પણ ઓનલાઇન ખરીદીમાં ફેટામાં દેખાતા નાઈટ ડ્રેસ જેટલા આકર્ષક લગતા હોય છે તેટલા રિયલમાં નથી સારા લગતા હોતા. જો વિસ્કોસ, શિફોન કે બોર્ન મટીરિયલમાં હોય તો તેની ખરીદી કરતાં પહેલાં વિચારવું જોઈએ, કારણ કે રાત્રીના સમયે આ કાપડ પહેરવાની સહેજ પણ મજા નથી આવતી, વળી તે પાતળું કાપડ પણ હોવાની શક્યતાઓ હોય છે.

## સાંધાનો દુખાવો

## વધુ રહે છે?

## આટલા કરો ઉપાય

કેટલીક વખત વાતાવરણ બદલાવવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થવા લાગે છે. તો કેટલાક લોકોને સાંધાના દુખાવો થાય છે. જે અસહનીય હોય છે. પહેલા સાંધાનો દુખાવો વધતી ઉમરના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ બદલાતી લાઈફસ્ટાઈલને લઈને દરેક લોકોને આ સમસ્યા થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ખૂબ દવાઓનું સેવન કરો છો. એવામા કેટલાક એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી તમે સાંધાના દુખાવાથી રાહત મેળવી શકો છો.

**કપૂરનું તેલ :** કપૂરનું તેલ શરીરના રક્ત સંચાર યોગ્ય રાખે છે. શરીરના કોઈપણ અંગમાં દુખાવો થતો હોય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મળે છે. તેમજ હાડકામાં થતો દુખાવો પણ દૂર થાય છે અને સાંધાના દુખાવાથી કાયમ માટે રાહત મળી શકે છે.

**એરંડીનું તેલ :** એરંડીના તેલથી માલિશ કરવાથી હાડકાનો દુખાવો દૂર રહે છે. આ તેલથી માલિશ કરવાથી દુખાવાની સાથે-સાથે સૂજન પણ ઓછી થાય છે. જો તમને પણ સાંધામાં દુખાવો રહે છે તો તમે અઠવાડિયામાં બે વાર આ તેલથી મસાજ કરી શકો છો.

**આદુ - હળદર :** બે કપ પાણીને બરાબર ઉકાળી લો. તે બાદ તેમા હળદર અને આદુને પાણીમાં ઉમેરો. હવે તેને 15 મિનિટ સુધી ઉકાળો. આ પેસ્ટને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીઓ. જેનાથી સાંધાનો દુખાવો દૂર રહે છે.

**લીંબુની છાલ :** કાયના ડબ્બામાં લીંબુની છાલ અને જૈતુનનું તેલ ઉમેરો. આ ડબ્બાને બંધ કરી દો. જેથી તેમા હવા ન જઈ શકે. આ ડબ્બાને 2 અઠવાડિયા સુધી ન ખોલો. જ્યાં સુધી તે તેલમાં ન બદલાઈ જાય. હવે રેશમી કાપડ પર આ તેલ લગાવો અને સાંધાનો દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

## શું રેન્સમવેરથી બચી શકાય છે?

## REDUCE THE RISK OF RANSOMWARE

ધંધામાં નુકશાની પહોંચાડવા અને યુઝર્સના ડેટાની ચોરી કરવા હેકર્સ વધુને વધુ અસરકારક રેન્સમવેરનો ઉપયોગ કરતા હોય છે અને બદલામાં રૂપિયાની માંગણી કરતા હોય છે. રેન્સમવેરને એક માલવેર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે તમારા કોમ્પ્યુટરમાં પ્રવેશી સીસ્ટમ ફાઈલ્સ સિવાય યુઝર્સની તમામ પર્સનલ ફાઈલ્સને એનક્રિપ્ટ કરે છે. જેને સરળ ભાષામાં સમજાવે તો હેકર્સ દ્વારા તમારા કોમ્પ્યુટર પર એટેક કરવામાં આવે છે અને તમારા ડેટાને લોક કરે છે. જેથી તમે જે-તે ફાઈલને વાંચી ન શકો. અને તેને ડીક્રિપ્ટ એટલેકે અન-લોક કરવા માટે હેકર્સ પાસે કી (વર્યુઅલ ચાવી) ની માંગણી કરવી પડે છે અને બદલામાં અમુક રકમ ચૂકવવાની હોય છે. પરંતુ મોટેભાગે હેકર્સને રૂપિયા ચૂકવી દીધા બાદ પણ યુઝર્સને તેની ફાઈલ્સ તેના મૂળ રૂપમાં મળતી નથી.

સાયબર સિક્યુરિટી કંપની ગ્રુપ-આઈબી દ્વારા તાજેતરમાં કરાયેલા વિશ્લેષણમાં 2020 માં રેન્સમવેર હુમલા બમણાં થયા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે સાયબર સિક્યુરિટી વેન્ડર્સની આગાહી છે કે 2021 માં રેન્સમવેરના હુમલા દર 11 સેકન્ડમાં થશે. જેથી દરેક કોર્પોરેટ કંપની તથા હોમ યુઝર્સએ પોતાના ડેટાના રક્ષણ માટે અને

રેન્સમવેરથી બચવાની તૈયારી કરવાની જરૂર છે.

(1) જેના માટે દરેક યુઝર્સએ પોતાની પર્સનલ સીસ્ટમને લોકલ નેટવર્કથી અલગ કરવાની જરૂર છે. વધુમાં આ સીસ્ટમ પર પૂરતા ટૂલ્સ એલાય કરવાની જરૂર છે. (2) તમારા બીઝનેસમાં રેન્સમવેરથી કોઈ નુકશાની થાય તો તેના માટે ભવિષ્યના નિર્ણય હાલમાં લેવાની જરૂર છે. જેમાં દરેક શક્ય પગલાની નોંધણી કરવી જરૂરી છે. (3) સાયબર એટેકની જાણ કંપનીના CEO તથા કંપનીની સાયબર એજન્સીને કરો. ત્યારબાદ રેન્સમવેર એટેકનો વિગતવાર રીપોર્ટ સાયબર કાર્મ ડીપાર્ટમેન્ટ અને લો-એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટને આપવું જરૂરી છે. (4) બેકઅપ સીસ્ટમ માંથી ડેટાને પુનઃસ્થાપિત કરવાની યોજના બનાવવી જોઈએ. પરંતુ બેકઅપ ફાઈલ્સ પણ રેન્સમવેરથી એનક્રિપ્ટ ન થઈ જાય એની તકેદારી રાખવી જોઈએ. (5) રેન્સમવેર એટેકની જાણ થતા જ સીસ્ટમ પર મોનીટરીંગ રાખવું અને જે-તે સિસ્ટમને નેટવર્ક માંથી દૂર કરી દેવું. રેન્સમવેરના પેચની માહિતી પણ મેળવી લેવી.

વધુમાં સીસ્ટમ બેકઅપ લેવાની ફરજ પાડવી જોઈએ. જેથી રેન્સમવેર એટેક થાય તો ડેટા રિકવરી સરળતાથી થઈ શકે.

@beinghumanmj



## DIVINE YOGA

By Geeta

### Children Yoga Class

Every Tuesday 5-6 PM

---

### Adult Yoga Class

Every Saturday 9-10 AM

---

### Gratitude Program

Every Thursday 9 PM

**Join today on-ZOOM!**

**: Classes Available :**

One to One Individual  
and Therapeutic



## Geeta Tailor

### 416-456-2261

Contact Geeta at  
divineyogabygeeta@gmail.com  
IG & FB: @divineyogabygeeta



# કોળી સમાજનો ઉમેદવાર મુખ્યમંત્રી બનશે તો ચોક્કસ જ ગમશે : અધ્યક્ષ

ભાવનગરમાં સમસ્ત કોળી સમાજની ચિંતન બેઠક મળી, 200થી વધુ લોકો હાજર

ભાવનગર

કોળી સમાજનો મુખ્યમંત્રી બનશે તો ચોક્કસ ગમશે અને મુખ્યમંત્રી દરેક લોકોનું કલ્યાણ કરી શકે તેવો હોવો જોઈએ તેમ મીડિયા સાથેની વાતચીત દરમિયાન વીર માંધાતા કોળી સમાજ સંગઠનના અધ્યક્ષે જણાવ્યું હતું. ભાવનગર શહેરમાં ગુરૂવારે સમસ્ત કોળી સમાજની ચિંતન બેઠક મળી હતી, જેમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતાં. સામાજિક, રાજકીય, શૈક્ષણિક ક્ષેત્રે

કોળી સમાજ આગળ વધે તેવી કોળી સમાજના આગેવાનોએ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં સોમનાથ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સિવાય અન્ય કોળી સમાજના ધારાસભ્ય હાજર રહ્યા ના હતાં.

સમસ્ત કોળી સમાજ-ગુજરાત દ્વારા ભાવનગર શહેરના ઈસ્કોન કલબ ખાતે ગુરૂવારે સાંજના સમયે કોળી સમાજના સામાજિક, રાજકીય આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓની અગત્યની ચિંતન બેઠક બોલાવવામાં

આવી હતી. આ બેઠકમાં અધ્યક્ષ રાજુભાઈ સોલંકીએ કહ્યું હતું કે, કોળી સમાજનો મુખ્યમંત્રી બનશે તો ચોક્કસ ગમશે અને મુખ્યમંત્રી સાડા છ કરોડ લોકોનું કલ્યાણ કરી શકે તેવો હોવો જોઈએ, દરેક સમાજ રાજકીય ઈચ્છા વ્યક્ત કરી શકે છે. આગામી દિવસોમાં કોળી સમાજનું મહા સંમેલન મળશે તેમ સંગઠન અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું. કોળી સમાજની ચિંતન બેઠકમાં સોમનાથ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હાજર રહ્યા હતાં.

# વિધાનસભા ચૂંટણી પહેલાં જિલ્લામાં નવું તંત્ર, GAS કેડરમાં 79ની ટ્રાન્સફર

ગાંધીનગર

૭૭ IASની ટ્રાન્સફરના ૧૦મા દિવસે મંગળવારે સામાન્ય વહિવટ વિભાગ- GADએ ગુજરાત સ્ટેટ સર્વિસ- GAS કેડરમાં સાગમટે ૭૯ ઓફિસરોની બદલીઓના આદેશો કર્યા હતા. જિલ્લા સ્તરે કલેક્ટર, DDO પછી એડિશનલ કલેક્ટર રેન્કના ક્લાસ-૧ સિનિયર GAS ઓફિસરોમાં ફેરફારોની સાથે જ ડિસેમ્બર-૨૦૨૨માં યોજનાર વિધાનસભા ચૂંટણીને લઈને વહિવટી તંત્ર સજ્જ થઈ રહ્યા સંકેતો સ્પષ્ટ થયા છે. GADના એડિશનલ સેક્રેટરી અશોક દવેની સહીથી પ્રસિધ્ધ નોટિફિકેશનમાં ૭૯ ઓફિસરો પૈકી

૧૫ જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી- DRDANા ડિરેક્ટર તરીકે નવા અધિકારીઓ મુકવામાં આવ્યા છે. પાંચ મહિના પછી રાજ્યના ૧૦,૩૧૨થી વધુ ગ્રામ પંચાયતોમાં સરપંચોની ચૂંટણી છે ત્યારે છેક ગામડા સુધી વિકાસના ભૌતિક કામોને વહનકર્તા DRDAમાં મોટાપાયે બદલાવ થયો છે. જ્યારે ૧૯ જિલ્લામાં રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર- RACની પણ બદલીઓ થઈ છે. ઓનલાઈન બિન ખેતી- NANI અરજીઓની સ્કુટની માટે મહેસૂલ વિભાગમાં પાસ ૧૦ ઓફિસરોની ટીમમાંથી ચારની બદલીઓ કરવામાં આવી છે.

# ‘હાલમાં શિક્ષણ ફેક્ટરી જેવું જ ચાલી રહ્યું છે’ : આ.દેવવ્રત

ગાંધીનગર

ગુજરાતમાં કોરોના મહામારીના કારણે શાળા અને કોલેજો બંધ છે ત્યારે વાલીઓ શાળાઓ પાસે વિદ્યાર્થીઓની ફી માફીની અનેકવાર વાત કરી ચૂક્યા છે. પરંતુ સરકારના આદેશ બાદ પણ શાળા સંચાલકો ધરખમ ફીની માંગણી વાલીઓ પાસે કરે છે. વાલીઓનો પણ આરોપ છે કે, શાળા સંચાલકો અવનવા કીમિયા અપનાવી વિદ્યાર્થીઓ પાસે ફીની માંગણી કરે છે. ત્યારે લોકો રોષ ઠાલવતા એવું પણ જણાવી રહ્યા છે કે, શાળા સંચાલકો દ્વારા વિદ્યાના ધામને એક બિઝનેસ બનાવી રહ્યા

છે. આવામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ મોટું નિવેદન આપ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના IITENા કાર્યક્રમમાં એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ વર્તમાન શિક્ષણ પદ્ધતિ પર કટાક્ષ કર્યો છે. આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના IITENા કાર્યક્રમમાં કહ્યું કે, હાલ શિક્ષણ ફેક્ટરી જેવું ચાલી રહ્યું છે. એટલે કે, ફેક્ટરીમાં માત્ર વેતનથી કર્મચારીને મતલબ હોય છે. બાકી કોઈ વસ્તુથી નહીં. પહેલા ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ અપાતું હતું, જ્યારે હવે મતલબથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

# કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, કોંગ્રેસ પણ ખેડૂતોની પડખે આવી

મહામુલી જમીન સસ્તા ભાવે પડાવી લેવાઈ હોવાનો આક્ષેપ, કલેક્ટરની આવેદન અપાયું

થરાદ : ભારત સરકારનો ડ્રિમ પ્રોજેક્ટ ભારતમાલા બનાવવાના સરહદી વિસ્તાર વાવ, સુઈગામ અને થરાદમાંથી પસાર થાય છે. જેમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં જિલ્લાના સરહદી વિસ્તારમાંથી 489 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે.

જો કે આ પ્રોજેક્ટમાં જંતીના ભાવે ખેડૂતોની મોંઘી જમીન સસ્તા ભાવે સંપાદન કરી પડાવી લેતા ખેડૂતોની હાલત કફોડી બનતાં ખેડૂતો હવે બીજે

ક્યાંય જમીન લઈ શકે તેમ નથી તો પશુપાલનનો વ્યવસાય કરી શકે તેમ ન હોવાથી તેવો આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોની ઘડેરે બનાવવામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો આવ્યા છે. ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આક્ષેપ લગાવ્યો હતો કે, આ પ્રોજેક્ટમાં ખેડૂતોને અન્યાય થયો છે તેમની મહામુલી જમીન સસ્તા ભાવે લઈ લેવાઈ છે. જેથી ખેડૂતો

હવે બીજે જમીન લઈ શકે તેમ નથી. તેમના ઘર છીનવાઈ રહ્યા છે તો બીજી બાજુ કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક ગામોના તળાવો ખોદી રીતે ખુબજ ઊંડા ખોદી દેવાયા છે. મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરાયો છે. તેથી જો ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળે અને યોગ્ય કામ નહીં કરાય તો ધારાસભ્યોએ કામ બંધ કરાવવાની અને હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોની મોંઘી જમીન ખુબજ ઓછું વળતર આપીને સંપાદન કરી લેવાઈ છે.

# ત્રીજી લહેર પહેલાં સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું, 2400 હોસ્પિટલ ઉભી કરાશે

ગાંધીનગર

રાજ્યમાં બીજી લહેરમાં સર્જાયેલ બેડ, ઓક્સિજન અને દવા-ઈન્જેક્શન સહિતની અછતને કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ હવે ત્રીજી લહેરને લઈ ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. અને ત્રીજી લહેરમાં રાજ્ય સરકાર દ્વારા કેવી પ્રકારનું આયોજન કરવામાં આવશે તેની માહિતી આપી હતી.

રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેર મામલે આગોતરા આયોજન અંગે

ગુજરાત હાઈકોર્ટે સમક્ષ સોગંદનામું રજૂ કરતાં જણાવ્યું કે, ત્રીજી લહેર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી 2400 હોસ્પિટલ ઉભી કરાશે. બીજા વેવમાં સરકારી અને ખાનગી 1800 હોસ્પિટલની સરકારે વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

સરકારે જણાવ્યું કે, બીજા વેવમાં 61 હજાર ઓક્સિજન બેડની સામે ત્રીજી લહેરમાં 1 લાખ 10 હજાર ઓક્સિજન બેડ ઉભા કરવાનું આયોજન છે. બીજી વેવમાં ICU

બેડ 15 હજાર હતા જેને ત્રીજી વેવ માટે 30 હજાર કરવાનું આયોજન છે. બીજા વેવમાં વેન્ટિલેટર બેડ 7 હજાર હતા જે ત્રીજા વેવમાં 15 હજાર કરવાનું આયોજન છે.

આ ઉપરાંત બાળકો માટે વેન્ટિલેટર બેડમાં પણ સરકાર વધારો કરશે. 2 હજાર પીડિયાટ્રિક બેડ સરકારી હોસ્પિટલમાં હાલ ઉપલબ્ધ છે જેને 4 હજાર કરવાનું આયોજન છે. તેમજ ઓક્સિજનની ક્ષમતા વધારવાનું આયોજન પણ ગુજરાત સરકારે કર્યું છે.

# અમદાવાદમાં બનેલા ઝેન ગાર્ડનનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરાયું

અમદાવાદ

અમદાવાદ ખાતે જાપાનીઝ સ્ટાઈલથી બનેલા ઝેન ગાર્ડન અને કાર્ડેન એકેડમીનું વડાપ્રધાન મોદીએ ગત રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદઘાટન કર્યું હતું. જે બાદ મોદીએ પોતે જ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ગાર્ડનની કેટલીક તસવીરો વાયરલ કરી હતી. મોદીએ ‘ઝેન’ અને ભારતીય ‘ધ્યાન’ વચ્ચેની સમાનતાઓ તરફ ધ્યાન દોરતા બેઉ સંસ્કૃતિઓમાં બાહ્ય પ્રગતિ અને વિકાસની સાથે આંતરિક શાંતિની છણાવટ કરી હતી. ગાર્ડનનું ઉદઘાટન કરતા મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના

મુખ્યમંત્રી તરીકે તેમણે વહીવટીતંત્રમાં કાર્ડેન પર ભાર મૂક્યો હતો. 2004માં ગુજરાતમાં વહીવટી તાલીમમાં એ દાખલ કરાયું હતું અને 2005માં ટોચના સરકારી અમલદારો માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન થયું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ‘આ બાબત સતત સુધારણા’ પ્રક્રિયાઓના શિષ્ટાચારમાં પ્રતિબિંબિત થાય છે જે શાસન પર હકારાત્મક અસર તરફ દોરી જાય છે. પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ ગુજરાતનો કાર્ડેન સંબંધી અનુભવ પીએમઓ અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોમાં લઈ આવ્યા હતા.

# ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અને અરવિંદ રાઠોડનું નિધન



અમદાવાદ : ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતી ફિલ્મના કલાકારનું મોત થતાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવિંદ રાઠોડે ગુજરાતના અનેક નાટ્યમંચ, ચલચિત્રમાં અભિનય કર્યો છે. અરવિંદ રાઠોડ ગુજરાતી નાટ્યમંચ અને ચલચિત્ર જગતના જાણીતા અભિનેતા છે. તેઓ એમના સંવાદો બોલવાની આગવી શૈલી માટે જાણીતા છે. જેમ હિન્દી ફિલ્મોમાં પ્રાણના નામનો સિક્કો ચાલતો, તેમ ગુજરાતી ફિલ્મોના વિલનમાં અરવિંદ રાઠોડનો દબદબો હતો

# ડેલ્ટા+ વેરિયન્ટનો ત્રીજો કેસ નોંધાતા હડકંપ, જામનગરનો દર્દી થયો સંક્રમિત

ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ સુરતમાં નોંધાયો હતો

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઈ છે અને સતત કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટન એન્ટ્રી થઈ હતી તેવી જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે આપી હતી. રાજ્યમાં એક સાથે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસ નોંધાયા હતા પરંતુ તે ત્રણ મહિના પહેલા. પરંતુ હવે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો ત્રીજો કેસ મળતા હડકંપ મચી ગયો છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો

પ્રથમ કેસ સુરતમાં નોંધાયો હતો જે યુવાન મહારાષ્ટ્રથી આવ્યો હતો તેમા ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યો હતો. ત્યારે હવે જામનગરમાં એક દર્દી ડેલ્ટા પ્લસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. કોરોના વાયરસની બીજી લહેરમાં આખું ગુજરાત ભયાનક સ્થિતિમાં મૂકાયું હતું પરંતુ બાદમાં આ મહામારી સામે ગુજરાત જંગ જીતતું નજર આવી રહ્યું છે પરંતુ હવે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ સામે આવ્યો છે.

# ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે અંતે ડો. રાજેન્દ્ર ખીમાણીની પસંદગી

અમદાવાદ

ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે અંતે ફરી ફરીને રજિસ્ટ્રાર રહી ચુકેલા ડો.રાજેન્દ્ર ખીમાણીની જ પસંદગી કરવામાં આવી છે. ગાંધીજીના આદર્શોને વરેલી અને ગ્રામીણ ઉત્થાન ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કરતી વિદ્યાપીઠને હવે ઉમેદવાર મળતા નથી. નવનિયુક્ત કુલનાયકે આજે જ ચાર્જ સંભાળી લીધો છે. વિદ્યાપીઠના પાંચ વર્ષની મુદત માટે ૧૬મા કુલનાયક તરીકે ડો.રાજેન્દ્ર અમુલખભાઈ ખીમાણી પસંદ થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો.અનામિક શાહને કુલનાયક તરીકે બે ટર્મ મળી હતી. ત્યારબાદ નવા કુલનાયક તરીકે વિદ્યાપીઠની સર્ચ કમિટીએ ગત ડિસેમ્બર-૨૦૨૦માં ડો.ખીમાણીને પસંદ કર્યા હતા.





# પાલિકા તેમજ પંચાયતની ચૂંટણીમાં વિજય બાદ પાટીલને મંત્રીપદ મળવાના સંકેતો

ગાંધીનગર

2024ની લોકસભાની ચૂંટણી પહેલાં મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થવાના સંકેતો છે. વળી, આ વિસ્તરણમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલને મંત્રી બનાવાય તેવા વાવાડ સાંપડ્યા છે. ચાર મહિના પહેલા ગુજરાતમાં યોજાઈ ગયેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવતા આ બાબતની નોંધ લઈને પાટીલને મંત્રી મંડળમાં સમાવવા ભાજપ રાષ્ટ્રીય સંગઠન ગહન ચર્ચા કરી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગતવર્ષે જૂલાઈમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી.આર. પાટીલને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવ્યા હતા. પાટીલે ૧૧ મહિનાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર તમામ જિલ્લા-તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ, મ્યુ. કોર્પોરેશનમાં ભાજપને સત્તા અપાવી છે. બીજી તરફ ભાજપના મુખ્ય હરિક પક્ષ કોંગ્રેસનો સફાયો થયો છે. સી આર પાટીલની પેજ પ્રમુખની ફોર્મ્યુલાથી ભાજપને મોટો ફાયદો થયો હોવાનું પાર્ટી માની રહી છે.

હવે ૧૮ જૂલાઈથી લોકસભાના

ચોમાસુ સત્રની શરૂઆત થનાર છે. આથી તે પહેલા કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ થવાની હિલાચાલ છે. દક્ષિણ ગુજરાત ક્ષેત્રને કાશીરામ રાણા પછી સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી. સ્થાનિક સ્તરે એ લાગણીને ન્યાય આપવા પણ પાટીલને ભારત સરકારમાં સ્થાન મળે તેવી રાજકીય ગણતરી છે. એટલે ગુજરાતના પાટીલને પાલિકા પંચાયતોની ચૂંટણીમાં મેળવેલી સફળતા અને યોગ્યતાને આધારે મંત્રીમંડળમાં સ્થાન આપવા માટે ભાજપના જ કેટલાય નેતાઓ ભલામણ કરી રહ્યા છે.

# નડિયાદ ખાતે કોલેરાનો કેસ મળતા ખળભળાટ, સમગ્ર વિસ્તાર ભયગ્રસ્ત

નડિયાદ

ગુજરાત હજુ કોરોના વાયરસની બીજી લહેરમાંથી બહાર નીકળ્યું નથી, તેવામાં નડિયાદ શહેર એક ભયાનક રોગમાં સપડાયું છે. નડિયાદ શહેરને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાતા હડકંપ મચી ગયો છે. આસપાસના ગામડાઓમાં લોકો ડરી રહ્યા છે. નડિયાદ શહેર અને આસપાસનો 10 કિ.મી. વિસ્તારને ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ માટે ખેડા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે. જેમાં શહેરમાં ઝાડા-ઉલટીના કેસો નોંધાતા તાબડતોડ રીતે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

એક મહિના સુધી નડિયાદ કલેક્ટરનું જાહેરનામું અમલમાં રહેશે. નવાના ચીફ ઓફિસરને પણ આ રોગને કાબૂમાં લેવા માટે જરૂરી પગલા લેવા સૂચના આપી દેવામાં આવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે નડિયાદ શહેરના કનીપુરા વિસ્તારમાંથી કોલેરાનો કેસ મળી આવ્યો છે, બુધવારે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી આરોગ્ય વિભાગે 10 જેટલા સેમ્પલ લીધા હતા. જેના ટેસ્ટિંગ દરમિયાન કોલેરા પોઝિટિવ મળી આવતા તંત્ર દ્વારા નડિયાદ પાલિકા વિસ્તારને કોલેરાગ્રસ્ત તેમજ આસપાસના 10 કિ મી ના વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.

# અમદાવાદમાં 12મીએ જગન્નાથજીની રથયાત્રા નીકળશે, સરકારની મંજૂરી

અમદાવાદ

જમાલપુર સ્થિત જગદીશ મંદિરથી નીકળતી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ચાલુ વર્ષે પણ આગામી તા. ૧૨મી જુલાઈને અષાઢી બીજના દિવસે નીકળશે અને તે માટે પોલીસ કમિશનર દ્વારા રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે.

બે કિલોમીટર લાંબી રથયાત્રામાં આ વખતે મોટરટ્રક, અખાડા, ભજન મંડળી અને ગજરાજની સંખ્યામાં જબરદસ્ત કાપ મુકાતા રથયાત્રા દર વર્ષની જેમ પૂર્ણ કક્ષાની નહીં હોય. ગૃહવિભાગના અધિકારીઓની લગાતાર પંદર દિવસ સુધીની મેરેથોન બેઠકો બાદ રાજ્ય

સરકારે રથયાત્રા કાઢવા માટે લીલીઝંડી આપી દેતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા જ્યાં બપોરે બે કલાક વિરામ કરે છે તે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના મોસાળ સરસપુર સ્થિત રણછોડરાયજી મંદિર ખાતે પણ તૈયારીઓને આખરીરૂપ આપી દીધું છે તો વળી રથયાત્રા અને જગદીશ મંદિરના મહંત દિલીપદાસજીનું જ્યાં નાગરિક સન્માન ક્લો કે ભવ્ય સ્વાગત કરવામાં આવે છે તે દાણાપીઠ સ્થિત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની મધ્યસ્થ કચેરી ખાતે પણ તૈયારીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે.


# 91 દેશના રાષ્ટ્રગીત મોઢે ગાનાર ગુજરાતી યુવકને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

ઈન્ટરનેટથી રાષ્ટ્રગીતોની નકલ મેળવી યુવકે ગાવા સુધીની પ્રેક્ટીસ કરી

વડોદરા

વડોદરા શહેરના કલાલી રોડ પર રહેતા અને વિદ્યાર્થી અર્થ મૂળેને વિશ્વના 91 દેશોના રાષ્ટ્રગીત કંઠસ્થ છે અને તેના અર્થ પણ જાણે છે. અર્થ મૂળેને તેની આ સિદ્ધિ બદલ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

વડોદરાના કલાલી રોડ પર રહેતો અને શહેરની કોલેજમાં અભ્યાસ કરતો અર્થ અમિતભાઈ મૂળે દુનિયાના 91 દેશોના રાષ્ટ્રગીત કડકડાટ મોઢે ગાઈ શકે છે અને તે તમામ રાષ્ટ્રગીતના



અર્થને સમજી પણ શકે છે. આજથી પાંચ વર્ષ પહેલાં માત્ર જિજ્ઞાસાવશ ઈન્ટરનેટ

પર ભારતના રાષ્ટ્રગીતના વિવિધ અંતરા શોધવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન દેશના પ્રસિદ્ધ ગાયકના કંઠે ગવાયેલું દેશનું રાષ્ટ્રગીત જન ગણ મન તેને સાંભળ્યું હતું. આ ગીત સાંભળ્યા

બાદ ઈન્ટરનેટ પર જ પાકિસ્તાનનું રાષ્ટ્રગીત પણ તેને સાંભળ્યું હતું અને ત્યાર બાદ વિવિધ દેશના રાષ્ટ્રગીત કેવા હશે? કેવી રીતે ગવાતાં હશે અને તેના ભાવાર્થ શું હશે? તે અંગેનો અભ્યાસ શરૂ કર્યો હતો. અર્થની જિજ્ઞાસાને કારણે તે આજે દુનિયાના 91 જેટલા દેશોના રાષ્ટ્રગીતને મોઢે કરી શક્યો છે. અર્થએ ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ દેશોના રાષ્ટ્રગીતની હાડ કોપી મેળવી તેને કેવી રીતે ગાઈ શકાય તેનો પણ બારીકાઈથી અભ્યાસ કર્યો છે.

# પાલસંડામાં યુવકના પ્રેમની માતાને સજા, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી યુરીન પીવડાવ્યું

વડોદરા

ઉત્તર ગુજરાતમાં યુવક યુવતીના પ્રેમની તાલીબાની સજા તેમના માતાને આપવામાં આવી હતી. આ ઘટનામાં એક યુવકે પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેની સજા યુવકની માતાને આપવામાં આવી હતી. પ્રેમસંબંધની જાણ થતાં જ યુવતીના પરિવારના લોકોએ યુવકની મહિલાને ઢોર માર મારી તેની અમાનવીય કૃત્ય કર્યું હતું. વાત એટલે સુધી પહોંચી કે યુવતી પક્ષના પુરુષોએ તે યુવકની માતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને યુરીન પીવડાવ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં બનેલી આ ઘટના છોટા ઉદેપુર નજીક આવેલા પાલસંડા ગામની છે. પાલસંડામાં રહેતા એક યુવકે તેના જ ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લેતાં ભડકો થયો હતો. આ બાબતે યુવતી પક્ષના સભ્યો ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. જે બાદ તેઓએ સમગ્ર બાબતનો રોષ યુવકની માતાને તાલીબાની સજા આપીને ઠાલવ્યો હતો. મળતી વિગતો મુજબ યુવકે તે યુવતી સાથે લગ્ન કરી લીધા છે તેવી જાણ થતાં યુવતીના સગાસંબંધીઓ એકત્ર થઈને યુવકને ઘરે પહોંચ્યા હતા અને

યુવકની માતાને ઢોર માર માર્યો હતો. સગાસંબંધીઓ મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ પૈશાબ પીવા મજબૂર કરી હતી.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસને જાણ થઈ હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ વીડિયો ઉત્તર ગુજરાતના પાલસંડા ગામનો હોવાની પુષ્ટિ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને આરોપીઓની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ભોગ બનનાર મહિલાને પણ શોધી કાઢી હતી.

# 50 વર્ષીય આદેડ ગીતેશ ચંદ્રવદને અંગદાનથી 5 જિંદગી અજવાળી કરી

સુરત

રંદેર રોડ પર આવેલ નવયુગ કોલેજ પાસે કોટયાકનગરમાં રહેતા મોઢ વણિક સમાજના 50 વર્ષીય આદેડના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. મૃતક પણ અંગદાન માટેના અભિયાનમાં સ્વયંસેવક તરીકે કામ કરતા હતા. તેમના મૃત્યુ બાદ પરિવારે અંગદાનનો નિર્ણય કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રંદેર રોડ પરની નવયુગ કોલેજ પાસે કોટયાકનગરમાં રહેતા 50 વર્ષીય ગીતેશ ચંદ્રવદને મોદી પાઈપ અને સેનિટરી ફિટિંગ્સ, ટ્રેડિંગ અને વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા.

દરમિયાન ગત તા. 23મીને સવારે ગીતેશ મોટરસાઈકલ પર રેલવે સ્ટેશન તરફ જતા હતા ત્યારે રિંગ રોડ પર ખુશી બજાર નજીક અકસ્માત સર્જાયો હતો. તેમાં તેમને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા ત્યાં ગત તા. 27મીના રોજ ડોક્ટરોએ ગીતેશને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સમગ્ર મામલે ડોનેટ લાઈફને જાણ કરાતા ગીતેશના પરિવારને અંગદાન વિષે માહિતીગાર કર્યા હતા. ઉપરાંત મૃતક ગીતેશ પણ સમાજમાં અંગદાન વિષે અનેકોને પ્રેરણા આપી હતી. જેથી પરિવારજનો અંગદાન માટે સંમત થયા હતા.

# ઈસરોમાં સિદ્ધિ મેળવનાર અરવલ્લીની ટ્રિવશા પટેલ પદ્મશ્રી એવોર્ડ માટે લિસ્ટેડ

અરવલ્લી



મોડાસામાં ધોરણ 12માં અભ્યાસ કરતી ટ્રિવશાએ તેને જોયેલા સ્વપ્ન સાકાર કર્યું છે. ભારત સરકાર તરફથી અપાતા પદ્મશ્રી એવોર્ડ માટે મેઘરજ તાલુકાની ગોઢા ગામની ટ્રિવશાની પસંદગી કરવામાં આવી છે. મેઘરજ તાલુકાના અંતરિયાર વિસ્તારમાં આવેલ ગોઢા ગામની ટ્રિવશાબેન જયેશભાઈ પટેલ નામની 18 વર્ષીય ટ્રિવશા પટેલને નાનપણથી જ વિજ્ઞાન વિશે રુચિ ધરાવતી હતી. તેને આકાશ મંડળ વિશે અવનનું જાણવા હંમેશા તત્પર રહેતી હતી. અને હાલ ટ્રિવશાએ ધોરણમાં 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી છે.

# રાજકોટમાં 50 કરોડના કૌભાંડમાં 11 સામે 10 હજાર પાનાંની ચાર્જશીટ

રાજકોટ

રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આકૃતી બ્રીજ બિલ્ડિંગમાં તથા ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસે આવેલ ધ સ્પાયર બિલ્ડિંગમાં ધમધમતી સમય ટ્રેડિંગ, સાંઈ સમય ટ્રેડિંગ અને આશીષ ટ્રેડિંગ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી લીમીટેડમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઉપરાંત નડિયાદ અને તેની આસપાસના પોલીસ ફરીયાદ મુજબ ૫૮૪ રોકાણકારોના રૂ.૪૮.૨૬ કરોડ ડુબી ગયા હતા. વાસ્તવમાં તેના કરતા પણ મોટા આ કૌભાંડમાં ગરીબ, મધ્યમ વર્ગ ઉપરાંત ઉચ્ચ

વર્ગના હજારો રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. આ કૌભાંડમાં પકડાયેલા ૧૧ આરોપી વિરૂધ્ધ ગઈકાલે તપાસ કરતી ગાંધીગ્રામ-૨ પોલીસે કોર્ટમાં ૧૦૨૮૦ પાનાનું ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. કૌભાંડના મુખ્ય સુત્રધાર અને તમામ મંડળીનો ચેરમેન પ્રદિપ ખોડાભાઈ ડાવેરા વલસાડ રહેતો હતો. જ્યાં તે શેર બજારના ટ્રેડિંગનું કામ કરતો હતો. ૨૦૧૭ માં રાજકોટ આવ્યો હતો. આવીને તેણે શેરબજારમાં રોકાણ કરવાથી વધુ વળતરની લાલચ આપતા કેટલાક રોકાણકારો તેની જાળમાં ફસાયા હતા.

# વિસ્થાપિતોને રહેણાક આપવા મુદ્દે હાઈકોર્ટે રેલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી

અમદાવાદ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જે.પી.ની ચાલીમાં ૨૦૧૮માં ઘણાં પરિવારની જમીન ૨૦૧૮માં ખાલી કરાઈ હતી. વિસ્થાપિતોને હજુ સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા હાઈકોર્ટમાં કરાયેલી રિટમાં કોર્ટે નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનને ટકોર કરી હતી કે રેલ કોર્પોરેશને સર્વે કરી વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું વચન પાળ્યું નથી અને તેઓ બીજી જગ્યાએ વસવાટ કર્યો હતો. ત્યાંથી પણ તેમને હટાવાયા છે. જેની સામે રેલ કોર્પોરેશને જવાબ આપ્યો હતો કે તેઓ વેસ્ટર્ન રેલવે દ્વારા અપાયેલી જમીન પર કામગીરી રહ્યા છે.



# અમદાવાદમાં પૌત્રને જાનથી મારી નાખવાની ધમકી આપીને સસરાનું પુત્રવધૂ સાથે દુષ્કર્મ

લોકડાઉનમાં પરિણીતાને ઘરમાં એકલી જોઈને સસરાની દાનત બગડી : ફરિયાદ થતાં ધરપકડ

**અમદાવાદ**  
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ૩ વર્ષ પહેલા એક મહિલાના લગ્ન થયા હતા. તેનો પતિ તથા સાસુ-સસરા મજૂરી કામ કરે છે અને તેની ૨ નણંદના પણ લગ્ન થઈ ચૂક્યા છે. મહિલાને પોતાના પતિથી ૧ વર્ષનો દીકરો છે. માર્ય મહિલામાં લોકડાઉન દરમિયાન પરિણીતાને ઘરમાં એકલી

જોઈને સસરાની દાનત બગડી હતી અને તેણે દીકરાને મારી નાખવાની ધમકી આપીને પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતા આ બંધ જાય નહીં તે માટે ચુપ રહી હતી. જોકે પછી આ દરરોજની ઘટના બની ગઈ હતી. તેના સસરાએ અવારનવાર તેને અડપલાં કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાનો પતિ મજૂરી કરવા ઘરેથી નીકળે ત્યારે તેનો સસરો તેની

એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કરતો હતો અને તેના એક વર્ષના દીકરાને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. મહિલાથી સસરો પુત્રવધૂનું શોષણ કરતો હતો. પરિણીતાએ પહેલા સાસુ અને પતિને સસરાની કરતૂતની જાણ પણ કરી હતી પરંતુ પતિ કે સાસુએ તેની વાતનો વિશ્વાસ નહીં કરતા તેને કોઈ મદદ મળી

નહોતી. પોતાનાં જ પૌત્રને મારી નાખવાની ધમકી આપીને મહિલાની એકલતાનો લાભ લઈ અવારનવાર સસરાએ દુષ્કર્મ આચરતો હતો. ત્યારે પરિણીતાની વાતનો સાસુ કે પતિએ વિશ્વાસ નહીં કરતા કંટાળીને તેણે અંતે મહિલાએ પોલીસની મદદ લીધી છે. પોલીસે વહુની ફરિયાદના આધારે આરોપી સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

**ક્લાસીફાઈડ / Classified**

**A COUPLE OR SINGLE PERSON NEEDED FOR HOUSEKEEPING**

A couple or a single person needed for housekeeping jobs in Longlac (Northern Ontario). Please contact Amit at 519 590 5410 or feneloninn@yahoo.com

**બેઝમેન્ટ ભાડેથી આપવાનો છે.**  
(કીલ-લોરેન્સમાં)

કીલ-લોરેન્સ ઈન્ટરસેકશન ખાતે સંપૂર્ણ રીનોવેટેડ અને વોકઆઉટ બેઝમેન્ટ ભાડેથી આપવાનો છે જે તમામ ઉપકરણોથી સજ્જ. બધી બેંકોથી વોકબલ ડીસ્ટેન્સ, ટીવી/મેટ્રો/વોલમાર્ટ/કલીનિક અને અન્ય સ્ટોર્સથી પણ નજીક. સ્ટુડન્ટસને પહેલી તક અપાશે.

સંપર્ક કરો :- ૪૧૬-૮૨૫-૪૭૧૪ or Email :- basil\_daniel@yahoo.ca. વહેલા તે પહેલાના ઘોરણે

## કેનેડાના વિજા આપવાની પ્રક્રિયા દોઢ વર્ષ બાદ શરૂ

**અમદાવાદ**  
ઘણાં લાંબા સમય બાદ ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં કોરોનાનું જોર ઘટી રહ્યું છે ત્યારે કેનેડા સરકારે આવતા મહિનાથી ભારત-કેનેડા વચ્ચેની વિમાની સેવા શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. બીજી તરફ તમામ પ્રકારના વિજા માટેની કામગીરી પણ શરૂ કરાઈ છે. અમદાવાદમાં પણ વિજા માટે અપ્લાય કરનારા લોકો માટે ફિંગર પ્રિન્ટ અને બાયોમેટ્રિક માટેની કામગીરી શરૂ થઈ છે. આ માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કેનેડાના વિજાની પ્રોસેસ માટે ૧૫ દિવસ પછીની અપોઈન્ટમેન્ટ મળતી થઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશોમાં પણ ભારતની ફ્લાઈટ શરૂ થાય તેવી પ્રબળ સંભાવના દેખાઈ રહી છે. ભારતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જતા હોય છે.

## 100 વિદ્યાર્થીઓને જલસા : બધા વિષયમાં શૂન્ય છતાં SSC પાસ

**અમદાવાદ**  
કોરોના મહામારીમાં જો કોઈને જીવનભરનો ફાયદો થયો હોય તો તે ગુજરાતમાં ધો. ૧૦ના બોર્ડના એ ૧૦૦ વિદ્યાર્થીઓ છે જેમણે એક પણ વિષયમાં કોઈ જ માર્ક મેળવ્યા વગર પર બોર્ડ પાસ કરી લીધું છે. મંગળવારે રાત્રે બહાર પડેલા ધો. ૧૦ના પરિણામમાં મહામારીના કારણે ધો. ૧૦માં આપવામાં આવેલા માસ પ્રમોશનમાં ૧૦૦ વિદ્યાર્થીઓને બોર્ડે ૧૯૮ ગ્રેસ માર્ક આપી પાસ કર્યા છે. હવે જો ગણતરી બેસાડીએ તો ધો. ૧૦માં બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓને પોતાના ૬ વિષયમાં ૩૩ માર્ક લેવાના હોય છે. તેવામાં જ્યારે જો બોર્ડે આ વિદ્યાર્થીઓને ૧૯૮ ગ્રેસ માર્ક આપ્યા છે તો

તેનો અર્થ એ થયો કે આ વિદ્યાર્થીઓએ શું ખરેખર દમમાંથી એક પણ વિષયમાં પોતાની જાતે એક પણ માર્ક મેળવ્યો નથી? ખરેખર આંચકા જેવી વાત છે. ભૂતકાળમાં ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ચઢાઉ પાસ કરવા માટે ટોટલ ૨૪ ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે. જો કે આ માટે શરત હતી કે વિદ્યાર્થીએ ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ. તેમજ બે જ વિષયમાં મળીને કુલ ૨૪ માર્ક બોર્ડ આપવામાં આવતા હતા. જોકે આ વર્ષની વાત અલગ છે. આ વર્ષે બોર્ડે ધોરણ ૧૦નું પરિણામ મહામારીને ધ્યાને રાખીને મેરિટ આધારિત બનાવ્યું છે.

## રાજકોટમાં પતિના આપઘાત બાદ પત્નીનો આત્મહત્યાનો પ્રયાસ

**રાજકોટ**  
રાજકોટ શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં પાંચ દિવસ પૂર્વે મૂળ બાબરા પંથકના યુવાને પત્ની તથા મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે યુવકના ભાઈએ તેની પત્ની દ્વારા રૂપિયા ૧૫ લાખની માગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે પતિએ ઝેરી દવા પીધા બાદ પત્નીએ પણ એ જ જગ્યાએ ઝેર પીધું છે કે જ્યાં તેના પતિએ પાંચ દિવસ પૂર્વે ઝેર પીધું હતું. ઉલ્લેખનીય છે કે ઝેરી દવા પીવાના કારણે પતિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આજે પણ તે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં છે.

# શું માનવીના કર્મોનો બોજો કોઈ બીજો ઉપાડી શકશે ?

**ભાગ-૧**  
પુરા જગતમાં રહેતા મનુષ્યો, જેમનો કોઈ ન કોઈ ધર્મ સાથે સંબંધ છે, તેઓ સર્વે એક વાતમાં સહમત છે કે પરમેશ્વરને રાજી કરવા માટે એટલે કે બંને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સદ્કાર્યો આવશ્યક છે. એક દિવસ વિનાશ પામનારા આ જગતમાં રહેતો પામર મનુષ્ય પોતાના પરમેશ્વરના આદેશો અનુસાર અને તેને રાજી રાખવા માટે સદ્કાર્યો કરવાની કોશિષ કરે છે. તેમ છતાં આ જગતમાં કંઈ કરોડોની સંખ્યામાં એવા પણ મનુષ્યો છે જેઓ પોતાના પરમેશ્વરના આદેશોની અવગણના કરતા નહારા કાર્યો પણ કરે છે. આ નહારા કાર્યો કરનારાઓ એ વાત પણ સારી રીતે જાણે છે કે તેમના આ નહારા કાર્યોની પુરી જવાબદારી તેમના પોતાના ઉપર જ છે, અને તે જવાબદારીનો બોજ(ભાર) બીજા કોઈના શીરે નહીં હોય, પણ તેમના આ કાર્યોનો બોજ કેવળ તેમના પોતાના જ ઉપર છે. તેવી જ રીતે સદ્કાર્યો કરનારા માનવીઓ પણ એ વાત સારી રીતે જાણે છે કે તેઓ જે સદ્કાર્યો કરે છે, તે કેવળ પોતાના માટે જ કરે છે અને ન કે કોઈ અન્ય માનવી માટે, અને તેઓ પોતાના આ સદ્કાર્યોનો બદલો બદલાના અંતિમ(કયામત)ના દિવસે મેળવવાની આશા રાખે છે. આ સત્ય અનુસાર સદ્કૃત્યો કે નહારા કૃત્યો કરવાની પુરી જવાબદારી એટલે કે માનવીના કર્મોનો બોજ(ભાર) કેવળ તેનાજ શીરે છે અને ન કોઈ અન્ય માનવીની એ જવાબદારી છે કે કોઈ અન્ય માનવીના શીરે છે.

હવે એક પ્રશ્ન એ ઉભો થાય છે કે શું માનવીના પોતાના ધર્મ ના અનુસાર જે જે કર્યો તેના પરમેશ્વર અને પાલનહાર તરફથી તેના ઉપર ફરજિયાત કરવામાં આવેલ છે, તે કર્યો એટલે કે જવાબદારીઓ અને તેણે આ જગતમાં જે જે સુકર્મો અથવા કુકર્મો કરેલ છે તેની જવાબદારીનો બોજો (ભાર) શું કોઈ અન્ય માનવી, તેના સગા સંબંધી સહિત, ઉપાડી શકે



**મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના બોધવચનો પર આધારિત**

શીરે લઈને અને તેમને મોક્ષ અપાવી દીધેલ છે. ઉત્તરમાં એ કહી શકાય કે જગતના અમુક ધર્મોમાં કદાચ આ પ્રકારની છુટછાટ હોય શકે છે. ઉદાહરણ તરીકે ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે પરમેશ્વરે ઈસુ ખ્રિસ્તી (મુસ્લિમો જેમને હઝરત ઈસા (અ.સ.) તરીકે એક પયગંબર માને છે)ને માનવીઓના સર્વે પાપો પોતાના ઉપર લઈ લેવા માટે જગતમાં મોકલેલ હતા અને ખ્રિસ્તીઓની માન્યતા અનુસાર માનવીઓના પાપોને ધોવા માટે અને તેમને મોક્ષ અપાવવા માટે તેઓ પોતે શુભી પર ચઢીને પોતાના પ્રાણનું બલિદાન આપેલ. જો કે મુસ્લીમો આ માન્યતાને નથી સ્વીકારતા અને તેઓ એ વાતને પણ નથી માનતા કે તેમને શુભી પર ચઢાવવામાં આવેલ હતા. પરંતુ ખ્રિસ્તીઓની માન્યતા અનુસાર આ રીતે પોતાના પ્રાણનું બલિદાન આપીને ઈસુ ખ્રિસ્તીએ માનવીઓના પાપ એટલે કે કર્મોનો બોજ પોતાના

ઈસ્લામ ધર્મ અનુસાર માનવી જે સદ્કાર્યો અથવા નહારા કાર્યો કરે છે, તેના માટે તે પોતેજ જવાબદાર છે. અંતિમ બદલા (કયામત)ના દિવસે તેના કર્મોનો બોજો(ભાર) તેને જ ઉપાડવાનો છે અને તેના આ કર્મોનો બોજો ઉપાડનાર કોઈ પણ નહીં હોય, ભલે તે તેનો બહુ જ નજીકનો સગો સંબંધી થતો હોય. આ સત્ય વિષે મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદમાં અસંખ્ય બોધવચનો આપવામાં આવેલ છે.

પહેલા નીચે કુરાન મજીદમાંથી ચાર બોધવચનો આપવામાં આવે છે, જેમાં કહેવામાં આવેલ છે કે જે કોઈ પુરૂષ કે સ્ત્રી સદ્કાર્યો કરશે અથવા નહારા કાર્યો કરશે, તો અંતિમ બદલા (કયામત)ના દિવસે તેઓને તેમના કર્મો અનુસાર જ બદલો આપવામાં આવશે. એટલે કે સદ્કાર્યો કરનારાઓ માટે સ્વર્ગ(જન્નત)માં પ્રવેશ હશે અને ન કે નહારા કૃત્યો કરનારાઓ

માટે. અને કર્મોના બદલા માટે કોઈને રજામાત્ર પણ અન્યાય નહીં થવા પામે. આ ચાર બોધવચનો આ પ્રમાણે છે.

“જે કોઈ નહારૂં કાર્ય કરશે, તો તે તેનો બદલો અવશ્ય પામશે અને તે પોતાના માટે અલ્લાહના સિવાય કોઈ પણ બીજો સહાયક અને હીમાયતી નહીં મેળવી શકે. અને જેણે પણ કોઈ સદ્કાર્યો કર્યા, ચાહે તે પુરૂષ હોય કે સ્ત્રી, અને શ્રદ્ધાળુ (મોમીન-ઈમાનની સાથે) હોય, તો આવા જ લોકો સ્વર્ગ (જન્નત)માં પ્રવેશ પામશે અને તેમને રજામાત્ર અન્યાય નહીં થવા પામે.” (પ્રકરણ ૪, શ્લોક ૧૨૩ અને ૧૨૪)

“જે કોઈ વ્યક્તિ એ સદ્કાર્ય કર્યું, ચાહે તે પુરૂષ હોય કે સ્ત્રી અને તે શ્રદ્ધાળુ (મોમીન) હોય, તેને અમે જગતમાં પવિત્ર અને સ્વચ્છ જીવન જીવાડીશું અને અંતિમ દિવસે(કયામતમાં) આવા લોકોને તેમનો બદલો તેમના સર્વશ્રેષ્ઠ કાર્યો અને સદ્કાર્યો અનુસાર આપીશું.” (પ્રકરણ ૧૬, શ્લોક ૯૭)

“જે લોકો શ્રદ્ધાળુ (મોમીનો) હશે અને જેમણે સદ્કાર્યો કર્યા હશે, તે ચોક્કસપણે અલ્લાહના સર્જનોમાં સૌથી શ્રેષ્ઠ છે. તેમનો બદલો તેમના પાલનહારને ત્યાં હંમેશા રહેવા માટે સ્વર્ગો (જન્નતો) છે, જેમની નીચે નદીઓ (નહેરો) વહી રહી હશે. તેઓ તેમાં હંમેશા રહેશે. અલ્લાહ તેમનાથી રાજી થયો અને તેઓ અલ્લાહથી રાજી થયા. આ બધું તે વ્યક્તિ માટે છે, જેણે પોતાના પાલનહારથી ડર રાખ્યો હોય.” (પ્રકરણ ૯૮, શ્લોક ૭ અને ૮)

“જેણે નહારા કાર્યો કર્યા, તેને તેના નહારા કાર્યો અનુસાર જ બદલો મળશે. અને જેણે સદ્કાર્યો કર્યા, ચાહે તે પુરૂષ હોય કે સ્ત્રી અને તેઓ શ્રદ્ધાળુ (મોમીન-ઈમાનવાળાઓ) હોય, તો એવા સર્વે લોકો સ્વર્ગ (જન્નત)માં પ્રવેશ પામશે, જ્યાં તેઓને બે હિસાબ આજીવિકા (રીઝક) આપવામાં આવશે.” (પ્રકરણ ૪૦, શ્લોક ૪૦)





# દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ૪ લાખ નજીક પહોંચ્યો

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ છ લાખથી ઓછા, છેલ્લા 24 કલાકમાં વધુ 48,786 લોકો સંક્રમિત થયા : એક દિવસમાં વધુ 1005 દર્દીનાં મોત

મુંબઈ

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી આંશિક વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ૪૦ હજારની નીચે પહોંચેલો આંકડો હવે ૫૦ હજારની આસપાસ રહે છે. ૩૦ જૂનના ચોવીસ કલાકમાં ૪૮ હજારથી વધુ સંક્રમિત કેસો સામે આવ્યા છે. બીજી તરફ, મોતના આંકડાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, દેશમાં કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામનારા

દર્દીઓની સંખ્યા ૪ લાખને સ્પર્શવા આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૮,૭૮૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૦૦૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૪,૧૧,૬૩૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૩,૫૭,૧૬,૦૧૯ લોકોને કોરોના વેક્સીનના ડોઝ

આપવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં ૬૧,૫૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૫,૨૩,૨૫૭ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૯૯,૪૫૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કોલેજિયલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩૦ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૧,૨૦,૨૧,૪૮૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

## ઝાયડસે રસી માટે DCGI પાસે મંજૂરી માગી

કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને વધુ એક સ્વદેશી રસી મળશે. ઝાયડસે કેડિલાએ પોતાની રસી ઝાયકોવ-ડી માટે ડીસીજીઆઈની મંજૂરી માંગી છે. પોતાની રસી ઝાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગ માટે ઝાયડસે માગી મંજૂરી માંગી છે. ૧૨ વર્ષથી વધુ વયના તમામ લોકો માટે આ રસીનો ઉપયોગ થાય તેવી શક્યતા છે. ઝાયડસે માંગેલી મંજૂરીમાં ૧૨ વર્ષથી વધુ વયના તમામ લોકોનો સમાવેશ થાય છે. ડીસીજીઆઈની મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં રસીને માર્કેટમાં ઝાયડસે કંપની ઉપલબ્ધ કરાવશે. ઝાયડસેની રસી પહેલી ડીએનએ બેઝ રસી છે. જેની મંજૂરી હાલ માંગવામાં આવી છે. ઝાયડસેની રસીને મંજૂરી મળશે એટલે એ દેશમાં ઉત્પાદન થતી ચોથી રસી બનશે. રસી ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને તેમાં ૨૮,૦૦૦થી વધુ સ્વયંસેવકો સામેલ થયા હતા. ડીસીજીઆઈની મંજૂરી મળ્યા બાદ ભારત બાયોટેકની કોવેક્સીન પછી આ બીજી સ્વદેશી રસી હશે. આ કોરોના વાયરસ સામે વિશ્વની પ્રથમ ડીએનએ રસી પણ હશે. ઝાયકોવ-ડી એ ડીએનએ રસી છે, જે વાયરસના તે ભાગના આનુવંશિક કોડનો ઉપયોગ કરે છે.

## ભારતના નકશા સાથે ચેડાં બદલ ટ્વીટર સામે ચુપી, MPમાં ફરિયાદ

નવી દિલ્હી

નવા આઈટી નિયમોના અમલ અંગે કેન્દ્ર સરકારે ટ્વીટર સામે આકરું વલણ અપનાવ્યું છે. આવા સમયમાં ટ્વીટરે ભારતના નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ તરીકે દર્શાવતા નવો વિવાદ સર્જાયો હતો. હવે આ મુદ્દે ઉત્તર પ્રદેશ અને મધ્યમ પ્રદેશમાં ટ્વીટર સામે એફઆઈઆર નોંધાઈ છે. બીજીબાજુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી હોવાના પગલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઈટ્સની ફરિયાદને પગલે દિલ્હી પોલીસે પણ ટ્વીટર સામે કેસ નોંધ્યો છે. નવા આઈટી નિયમોના

અમલ અંગે કેન્દ્ર અને ટ્વીટર વચ્ચે તકરાર ચાલી રહી છે અને ઉત્તર પ્રદેશમાં એક વૃદ્ધ મુસ્લિમને મારવા સંબંધે વાંધાજનક વીડિયો પોસ્ટ કરવા મુદ્દે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મુશ્કેલીમાં મુકાયું છે. દેશના નકશા સાથે ચેડાંના વિવાદ મુદ્દે ભારે હોબાળો મચતાં ટ્વીટરે તેની વેબસાઈટ પરથી ભારતનો ખોટો નકશો હટાવી દીધો હતો. જોકે, દેશના નકશા સાથે ચેડાં બદલ ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લામાં ખુર્જા નગર પોલીસ મથકમાં સોમવારે સાંજે ટ્વીટર ઈન્ડિયાના એમડી મનિષ માહેશ્વરી સામે પહેલી એફઆઈઆર નોંધાઈ હતી.

## બિહાર અને મહારાષ્ટ્રમાં વીજળી પડવાથી 12નાં મોત, ભારે વરસાદથી પૂરની સ્થિતિ

બિહારમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી ૩૩૯ મીમી વરસાદ : સામાન્યથી ૧૩૯ ટકા વધુ

પટણા : બિહારના વિવિધ વિસ્તારોમાં વીજળી પડવાને કારણે કુલ ૧૧ લોકોનાં મોત થયા છે તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર પશ્ચિમ ચંપારણમાં ૩, પૂર્વ ચંપારણમાં ૩, પટણામાં બે, નાલંદામાં બે, માધેપુરામાં એક અને એક ઓરંગાબાદમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત વીજળી પડવાને કારણે પૂર્વ ચંપારણમાં ચાર લોકો ગંભીર રીતે



ઘાયલ થયા છે અને પટણા જિલ્લામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૩૯ મિમી વરસાદ પડ્યો

છે જે સામાન્ય કરતા ૧૩૯ ટકા વધારે છે. જેના કારણે ચાર જિલ્લાઓ પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ અને સારણમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ૮૦,૦૦૦ લોકોને અસર થઈ છે. જોકે પૂરગ્રસ્ત વિસ્તારોમાં કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મોબાઈલ નેટવર્ક બરાબર પકડાય તે માટે વૃક્ષ પર ચડેલા ૧૫ વર્ષના કિશોરનું વીજળી પડવાને કારણે મોત થયું છે અને અન્ય સગીરોને ઈજા થઈ છે.

## તાત્કાલિક પોર્નોગ્રાફિક કન્ટેન્ટ દૂર કરવા એનસીડબલ્યુએ ટ્વિટરને આદેશ આપ્યો

US કાયદો પણ ભારતીય કાયદા સાથે સુસંગત હોય તો જ ચાલશે: રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી

નેશનલ કમિશન ફોર વીમેન (એનસીડબલ્યુ)એ ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરને આદેશ આપ્યો છે કે તેઓ સત્તાહની અંદર આ પ્લેટફોર્મ પરથી દરેક પ્રકારના અભદ્ર કન્ટેન્ટ દૂર કરે. આ ઉપરાંત મોટી સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદેહિતા અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ટ્વિટરે તેમનું એકાઉન્ટ બ્લોક કરવા માટે યુએસ



કોપીરાઈટ એક્ટ લગાવ્યો હતો, પરંતુ આ કાયદો પણ ભારતમાં ત્યારે લગાવી શકાય જ્યારે તે ભારતીય કાયદા સાથે સુસંગત હોય. આ એનસીડબલ્યુની ચેરપર્સન

રેખા શર્માએ દિલ્હીના પોલીસ કમિશનરને પણ આ કેસની તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું હતું. એનસીડબલ્યુએ ટ્વિટર પર કેટલીક પ્રોફાઈલ્સમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટના પગલે આપમેળે જ પગલાં લઈ કાર્યવાહી શરુ કરી છે. ચેરપર્સન રેખા શર્માએ ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરને જણાવ્યું છે કે તે તાત્કાલિક અસરથી પોર્નોગ્રાફિક અને અભદ્ર કન્ટેન્ટ તેમના પ્લેટફોર્મ પરથી સત્તાહની અંદર દૂર કરે.

## ગાઝીપુર સરહદ પર ખેડૂતો અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી

નવી દિલ્હી

દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ વચ્ચે ભારે હંગામો થયો હતો. ખેડૂતો અને કાર્યકર્તાઓ બંને આમને સામને આવી ગયા હતા અને છુટ્ટાહાથની મારામારી થઈ હતી. ભાજપના કાર્યકર્તાઓ સૌથી પહેલા ગાઝીપુર બોર્ડર પર આવ્યા હતા, જ્યાં ખેડૂતો સાત મહિનાથી કૃષિ કાયદાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. જે બાદ ત્યાં હાજર ખેડૂતોની સાથે વિવાદ થતા બંને આમને સામને આવી ગયા હતા. એવા અહેવાલો છે કે ગાઝીપુર બોર્ડર પર ભાજપના એક

નેતાનું સ્વાગત કરવા માટે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, તે સમયે જ ખેડૂતોની સાથે બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિટ્ટેને આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓ અમારા મંચનો ઉપયોગ કરવા માગતા હતા, કેટલાક નેતાઓ મંચ પર આવી પણ ગયા હતા. જો તમારે અમારા મંચ પર આવવું હોય તો પહેલા ભાજપમાંથી રાજીનામું આપો. જો મંચ એટલો જ વડાલો હોય તો અમારા આંદોલનમાં સામેલ થઈ જાવ અને પક્ષને અલવીદા કરી દો.

## શ્રીનગરમાં એન્કાઉન્ટરમાં 2 અને પરીમપોરામાં 1 આતંકવાદી ઠાર મરાયો

શ્રીનગર

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સૈન્યના એન્કાઉન્ટરમાં લશ્કરે તોયબાના બે કમાન્ડર ઠાર મરાયા હતા. માર્યા ગયેલા પૈકી એક આતંકીનું નામ નદીમ અબરાર છે. જ્યારે શ્રીનગરમાં જ પરીમપોરા વિસ્તારમાં અન્ય એક કમાન્ડર પણ ઠાર મરાયો હતો. પોલીસે આ એન્કાઉન્ટરની વિગતો આપી હતી અને કહ્યું હતું કે માર્યા ગયેલો આતંકી અબરાર લશ્કરે તોયબાનો ટોપ કમાન્ડર હતો અને અનેક લોકોની હત્યામાં તેનો હાથ હતો. તેની ધરપકડ પરીમપોરા વિસ્તારમાં સોમવારે કરવામાં આવી હતી. લશ્કરે તોયબાના આ ટોપ કમાન્ડરે સ્વીકાર કર્યો હતો કે તેની પાસે એક-૪૭ રાઈફલ હતી અને અનેક હુમલામાં સેનો હાથ હતો.

## રાજ્યો એક મહિનામાં 'એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ' યોજના લાગુ કરે : સુપ્રીમ

નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩૧મી જુલાઈ સુધીમાં 'એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ' યોજના લાગુ કરવા આદેશ આપ્યો છે. આ યોજના હેઠળ ૮૦ કરોડથી વધુ લોકોને દેશના કોઈપણ ભાગમાં રાશન કાર્ડ મારફત ખાદ્યાન્ન લેવાની સુવિધા મળશે. સુપ્રીમે અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી મુદ્દે સરકારના ઉદાસીન અને બેદરકારીપૂર્ણ વર્તનને 'અક્ષમ્ય' ગણાવી કેન્દ્રની ઝાટકણી કાઢી હતી અને ૩૧મી જુલાઈ સુધીમાં આ કામ શરૂ કરવા આદેશ આપ્યો છે, જેથી



આ વર્ષના અંત સુધીમાં બધા જ પ્રવાસી કામદારોની નોંધણી થઈ શકે અને કોરોના મહામારીના મુશ્કેલ સમયમાં ગરીબો સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે. સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકારોને અન્ય અનેક દિશા-નિર્દેશ આપ્યા છે.

## કાશ્મીરમાં સતત ત્રીજી રાત્રે સૈન્ય સ્ટેશન પર ડ્રોન દેખાયા, PMએ બેઠક યોજી

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરમાં કાયર આતંકીઓ દ્વારા હવે સૈન્ય પર ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. અગાઉ જમ્મુ એરબેઝ પર બે ડ્રોન હુમલા થયા હતા, જેના બીજા દિવસે સૈન્ય કેમ્પ પર બે ડ્રોન દેખાયા હતા. હવે વધુ એક સૈન્ય સ્ટેશન પર ડ્રોન જોવા મળ્યા છે. જેને પગલે સૈન્ય એલર્ટ થઈ ગયું છે અને સમગ્ર મામલાની તપાસ શરુ કરી દેવામાં આવી છે. સાથે જ જમ્મુ એરબેઝ હુમલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. સતત ત્રીજી રાત્રે મંગળવારે ૧૨.૩૦ વાગ્યાથી લઈને સવારે ૪.૩૦ વાગ્યા વચ્ચે રત્નચક્ર, કાલ્પચક્ર મિલિટરી સ્ટેશનો અને સુંજવાં આર્મી બ્રિગેડ પાસે ડ્રોન જોવા મળ્યા હતા.



# ભારતીયોએ દુબઈમાં 12,100 કરોડની સંપત્તિ ખરીદી

કોરોના-19ના પ્રતિબંધો વચ્ચે પણ ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં દુબઈના રિયલ એસ્ટેટમાં 8000થી વધુ રોકાણકારો પ્રવેશ્યા

**મુંબઈ**

કોરોના મહામારીથી સમગ્ર દુનિયામાં ગંભીર આર્થિક અનિશ્ચિતા સર્જાઈ છે જો કે કેટલાંક લોકોએ આ તકનો લાભ લઈ નીચી કિંમતે મોટું મૂડીરોકાણ કરવાની તક ઝડપી લીધી છે. આવી કંઈક ધનિક ભારતીયોએ દુબઈના રિયલ એસ્ટેટમાં કર્યું છે. ભારતીયોએ કોરોના સંકટ વચ્ચે દુબઈના રિયલ એસ્ટેટમાં ૬ અબજ દિરહામની સંપત્તિ ખરીદી છે. ભારતીય ચલણમાં ગણતરી રીતે તો તેનું મૂલ્ય ૧૨,૧૦૦ કરોડ રૂપિયા જેટલું થાય છે. તો યુકેના રોકાણકારોએ



દુબઈના રિયલ્ટી સેક્ટરમાં ૨.૮ અબજ દિરહામ અને ચીનના લોકોએ ૧.૪ અબજ દિરહામનું રોકાણ કર્યું

છે એવી માહિતી દુબઈ સરકારના સિનિયર એડવાઈઝર મહમૂદ અલબુરાઈએ દિવટમાં જણાવી છે.

ધનિક ભારતીયોએ કોરોના સંકટકાળ વચ્ચે દુબઈમાં પોતાની માટે એક નવું ઘર ખરીદ્યું છે જેની પાછળ વ્યાપકપણે સરળ ટેક્સ-ફ્રેન્ડલી નિયમો અને રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ દ્વારા તાત્કાલિક રેસિડેન્ટનું સ્ટેટ્સ મળવું, એક આંતરરાષ્ટ્રીય સ્તરની જીવનશૈલી ઉપરાંત ભારતથી વધારે દૂર ન હોવું જેવા પરિબળોએ મોટી ભૂમિકા ભજવી છે.

ઉલ્લેખનિય છે કે, આ રેતાળ પ્રદેશમાં ઘર-મકાનો કંઈ સસ્તા નથી. લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, વીલા અને હોટલનો રૂમ પણ એક કરોડ રૂપિયાથી

લઈને ૨૦ કરોડ રૂપિયા સુધીમાં વેચાય છે.

દુબઈ ભારતથી ભૌગોલિક દ્રષ્ટિએ ઓછા અંતરે આવેલ હોવાથી ઘણા ધનિક ભારતીયો ત્યાં મકાન ખરીદવા આકર્ષાયા છે. રેસિડેન્સી વીઝા મેળવવા માટે મિલકતોમાં ઓછામાં ઓછા મૂડીરોકાણની રકમ ૧૦ લાખ દિરહામ (લગભગ ૨ કરોડ) છે. જે પોર્ટુગલ અને સ્પેનમાં રેસિડેન્ટ વીઝા પ્રાપ્ત કરવા માટે રિયલ એસ્ટેટમાં ૫ લાખ યુરો (લગભગ ૪.૪ કરોડ રૂપિયા)નું મૂડીરોકાણ કરવા કરતા ઘણું વાજબી છે એવું નિષ્ણાંતોનું કહેવું છે.

## અદાણીને ફરી ફટકો : નેટવર્થમાં ૧૭ દિવસમાં ૧૭ અબજ ડોલરનો ઘટાડો

**નવી દિલ્હી**

અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીની ૬ મુખ્ય કંપનીઓ પૈકી ૩ કંપનીઓના શેરના ભાવ સતત ગગડી રહ્યા છે. બુધવારે આ ગ્રૂપની બીજી કંપનીઓને પણ નુકસાન થયું હતું. જેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી રહી છે. એક મીડિયા ગ્રૂપના રિપોર્ટ પ્રમાણે અદાણીની નેટવર્થ હવે ૫૮.૭ અબજ ડોલર રહી છે. શેરના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાના કારણે તેમની નેટ વર્થમાં ૧૭ દિવસમાં ૧૭ અબજ ડોલરનો ઘટાડો થયો છે. રૂપિયામાં ગણીએ તો તેમની સંપત્તિમાં ૧.૨૮ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું

છે. જેના પગલે તેઓ દુનિયાના ટોપ ૨૦ ધનિક લોકોની યાદીમાંથી પણ બહાર નીકળી ગયા છે. રિપોર્ટ પ્રમાણે અદાણી ધનિકોના લિસ્ટમાં પહેલા ૧૯મા ક્રમે હતા. હવે તેઓ ૨૧મા ક્રમે જતા રહ્યા છે. અદાણી ગ્રૂપની તમામ ૬ કંપનીઓના શેરના ભાવમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં ૦.૯ ટકા, અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં ૫ ટકા, અદાણી ટોટલ ગેસના શેરોમાં ૫.૫ ટકા, અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ૧.૧૦ ટકા, અદાણી પોર્ટના શેરમાં ૧.૦૨ ટકા અને અદાણી પાવરના શેરમાં ૨.૭૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.

## 3592 કરોડની છેતરપિટીમાં મુંબઈ સ્થિત કંપનીની રૂ. 185 કરોડની સંપત્તિ ટાંચમાં ફોસ્ટ ઇન્ટરનેશનલ લિ., આર એસ બિલ્ડર્સ-પ્રમોટરો, ડાયરેક્ટરો સામે કેસ

**નવી દિલ્હી**

૧૪ બેંકો સાથે ૩૫૯૨ કરોડ રૂપિયાની છેતરપિટી આચરવા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુંબઈ સ્થિત કંપનીની ઈડીએ ૧૮૫ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ ફોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ અને તેમની ગ્રુપ કંપનીઓ ગ્લોબલ એક્ઝિમ પ્રાઈવેટ લિમિટેડ, એનએસડી નિર્મન પ્રાઈવેટ



લિમિટેડ અને આર એસ બિલ્ડર્સ તથા તેના પ્રમોટરોની સંપત્તિઓ ટાંચમાં લેવા માટે પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. કાનપુર, દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, કોલકાતા અને તમિલનાડુના

કેટલાક શહેરોમાં ૧૮૫ કરોડ રૂપિયાની સ્થિર મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને આધારે ઈડીએ પીએમએલએ હેઠળ કેસ દાખલ કર્યો છે. ઈડીએ જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમને મળેલા પુરાવાઓ પરથી સાબિત થાય છે કે ફોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ અને તેની ગ્રુપ કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

## વીજ ક્ષેત્ર માટે રૂ. 3.03 લાખ કરોડ અને ભારત નેટ માટે 19 હજાર કરોડને મંજૂરી

**નવી દિલ્હી**

વડાપ્રધાનના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. પાવર ડિસ્ટ્રિબ્યુશન રિફોર્મને મંજૂરી આપવામાં આવી છે. આ માટે ૩.૦૩ લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશના ગામ સુધી ઈન્ટરનેટ પહોંચાડવા માટે ૧૯ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.



આ મહત્વપૂર્ણ બેઠક અંગેની માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન જાવડેકરે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા નાણા પ્રધાન નિર્મલા સિતારમને ૬ લાખ ૨૮ કરોડના પ્રોત્સાહન પેકેજની

જાહેરાત કરી હતી. આ પેકેજને પણ આજે મંજૂરી આપવામાં આવી હતી. જાવડેકરે જણાવ્યું હતું કે નવેમ્બર સુધી ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ આપવામાં આવશે. આ માટે કેબિનેટે ૯૩૦૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે દરેક ગામ સુધી ઈન્ટરનેટ પહોંચાડવાનો સરકારે નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે ભારત નેટ પ્રોજેક્ટ માટે ૧૯ હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

## બોમ્બે હાઈકોર્ટ : ગુલશન કુમારની હત્યાના આરોપીની સજા યથાવત

**મુંબઈ**

બોમ્બે હાઈકોર્ટે ગુલશન કુમાર હત્યા મામલે સંકળાયેલી અરજ અંગે નિર્ણય સંભળાવી દીધો છે. તેમાં મરંના એક દોષિત અબ્દુલ રઉફ ઉર્ફે દાઉદ મર્યેન્ટની સજા અકબંધ રાખવામાં આવી છે. અબ્દુલ રઉફ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સાથી છે. સેશન કોર્ટે તેને ઉમર કેદની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, અબ્દુલ રઉફ કોઈ પણ જાતની ઉદારતાનો હકદાર નથી કારણ કે તે

પહેલા પણ પેરોલના બહાને બાંગ્લાદેશ ભાગી ગયો હતો.

ટી-સીરિઝ કંપનીના માલિક ગુલશન કુમારની ૧૨ ઓગષ્ટ, ૧૯૯૭ના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં હત્યા થઈ હતી. ગુલશન કુમારની મંદિર બહાર ૧૬ ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કેટલાક પર હજુ પણ કેસ ચાલી રહ્યો છે. જસ્ટિસ જાધવ અને જસ્ટિસ બોરકરે અરજ પર ચુકાદો સંભળાવ્યો હતો.



## ભૈયાજી જોશીને રામ મંદિર નિર્માણ પ્રોજેક્ટના નવા કેરટેકર બનાવ્યા

**નવી દિલ્હી**

થોડાક દિવસો પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે રામ મંદિર નિર્માણ માટે ટૂંકે ૨ કરોડ રૂપિયાની જમીન ૧૮ કરોડ રૂપિયાથી વધારેની કિંમત આપીને ખરીદી છે. આ વિવાદ સામે આવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS)કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. અત્યાર સુધી સંઘના સરકાર્યવાહ રહેલા ભૈયાજી જોશી મંદિર પ્રોજેક્ટના કેરટેકરની ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ ભૈયાજી જોશીની દેખરેખ હેઠળ ચાલશે. RSSની નજર ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર આ નિર્ણય સંઘમાં એનોપચારિક રીતે લેવામાં આવ્યો છે.

## જમ્મુ-કાશ્મીરમાં 'દરબાર મૂવ' પ્રથા બંધ, દર વર્ષે 200 કરોડની બચત થશે

**જમ્મુ કાશ્મીર**

જમ્મુ કાશ્મીરની બે રાજધાનીઓ શ્રીનગર અને જમ્મુ વચ્ચે દર છ મહિને થતી 'દરબાર મૂવ'ની ૧૪૯ વર્ષ જૂની પ્રથાને બંધ કરવામાં આવી છે. અત્યાર સુધી અહીં રાજભવન, સિવિલ સચિવાલય, દરેક મુખ્ય વિભાગોના વડાઓની ઓફીસ દરબાર મૂવ અંતર્ગત શિયાળામાં જમ્મુમાં અને ઉનાળામાં શ્રીનગરમાં ટ્રાન્સફર થતી રહેતી હતી. જમ્મુ-કાશ્મીર સરકારે બુધવારે કર્મચારીઓને ફળવવામાં આવતી રહેઠાણ ફળવણીને બંધ કરી દીધી હતી



અને જેઓને રહેઠાણો ફળવી દેવામાં આવ્યા હતા તેવા અધિકારીઓને ત્રણ અઠવાડિયાની અંદર સરકારી રહેઠાણો ખાલી કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

## પશ્ચિમ બંગાળ હિંસા સંદર્ભે કેન્દ્ર, રાજ્ય, ચૂંટણી પંચને નોટિસ

**નવી દિલ્હી**

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકાર, તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને ભારતના ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. અરજમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ એસઆઈટી દ્વારા કરાવવાની માંગ કરાઈ હતી. જસ્ટિસ વિનીત સરનની અધ્યક્ષતાવાળી બેંચે આ અરજ પર કેન્દ્ર, પશ્ચિમ બંગાળ સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, આમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં પીડિતો અને તેમના પરિવારો માટે વળતરની માંગ કરાઈ છે. આ અંગે સુપ્રીમ કોર્ટે નોટિસના જવાબ માટે આ તમામ પક્ષકારોને ચાર સપ્તાહનો સમય આપ્યો છે.





# ડેલ્ટાથી 96 દેશમાં ફફડાટ : આફ્રીકાથી દુનિયા પ્રભાવિત

ડેલ્ટા વેરિઅન્ટ જે ઈકોનોમી કોરોનાનાં આંચકામાંથી બહાર આવી રહી છે તેવી ઈકોનોમી માટે ફરી ખતરો : WHO

## જિનિવા

કોરોનાનો વધુમાં વધુ ખતરનાક ગણાતો ડેલ્ટા વેરિઅન્ટ હાલ ૯૬ દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. જ્યારે ૧૭૨ દેશો આફ્રીકા વેરિઅન્ટથી પ્રભાવિત છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં વડા ગેબ્રિયેસિસે જણાવ્યું હતું. આવનાર સમયમાં ડેલ્ટા વાર્ધરસ વધુ ખતરનાક બની શકે છે. બ્રિટનમાં નવા ૮૦ ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટથી પ્રભાવિત થયેલા છે. નિષ્ણાતોનાં મતે ડેલ્ટા વેરિઅન્ટ આફ્રીકા કરતા ૫૫ ગણો વધુ ખતરનાક છે. બ્રિટનનાં મળેલો આફ્રીકા વેરિઅન્ટ હાલ ૧૭૨ દેશમાં વકરી રહ્યો છે. WHO દ્વારા યુરોપનાં દેશોમાં

ત્રીજી લહેર ગમે ત્યારે આવી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે.

WHO એ કહ્યું હતું કે ડેલ્ટા વેરિઅન્ટ જે ઈકોનોમી કોરોનાનાં આંચકામાંથી બહાર આવી રહી છે તેવી ઈકોનોમી માટે ફરી ખતરો સર્જ શકે છે. આને રોકવા માટે અનેક દેશોએ ફરીથી પ્રતિબંધાત્મક આદેશો લાગૂ પાડવા જરૂરી છે. ભારતમાં જીવલેણ બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જવાબદાર માનવામાં આવે છે. WHOનાં માનવા મુજબ ડેલ્ટા વેરિઅન્ટ તેનું સ્વરૂપ ઝડપથી બદલી રહ્યો છે જે ભારત માટે વધુ ઘાતક પૂરવાર થઈ શકે છે. નવા સ્વરૂપને ડેલ્ટા પ્લસ નામ અપાયું છે.

## રશિયામાં કોરોના નવા 20,616 કેસ, 652નાં મોત

મોસ્કો : રશિયામાં અચાનક કોરોનાના કેસમાં અભૂતપૂર્વ ઊંચાણ આવતાં છેલ્લા 24 કલાકમાં રશિયામાં કોરોનાના 20,616 કેસ નોંધાયા છે અને 652 જાણના મોત થયા છે. રશિયામાં એક જ દિવસમાં નોંધાયેલા આ સૌથી વધારે મોત છે. રશિયામાં રસી લેનારાઓની સંખ્યા ઓછી હોવાથી આરોગ્ય કર્મચારીઓ હવે નવા કેસો અને મરણો સામે ઝગૂમી રહ્યા છે. રશિયાના સ્ટેટ કોરોના વાઇરસ ટાસ્કફોર્સે જણાવ્યું હતું કે દરરોજ સરેરાશ 20,000 કરતાં વધારે કોરોનાના નવા કેસો અને 600 કરતાં વધારે મોત નોંધાઈ રહ્યા છે. રશિયાના આરોગ્ય અધિકારીઓએ જુનની શરૂઆતમાં આવેલા કોરોનાના નવા મોજા માટે રશિયાનોની બેદરકારીને જવાબદાર ગણાવી છે.

## સાત દેશોએ કોવિશીલ વેક્સિનને આપી મંજૂરી

યુરોપિયન સંઘના 7 દેશોએ કોવિશીલ લીધી હોય તેવા લોકોને ટ્રાવેલ માટેની પરવાનગી આપી છે. જેમાં ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઈસલેન્ડ, આયર્લેન્ડ અને સ્પેને કોવિશીલ વેક્સિનનો સ્વીકાર કર્યો છે. ખાસ વાત એ છે કે એક જ દિવસ પહેલા ભારતે ઔપચારિક રીતે EUના સભ્યોને કોવિશીલ અને કોવેક્સિનને પાસપોર્ટ યાદીમાં સામેલ કરવાની અપીલ કરી હતી.

## UKએ 2020માં 56000 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા

### લંડન

યુકેએ ૨૦૨૦માં ૫૬ હજાર ભારતીય વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા છે. આમ તેમાં વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ ૧૩ ટકાનો વધારો થયો છે, એમ યુકેના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે બુધવારે જણાવ્યું હતું. ઈન્ડિયા ગ્લોબલ ફોર્મ પર ગ્લોબલ લીડરશિપ વીમેન ફર્સ્ટ: રેડિકલ એક્શન્સ ઈન ધ પોસ્ટ-પાન્ડેમિક એરાના સત્રને સંબોધી વખતે આ વાત કહી હતી. ગયા વર્ષે અમે ૫૬,૦૦૦ ભારતીયોને સ્ટુડન્ટ વિઝા જારી કર્યા હતા. સૌથી વધારે મહત્વની વાત એ

છે કે કોરોનાના રોગચાળાની વચ્ચે અમે વિઝા જારી કરવામાં ૧૩ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. પોસ્ટ સ્ટડી રુટનો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જે મુખ્યત્વે પોસ્ટ સ્ટડી વર્ક રુટ માટેનો છે. તેના દ્વારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રતિભાઓને યુકે લાવી શકાય છે. આ ફોરમમાં બોલતા કેન્યાના સ્પોર્ટ્સ, હેરિટેજ અને સાંસ્કૃતિક બાબતોના કેબિનેટ સેક્રટરી અમિના મોહમદે જણાવ્યું હતું કે યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-ફાઈવ જાતિલક્ષી સમાનતા તે રોગચાળાના એસડીજીના સૌથી અસરકારક પાસામાં એક છે.

## સીરિયા-ઈરાકમાં આતંકવાદીના અડ્ડા ઉપર અમેરિકન સૈન્યની એરસ્ટ્રાઈક

રાષ્ટ્રપતિ બિડેન દ્વારા મધ્યપૂર્વમાં બીજી વખત હવાઈ હુમલાનો આદેશ અપાયો

### વોશિંગ્ટન

અમેરિકાએ સોમવારે સવારે ઈરાક અને સીરિયામાં ઈરાન સમર્થિત બે આતંકવાદી જૂથોના ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી. પેન્ટાગોને જણાવ્યું હતું કે તાજેતરના સમાહોમાં અમેરિકાના કર્મચારીઓ પર ટ્રોન હુમલા થયા હતા, આ હુમલા ઈરાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, એમ સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ બિડેનની સૂચના મુજબ અમેરિકન લશ્કરી ઘણેએ



ઈરાક-સીરિયા સરહદી વિસ્તારમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથોના ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી, એમ પેન્ટાગોનના

પ્રવક્તા જોન એફ કિર્બીએ જણાવ્યું હતું. કિર્બીએ જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનો આ સગવડોનો ઉપયોગ કરતા હતા. તેમાં હીઝબુલ્લાહનો સમાવેશ થાય છે, એમ જોન એફ કિર્બીએ જણાવ્યું હતું.

કિર્બીએ જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત આતંકવાદ સંગઠન હીઝબુલ્લાહ અને સૈયદ અલ શુહાદા આ સ્થળનો ઉપયોગ તેમના શસ્ત્રો અને દારૂગોળાનો સંગ્રહ કરવા માટે કરતા હતા.

## ફ્લોરિડાની ધરાશાયી થયેલી ઈમારતનાં કાટમાળમાં હજુ ૧૫૦થી વધુ ફસાયા

ભારતીય મૂળનો પરિવાર પણ લાપતા : કાટમાળમાં ફસાયો હોવાની શક્યતા

### સર્કસાઈટ

ફ્લોરિડાના સર્કસાઈટ શહેરની ૧૨ માળની ઈમારત ધરાસાઈ થતાં હજુ ૧૫૦ જેટલાં લોકો લાપતા છે. અત્યાર સુધીમાં નવ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. મૃત્યુ આંક હજુ વધે તેવી દહેશત વ્યક્ત થઈ હતી. ભારતીય મૂળનો પરિવાર સહિત હજુ ૧૫૦ જેટલાં લોકોની કોઈ જ ભાળ મળી નથી. ભારતીય મૂળના વિશાલ પટેલ અને ભાવના પટેલ પણ આ બિલ્ડિંગમાં રહેતા હતા. આ દંપતી તેમની એક



વર્ષની દીકરી ઈશાની સાથે ઈમારત ધરાસાઈ થઈ ત્યારથી લાપતા છે.

બ્રિટનમાં રહેતાં તેમના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે બિલ્ડિંગ ધરાસાઈ થઈ એ વખતે તેઓ ઘરમાં જ હતા.

બિલ્ડિંગ ધરાસાઈ થઈ તેના સમાચાર મળ્યા ત્યારથી તેમને અસંખ્ય મેસેજ અને ફોન કર્યા છે, પરંતુ કોઈ જ જવાબ આવ્યો નથી.

આ પરિવાર સહિતના ૧૫૦ લોકો હજુ કાટમાળમાં ફસાયા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બચાવ ટૂંકડીએ પહેલા દિવસે જ ૧૦૦ જેટલાં લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પરંતુ બહુ જ અંદર ફસાયેલા લોકોને તુરંત બહાર કાઢવાનું કામ શક્ય બન્યું ન હતું.

## ફ્લાઈંગ કારનું સફળ ઉડ્ડયન



તાજેતરમાં જ એક ફ્લાઈંગ કારે બે એરપોર્ટ વચ્ચે સફળતાપૂર્વક ઉડ્ડયન કરી બતાવીને પરીક્ષા પાસ કરી લીધી છે. સ્લોવેકિયાની એક કંપનીએ 30 વર્ષની મહેનતથી આ ફ્લાઈંગ કાર વિકસાવી છે. તે ઘરની ઉપર ચાલી શકે છે અને હવામાં ઊડી શકે છે. તેમાં BMWનું એન્જિન છે જે પેટ્રોલથી ચાલે છે. ૨૫૦૦ મીટર ઊંચે કલાકના ૧૭૦ કિલોમીટરની સ્પીડે સળંગ ૧૦૦૦ કિલોમીટર સુધી ઊડી શકે છે. તેની પાંખો ફોલ્ડિંગ છે અને કારની બંને બાજુ ગોઠવાઈ જાય છે. બે મિનિટ ૧૫ સેકન્ડમાં પાંખો ખૂલીને વિમાન બની જાય છે.

## તાઈવાનમાં જુડો ક્લાસમાં 22000 કિમીની ઝડપે પૃથ્વી નજીક આવી રહ્યો છે બુર્જ ખલિફાના કદનો એસ્ટરોઈડ

### શાંઘાઈ

તાઈવાનમાં સાત વર્ષના બાળકને જુડો ક્લાસમાં તેના સીનિયરે ૨૭ વખત પટકતા તેનો જીવ જતો રહ્યો હતો. તેનો સીનિયર તેને સતત પટકી રહ્યો હતો ત્યારે તેનો કોચ તેને સતત પ્રોત્સાહન આપી રહ્યો હતો અને તેને વારંવાર પટકવા માટે કહેતો હતો. આ મામલાને લઈને સમગ્ર તાઈવાનમાં મોટાપાયે પર આકોશ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો બાળકને શ્રદાંજલિ આપવા સાથે કોચને સજા આપવાની માંગ કરી રહ્યા છે વાસ્તવમાં સમગ્ર મામલો એપ્રિલનો છે. જુડો ક્લાસમાં સાત વર્ષના માસૂમ બાળકને તેના સીનિયરે ૨૭ વખત પટકતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું.

### વોશિંગ્ટન

અમેરિકાની અવકાશી સંસ્થા નાસાએ ચેતવણી આપતા કહ્યું છે કે, 250 મીટરનું કદ ધરાવતો એક એસ્ટરોઈડ 22000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે. આ એસ્ટરોઈડ એક જુલાઈએ પૃથ્વીની ભ્રમણકક્ષાથી અત્યંત નજીક રહીને પસાર થશે. આ એસ્ટરોઈડ પર નાસા 2006થી નજર રાખી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો તેનું કદ બુર્જ ખલિફા ઈમારત જેટલું છે. નાસાનું કહેવું છે કે, સૌથી પહેલા તેની ઓળખ 2006માં થઈ



હતી. આ જ પ્રકારનો એક એસ્ટરોઈડ ગયા વર્ષે મે મહિનામાં ધરતી પાસથી પસાર થયો હતો. હવે બુર્જ ખલિફાના આકારનો એસ્ટરોઈડ હાલમાં 6.29 કિમી પ્રતિ સેકન્ડની ઝડપથી મુસાફરી કરી રહ્યો છે.

## અમેરિકામાં સ્પેલિંગ બી સ્પર્ધાના અંતિમ ૧૧ સ્પર્ધકોમાં ૮ ભારતીયો

### વોશિંગ્ટન

યુએસ સ્પેલિંગ બી સ્પર્ધાના અંતિમ ૧૧ સ્પર્ધકોમાં ૮ ભારતીય મૂળના અમેરિકનો છે. આ સ્પર્ધામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓનું પ્રભુત્વ રહ્યું છે. સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી ફાઈનલની ૮ જુલાઈના રોજ ફાઈનલ સ્પર્ધા યોજાશે. જેમાંથી ૮ ભારતીય મૂળના અમેરિકન હશે. સ્થાન મેળવનારામાં ૧૨ વર્ષીય રોય સેલિંગમેન, ૧૩ વર્ષીય ભાવના મેડિની, ૧૪ વર્ષીય શ્રીનાથ ગજુલા, ૧૪ વર્ષીય અશ્રિતા ગંધારી, ૧૩ વર્ષીય અવની જોશી, ૧૪ વર્ષીય ઝૈલા એવન્ટ, ૧૦ વર્ષીય વિવિન્શા વેદુરુ, ૧૨ વર્ષીય ધુરવ ભરતિયા, ૧૨ વર્ષીય વિહાન સિબલ, ૧૩ વર્ષીય અક્ષૈની કમ્મા, ૧૨ વર્ષીય ચૈત્ર થુમુમલાનો સમાવેશ થાય છે.





## વિમ્બલ્ડનમાં જોકોવિચનો સતત ૧૬મો વિજય

- » ઘટાલીના મારિયો બેરેટિનીએ ૧૩૯ મઘલ પ્રતિ કલાકની ઝડપે સર્વિસ કરી હતી.
- » જાપાનના કેઇ નિશિકોરીએ ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનને ૬-૪, ૬-૪, ૬-૪થી હરાવીને કારકિર્દીમાં ૧૦૦મો ગ્રાન્ડસ્લેમ વિજય મેળવ્યો હતો.
- » મરેએ બીજા રાઉન્ડના મુકાબલામાં ક્વોલિફાયર ઓસ્કર ઓટોને ૬-૩, ૪-૬, ૪-૬, ૬-૪, ૬-૨થી હરાવ્યો હતો.

લંડન: કેટલાક દિવસ પહેલાં ૧૩મી જૂને ક્લે કોર્ટ ઉપર કેન્ય ઓપનના કિંગ બનેલા નોવાક જોકોવિચે સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસનને સીધા સેટમાં ૬-૩, ૬-૩, ૬-૩થી હરાવીને ગ્રાસ કોર્ટ ઉપર રમાતા વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. તેણે વિમ્બલ્ડનમાં આ સતત ૧૬મો વિજય મેળવ્યો હતો. વિજય મેળવ્યો હોવા છતાં સિંબયન ખેલાડી ખુશ જણાતો નહોતો અને તેણે ઘણી વખત ગ્રાસ ઉપર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. ટૂર્નામેન્ટમાં સેરેના વિલિયમ્સ તથા ઓસ્ટ્રિયન મનારિનો ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયા છે.

## ઈજાગ્રસ્ત સેરેના વિલિયમ્સ વિમ્બલ્ડનમાંથી આઉટ

લંડન: અમેરિકાની અનુભવી ખેલાડી સેરેના વિલિયમ્સ બેલારસની એલેક્સાન્દ્રા સેસાનોવિચ સામે મંગળવારે પ્રથમ રાઉન્ડના મુકાબલામાં ઈજાગ્રસ્ત થયા બાદ ગ્રાસ કોર્ટ ઉપર રમાતા વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમમાંથી બહાર થઈ ગઈ હતી. કારકિર્દીના ૨૩માંથી સાત ગ્રાન્ડસ્લેમ ઓલ ઈંગ્લેન્ડ ક્લબ ખાતે જીતી ચૂકેલા સેરેના પ્રથમ સેટમાં સ્કોર ૩-૩થી સરભર હતો ત્યારે મુકાબલામાંથી બસી ગઈ હતી. સેરેનાએ મુકાબલાને અધવચ્ચેથી પડતો મૂક્યો હોય તેવો આ બીજો બનાવ છે. આ પહેલાં ૧૯૯૮માં પણ તેને ગ્રાન્ડસ્લેમમાંથી બસી જવું પડ્યું હતું. સેરેના કોઈ ગ્રાન્ડસ્લેમના પ્રથમ રાઉન્ડમાં જ હારી હોય તેવો આ બીજો બનાવ છે.



## તીરંદાજ વર્લ્ડ કપ સ્પર્ધામાં દીપિકા કુમારીએ રચ્યો ઇતિહાસ

સુવર્ણ ચંદ્રક જીતતાં વિશ્વની નંબર-૧ તીરંદાજ

નવી દિલ્હી ભારતની સ્ટાર મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ પેરિસ ખાતે ચાલી રહેલા તીરંદાજ વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપ સ્ટેજ ૩માં રિકર્વ વ્યક્તિગત સ્પર્ધા ૬-૦થી જીતીને સુવર્ણ પદકની પોતાની હેટ્રિક પૂરી કરી છે. આ વિજય સાથે જ દીપિકા કુમારી વિશ્વની નંબર-૧ મહિલા તીરંદાજ બની ગઈ છે.

સોમવારે વર્લ્ડ આર્ચરી તરફથી સત્તાવાર ટૂવીટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, દીપિકા કુમારીએ વિશ્વ તીરંદાજમાં પહેલી રેન્ક હાંસલ કરી છે. દીપિકા કુમારીએ પહેલા અંકિતા ભક્ત અને કોમાલિકા બારી સાથે મહિલા રિકર્વ ટીમ સ્પર્ધામાં મેક્સિકોને સરળતાથી હરાવીને સુવર્ણ પદક જીત્યો હતો. ત્યાર બાદ તેમણે પોતાના પતિ અતાનૂ દાસ સાથે ૦-૨થી પાછળ રહ્યા બાદ નેધરલેન્ડના સેફ વાન ડેન અને ગૈબ્રિએલાની જોડીને ૬-૩ના અંતરથી હરાવીને ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું હતું. ત્યાર બાદ રાંચીની રાજકુમારીએ રશિયાની ૧૭મી રેન્ક પ્રાપ્ત એલિના ઓસીપોવાને ૬-૦ના અંતરથી હરાવીને સુવર્ણ પદક જીત્યો હતો. દીપિકાના ઓવરઓલ પદકોની વાત કરીએ તો ૯ સુવર્ણ, ૧૨ રજત અને ૭ કાંસ્ય પદક જીતવામાં સફળ રહી છે.

વિશ્વ તીરંદાજ દ્વારા સોમવારે નવું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દીપિકાને પહેલું સ્થાન મળ્યું છે. કુમારીએ બીજી વખત તીરંદાજમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. રાંચી સાથે જોડાયેલી ૨૭ વર્ષીય દીપિકા કુમારીએ ૨૦૧૨માં પહેલી વખત તીરંદાજમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. રવિવારે દીપિકાએ વ્યક્તિગત અને મિશ્રિત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

સાનિયા મિર્ઝા અને બેથેનીએ અપસેટ સર્જ્યો ભારતની સાનિયા મિર્ઝા અને તેની અમેરિકન સાથીદાર બેથેની મેટ્ટકે સેન્ટુસે વિમ્બલ્ડન વિમેન્સ ડબલ્સના મુકાબલામાં છટ્ટી ક્રમાંકિત ડેબિયુ અને એલેક્સ ગુરાચીને ૭-૫, ૬-૩થી હરાવી હતી.

## એલને બાર્ટી અને કોકો ગોફ બીજા રાઉન્ડમાં

વિશ્વની નંબર-૧ મહિલા ખેલાડી એથ્લે બાર્ટી અને ૨૦મી ક્રમાંકિત કોકો ગોફ પણ બીજા રાઉન્ડમાં પહોંચી હતી. બાર્ટીએ સ્પેનના કાર્લા સુઆરેઝ નવારોને ૬-૧, ૬-૦ (૧-૦), ૬-૧થી હરાવી હતી. અમેરિકન ખેલાડી ગોફે ફ્રાન્સિસ્કા જોન્સને ૭-૫, ૬-૪થી, માર્ટિનાકોવાએ ૨૮મી ક્રમાંકિત એલિસન રિસ્કેને ૬-૨, ૪-૬, ૬-૧થી, ૨૫મી ક્રમાંકિત એન્જલિક કેબરે સ્તોજાનોવિચને ૬-૪, ૬-૩થી, જેસિકા પેગુલાએ કેરોલિના ગ્રાસિયાને ૬-૩, ૬-૧થી પરાજય આપીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.

## મહિલાઓની ૧૦૦ અને ૨૦૦ મીટરની રેસમાં દુતી ચંદ ભાગ લેશે



પટિયાલા: ભારતીય એથલીટ દુતી ચંદે મહિલાઓની ૧૦૦ અને ૨૦૦ મીટરની રેસમાં ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. દુતીને વર્લ્ડ ચેમ્પિયને આધારે ટોકિયો ગેમ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુતી ૧૦૦ મીટરના વર્લ્ડ ચેમ્પિયનમાં ૪૪મું સ્થાન અને ૨૦૦ મીટરમાં ૫૧મું સ્થાન છે. પટિયાલામાં ચાલી રહેલી ઈન્ટર સ્ટેટ એથલેટિક્સમાં દુતીએ ભાગ લીધો હતો. જોકે તે ક્વોલિફાઇંગ ટાઇમને આધારે ટોકિયો ઓલિમ્પિકમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.

## ગોલ્ડર અદિતી અને ડિક્સર શ્રોઅર સીમા ઓલિમ્પિકમાં ક્વોલિફાય


નવી દિલ્હી : ભારતીય ગોલ્ડર અદિતી અશોક અને ડિક્સર શ્રોઅર સીમા પુનિયા ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ગયા છે. અનિર્બાન લાહિરી અને ઉદયન માને બાદ અદિતી ટોકિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયેલી ભારતની ત્રીજી ગોલ્ડર છે. તે સતત બીજા ઓલિમ્પિકમાં ભાગ લેશે. જ્યારે ૩૭ વર્ષની સીમા પુનિયાએ ઈન્ટર સ્ટેટ એથલેટિક્સમાં ૬૩.૭૦ મીટરના ડિક્સર શો સાથે ૬૩.૫૦ મીટરના ઓલિમ્પિક ક્વોલિફાઇંગના માપદંડને પાર કર્યો હતો.



## ભારતીય સ્વિમર શ્રીહરિ નટરાજ પણ ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેશે

નવી દિલ્હી: સર્જન પ્રકાશ બાદ ભારતીય સ્વિમર શ્રીહરિ નટરાજે પણ ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. શ્રીહરિ નટરાજે રોમમાં યોજાયેલી સેન્ટે કોલી સ્વિમિંગ ટ્રોફીની ૧૦૦ મીટર બેકસ્ટ્રોકની ઈવેન્ટમાં ૫૩.૭૭ સેકન્ડનો સમય આપ્યો હતો. જેને સ્વિમિંગની સર્વોચ્ચ સંસ્થા ફિનાએ માન્યતા આપતાં શ્રીહરિએ ટોકિયો ગેમ્સમાં પ્રવેશ મેળવી લીધો છે. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ દિવટ પર આ અંગેની જાહેરાત કરી હતી.

## જાપાને મુકેલા નિયંત્રણોથી બચવા બોક્સર મેરી કોમ ઈટાલી પહોંચી જશે



નવી દિલ્હી: જાપાનીઝ સરકારે ભારત સહિતના ૧૧ દેશોમાંથી ટોકિયો ઓલિમ્પિકમાં રમવા માટે આવનારા ખેલાડીઓ માટે કોરોનાના ટેસ્ટિંગથી માંડીને ક્વોરન્ટાઇનના કડક નિયમો અમલમાં મૂક્યા છે. પરંતુ ખેલાડીઓ વિદેશમાં તાલીમ લેતા હોય અને સીધા જ ટોકિયો પહોંચવાના હોય તો તેમને નિયમો-નિયંત્રણો લાગુ નહીં પડે. જેના કારણે ભારતીય બોક્સર મેરી કોમે ઈટાલી જવાનો નિર્ણય લીધો છે.

## ખેલ રત્ન માટે અશ્વિન, મિતાલી રાજ, સુનિલ છેત્રી અને નીરજ ચોપરા નોમિનેટ

નવી દિલ્હી ભારતીય ક્રિકેટર આર. અશ્વિન અને મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજની સાથે સાથે ક્રૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી, એથલીટ નીરજ ચોપરા અને ટેબલ ટેનિસ સ્ટાર શરથ કમલનું નામ દેશના સર્વોચ્ચ રમત એવોર્ડ - રાજ્ય ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. શૂટિંગમાં આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા અંજુમ મુદગીલ અને અંકુર મિત્તલ તેમજ તીરંદાજમાં જ્યોતિ સુરેષા વેત્રામના નામ પણ ખેલ રત્ન એવોર્ડ માટે મોકલવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહ, શિખર ધવન અને લોકેશ રાહુલના નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યા છે. ભારતીય ક્રૂટબોલ ફેડરેશને સુનિલ છેત્રીને ખેલ રત્ન અને બાલા દેવીને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ



કર્યા છે. જ્યારે ગેબ્રિયલ જોસેફના નામની ભલામણ દ્રોણાચાર્ય એવોર્ડ માટે કરવામાં આવી છે. ગોલ્ડર શુભંકર શર્મા, શરથ કમલને ખેલ રત્ન એવોર્ડ આપવાની ભલામણ કરી છે. જ્યારે ગુજરાતના માનવ ઠક્કરની સાથે ઐહિકા મુખર્જી અને સુનીયા મુખર્જીને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે. ઈલાવેનિલ વાલારિવન અને અભિષેક વર્માનું નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.

### SHIV FINANCIAL SERVICES

VISITOR TO CANADA AND NEW IMMIGRANTS INSURANCE

Personal Tax - File is Free For New Immigrants.

**Full Time Service Provider**

Serving Community Since 2009

- Life Insurance, Critical Illness Insurance & Mortgage Insurance with Money Back Option
- Health & Dental Plan
- Segregated Fund • Personal Tax-file

\* અમે બધી ટોપની ઈન્સ્યુરન્સ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. \* New Life Insurance Advisors are recruited.

::: For Free Quotation & Consultation :::

Supervisa Insurance Monthly Plan Available

જગદીશ સેવક

(Financial Advisor)

Cell: 647-236-7620

SHIV FINANCIAL SERVICES

"Proper insurance coverage is Peace of Mind"

Email: sevak\_2007@hotmail.com

www.shivfinancialservices.ca

GUARANTEED LOWEST PREMIUM



**Dr. Salim Kapadia** DDS

Dental Centre

SK

Your Perfect  
Smile...Is Our Greatest  
Satisfaction!**SERVICES**

- Smile Makeover
- Laser Teeth Whitening
- Dental Implants - Start to Finish
- Single Visit Root Canal
- Re-treatment of Failing Root Canal
- Surgical Wisdom Teeth Extraction
- Scaling & Root Planing
- White Tooth Colored Filling
- Implant Retained Dentures
- Complete & Partial Dentures
- Lumineers & Veneers
- Crown & Bridges (Zirconia & E.max)




1825 Markham Rd, Suite 102  
Scarborough, ON M1B 4Z9  
drsalimkapadiadental.com

**416-321-3268****વાસ્તુશાંતી પૂજા-યજ્ઞ****વેદોક્ત પદ્ધતિથી સંપૂર્ણ વાસ્તુ શાસ્ત્રથી વાસ્તુ શાંતિ પૂજા યજ્ઞ**

ઘર પૂજા સ્થાન છે. ઘરમાં જ સ્વર્ગ છે. ઘરમાં જ શાંતિનો આધાર છે. અને ઘરમાં જ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ છે. પરંતુ જો આ બધી શ્રેષ્ઠતા આપનાં ઘરમાં ના હોય તો ઘરનાં કહેવાય તેને નર્ગ કહેવાય તો આપના નવા ઘરને સ્વર્ગ બનાવવા માટે સચોટ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી વાસ્તુશાંતિ યજ્ઞ થવો જરૂરી છે. કારણ કે જ્યારે નવા ભવનનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે તેના ભૂગર્ભમાંથી ખોદકામથી આઠ વસ્તુઓ દોષ યુક્ત નિકળે છે તદઉપરાંત નર-અને પશુના અસ્થિ નિકળવાથી ભૂમિદોષ લાગે છે જેનાથી ઘર સ્વર્ગ નહિ પરંતુ નર્ગ બની સ્મશાન જેવું થઈ જાય છે. આવા અશુભ દોષનાં નિવારણ માટે વાસ્તુ શાંતિ યજ્ઞ કરાવવો.



કથા, વાસ્તુ, બેબીશાવર, ગૃહપ્રવેશ, નવચંડી, લઘુરુદ્ર, રુદ્રી પાઠ, ચંડીપાઠ દરેક પ્રકારના હવન અને પૂજા વિધિ કરાવનાર, જન્માક્ષર બનાવવા તથા જોવડાવવા માટે મળો

**શાસ્ત્રી મિલનભાઈ ત્રિવેદી આણંદ (બોરસદ) ગુજરાત વાળા****Mobile : 647 770 5984**

॥ શ્રી ગણેશાય નમઃ ॥

**આપની દરેક સમસ્યાનું સમાધાન સાધના અનુષ્ઠાનથી કરાવવામાં આવશે****સચોટ અને શાસ્ત્રોક્ત જ્યોતિષ સલાહ અને નિદાન-વિધાન**

નવા, જનમાક્ષર બનાવવા અને જોવડાવવા, કુંડળીમેળાપ, કાલસર્પદોષ, ગ્રહણદોષ પિતૃદોષ, શનીપનોતી, લગ્નયોગ, મકાન-યોગ, ગુપ્તરોગ, દેવુમુક્તિ, શિગ્રવિવાહ, શિગ્રનોકરી પ્રાપ્તિ, બાળકોના ભણવા માટે વિદ્યા યોગ, વિદેશગમન યોગ તથા આપની કોઈપણ ગુપ્ત સમસ્યા, ગુપ્ત રોગ, ગુપ્ત શત્રુનિવારણ માટે મળો. શું આપના બાળકો પુત્ર-પુત્રી ગલત માર્ગથી પાછા વાળવા માંગો છો, શું આપના ઘર પરિવાર ઉપર કોઈએ મેલી વિદ્યા કરેલ છે, શું આપના ઘરમાં હંમેશા લડાઈ-ઝઘડા થાય છે, શું આપનો ભાગ્યોદય થવામાં વિલંબ થાય છે. શું આપના ઘર પરિવાર ઉપર કોઈક સંમોહન વશીકરણ કરેલ છે. શું આપ હંમેશા કોઈ મોટી બિમારીના શિકાર છો તેનો ઈલાજ કર્યા છતાં પણ તેનું નિવારણ નહિ થતું, શું આપનાં વ્યાપાર ધંધાને લગતી કોઈ સમસ્યા છે તો આવી જીવનની દરેક સમસ્યાનાં નિવારણ માટે આજેજ અમારી મૂલાકાત લો અને સચોટ શાસ્ત્રોક્ત વિધાનથી સમસ્યાનું નિવારણ કરાવો.

દરેક પ્રકારના ગ્રહોના નંગ, ચંત્રોગ, સ્ફટિકની માળા, શિવલિંગ, ઘોડાની નાળ, શિયાળાસિંગિ, હથ્થા જોડી, વૈજંતીબિજની માળા, મુંગાની માળા, રુદ્રાક્ષ માળા, મેરુપૃષ્ઠ શ્રી યંત્ર, ગોમતીચક્ર દરેક વસ્તુવિધી કરેલ પ્રાણપ્રતિષ્ઠત વાળી મળશે.

